

## સુવાસ કાર્યાલયના નિયમો

‘સુવાસ’ દરેક અંગ્રેજ મહિનાની પાંચમી તારીખે પ્રગટ થશે.

આરમી તારીખ સુધીમાં અંક ન મળે તો વડોદરા-એસિસના સરનામે ફરિયાદ કરવી. નમુનાનો અંક મંગાવનારે પાંચ આનાની ટિકિટ ભોડવી.

‘સુવાસ’માં પ્રગટ થતા દરેક લેખના લેખકને લેખની ચોષ્ટતા પ્રમાણે પાના ઢીડ રૂ. ૦૦ થી ૧ સુધી આપવામાં આવશે. આવો પુરસ્કાર સ્વીકારવા સામે જેમને વાંધો ન હોય તેમણે પોતાનો લેખ મોકલતી વખતે તે લેખના હાંસિયામાં ‘પુરસ્કાર’ શબ્દ લખવો. લેખકને તેમનો લેખ પ્રગટ થયા પણ પુરસ્કાર મોકલી દેવામાં આવશે. પણ લેખકને ‘સુવાસ’ના ગ્રાહક ગણી તેમને મળતા પુરસ્કારમાંથી તેમનું ગ્રાહકપદ ચાલુ રહી શકે એટલું વળતર જરૂરી ગણુણાશે. દરેક લેખકને તેના લેખની પાંચ ‘આઉટ ઓફિન્ટસ’ ગોકલાશે.

તલસ્પર્શી, ને ભાષાશુદ્ધિ ને કલાપૂર્વક આલેખાયલા સુવાચ્ય લેખો માટે ‘સુવાસ’માં ઉચ્ચિત સ્થાન છે. જોઉણી સંબંધમાં લેખકાણે ગુજરાત-વિદ્યાપીડના ડ્રાશને અતુસરવું. અશુદ્ધ લેખો માટે અસ્વીકારનો લય કાયમ રહેશે. સ્વીકાર્ય લેખાની એક આદવાડિયાની અંદર પહોંચ આપવામાં આવશે; અસ્વીકાર્ય ને અમૃતપૂર્વક આલેખાયલા લશો તો તે ઉચ્ચિત નોંધ સાથે તે જ સુદૂરમાં પાછા મોકલવામાં આવશે. તે સિવાયના લેખો ને લેખકો ટપાલ ખર્ચ મોકલી એક માહનાની અંદર પાછા નહિ મંગાવી લેં તો તે રદ કરવામાં આવશે.

તરતમાં પ્રગટ થયેલ અન્ધોને અને ‘ગ્રન્થ પરિચય’માં સ્થાન આપીશું. તે સિવાયના અન્ધોની ડેવણ નોંધ જ લેવાશે.

‘સુવાસ’ સંબંધી પત્રવ્યવહાર કરતી વખતે પોતાનું નામ અને સરનામું પૂરેપૂરે લખવું.

‘સુવાસ’ને લગતો અધ્યો પત્રવ્યવહાર નીચેના શરનામે કરવો—

## સુવાસ કાર્યાલય • રાવપુરા • વડોદરા

### ૧: થોડાક અલિપ્રાયો :—

.....દરેક પુસ્તકાલયમાં આ પુસ્તક હોંઠ જ નેટએ એટલું જ નહિ પરતુ તે વિશેષ વંચાય એવી પેણી મંગાવોણી એટલું નહિએ....

### “પુસ્તકાલય” માસિક (વડોદરા)

.....આવાં પ્રણ ડિપ્યોગીની પુસ્તકને રાન્ધે અને ડિપ્યોગીના પ્રચાર માટે ડલ્લી થયેલી સંસ્થાએ ક્રેનેજન આપી, આમ ડિપ્યોગને સંજીવન કરવામાં સાથ અને સહકાર આપવો નેછાએ....

### “આમ જીવન, સહકાર્ય અને જેતી” માસિક. (વડોદરા.)

.....ધર ગણ્ય હુનરોનાં આ જલનાં દેખાતો પુસ્તકો આપણે ત્યા ધણ્યાં બહાર પડયાં છે, અને હુલ યે જમે તેવી નહેરતીનાં ચોકડાં સાથે બહાર પડરો, પરતુ આ પુસ્તકની વિશેપતા તેમાં સુકેલા પ્રયોગો જ માત્ર નથી. પણ જુદા જુદા વિષયોના સારા અનુભવી લેખકો પાસે લખાવેલા લેખાને સંગ્રહીને આ પુસ્તકને વિવિધતા ભર્યું બનાવવામાં આવ્યું છે તે છે....

### “રવિવાર” સાપેતાહિક. (સુંપથ.)

.....આંતું શાખાયી પુસ્તક એ રિપિયાની કિંમતે મળે એ ખરેખર સરસું જ લેખાયશે....

### “કમર” માસિક. (સુરત)

સુંપથ પ્રાંતના ડેળવણી આતાએ અને વડોદરા રાજ્યે પુસ્તકાલયો માટે મંજુર કર્યું છે.

ધર ઘેઠાં પૈસા કમાવા મંગાવો ?

## નક્કારક હુનરો

### ભાગ પહેલા

નિષ્ણાતો અને અનુભવીઓએ લખેલા

વિવિધ હુનરોથી ભરપુર પુસ્તક જેની ઉત્તમતા વિષે અનેક સુપ્રસિદ્ધ પત્રોએ સારામાં સારા અલિપ્રાયો આપ્યા છે.

ઉમદા એંટીક કાગળ અને સુંદર છપાઈ છતાં કિંમત માત્ર ર રૂપીએ, ટપાલ ખર્ચ માઝ. મળવાનું ડેકાણું :—

## શ્રી લક્ષ્મી પુસ્તકમાળા

પોસ્ટ સીનુગરા, (અંંબર-કાંદી)

## બાળક કોઈ પણ પત્ર સાથે જોડાયેલું નથી

સ્વ	બાળક માસિક બાળકો માટેજ પ્રગટ થાય છે. સાહી ને
ત	શ્રીધી લાખા હોઠ આજના પ્રોફ શિક્ષણના જમાનામાં
ન	અક્ષરજ્ઞાનની શરૂઆત કરનારાઓને તેમાંથી કંઈ કંઈ
રીત	મળી રહેશે.
૧૭	ઇતાં લિવાજમ વરસના ઇક્તા ઝ્રિપિયા એ
વરસ	તમારી સંસ્થા કે ઘરમાં
થી	અવર્થય હોવું જેઠાચે, કેમકે નિર્દ્દીષ બાલુડા બાળક
પ્રગટ	વાંચવા ધણું આતુર હોય છે :
થાય	નવા વરસથી ધણો ફેરફાર જણાશે.
છે	‘બાળક’ કાર્યાલય, રાવપુરા-વડોદરા.

‘સુવાસ’ હરેક સંસ્કારી સ્વી પુરસ્કારનું જીવનકૂલ છે.

## એકાર દુનિયાને મહાન આર્થિર્વાદ

સ્વતંત્રગણે જીવન ગણનું હોય  
આરામથી જીવન ગુલરતું હોય  
કોઈના તાખેદાર ન રહેલું હોય  
—: અને :—  
વગર પૈસે વેપાર કરવો હોય તો  
છાયા ટેક્સરીંગ કાલેજમાં  
આજેજ દાખલ થાય, અને શીવળું તથા  
વેતરણું શીખી દો.

વેતરણામના શિક્ષણ માટે ‘માસ્ટર કટર’  
અથવા ‘હેમટેક્સર’ કિંમત: રૂ. ૨-૧૨-૦  
પેસ્ટેજ ૦-૭-૦ પરદેશ શિક્ષણ રૂ.

છાયા ટેક્સરીંગ કાલેજ-વડોદરા.

તા. ક. સવા આનાની ડિઝિટ બીડી સુચિપ્રન  
મંગાવો.

# સ્ત્રી ઉપયોગી પુસ્તકો

સ્ત્રીશક્તિ બ્રંથમાળા

૧ વંધ્યા	૦-૪	૩૬ માતૃપ્રેમ	૦-૪
૨ કોડી	૦-૩	૩૭ પારસી લગ્નગીતો	૦-૬
૩ ક્રિયદામાં ર્વીનું સ્થાન	૦-૩	૩૮ સંતતિનિયમન	૦-૮
૪ અર્ધીગના (વાતો)	૦-૩	૩૯ વહેમી પતિ	૦-૩
૫ ગૃહબ્યલસ્થાની વાતો	૦-૬	૪૦ આરોગ્ય અને સુખ	૦-૬
૬ અંયણાં (લોકગીત)	૦-૫	૪૧ સામાજિક વાતો	૦-૫
૭ અલિદાન (પ્રેરક ગીતો)	૦-૫	૪૨ રમુજ વાતો	૦-૪
૮ ભવાટીની	૦-૪	૪૩ ભલી ભાલી	૦-૧
૯ મા (વાતો)	૦-૪	૪૪ પતિ પ્રલુદ્	૦-૧
૧૦ જ્યાના પત્રો (કસોટીમય લગ્ન)	૦-૬	૪૪ માંદગી અને માવજત	૦-૪
૧૧ પતિનો પસંદણી	૦-૪	૪૬ વાતનું વતેસર	૦-૧
૧૨ લીલીની આત્મકથા	૦-૩	૪૭ ધરેણુંનો શોભ	૦-૧
૧૩ ફેઝ્	૦-૪	૪૮ પારસી સતીઓ	૦-૬
૧૪ પારસી વાતાનો	૦-૬	૪૯ એકાદશી	૦-૧૧
૧૫ વિધવા (વાતો)	૦-૫	૫૦ રાખુંકેવી	૦-૧૨
૧૬ ડોને પરણું ? (વાતો)	૧-૪	૫૧ શિવાળી બા	૦-૧૦
૧૭ સુધડતા અને સુંદરતા	૦-૮	૫૨ સાસુની શિખામણુ	૦-૧
૧૮ હાસ્યનો કુવારો	૦-૮	૫૩ કાયમનું અગ્રાન	૦-૧
૧૯ કુતના લદ્ડા (વાતો)	૧-૧૨	૫૪ નામ વગરની નવલકથા	૧-૮
૨૦ વિષવૃક્ષ (વાતો)	૧-૮	૫૫ નારી અભિષેક	૦-૪
૨૧ હાસ્યકલાપ (રમુજ)	૧-૮	૫૬ માસિક ધર્મ	૦-૨
૨૨ દેવી ચૌધરાણી	૧-૮	૫૭ નવા સાથિયા	૦-૧
૨૩ વીર રોજા (કાળું ગુલાબ)	૧-૦	૫૮-૫૯ વીર તારા (એ ભાગ)	૨-૪
૨૪ હાસ્ય જરણા (રમુજ)	૧-૮	૬૦ ગોરમાનાં ગીતો	૦-૧
૨૫ “જરા ચાહ મુક્ને”	૧-૦	૬૧ મેડમ તેમીડા	૦-૧૨
૨૬ ગરાવળી (રાષ્ટ્રીય)	૦-૪	૬૨ સામાજિક વાતો	૦-૩
૨૭ જીવનપલટો (વાતા)	૦-૪	૬૩ ગુણીયલ ગૃહિણી	૦-૧
૨૮ સુખી ઘર (બોધક)	૦-૩	૬૪ ર્વી સ્વાતંત્ર્ય	૦-૧
૨૯ લરત ગૂંઘણુ	૦-૧૦	૬૫ દક્ષિણી રંધણુકળા	૦-૩
૩૦ ચોર્યોસોનું ચચ્છર	૦-૫	૬૬ સતી જસમા	૦-૬
૩૧ રાજીવા બેગમ	૦-૩	૬૭ સંસારદર્શન	૦-૬
૩૨ ગૃહ વિવેક	૦-૬	૬૮ ભૂમિમાતા આનંદમઠ	૧-૦
૩૩ સુખીના પત્રો	૦-૮	૬૯ આળવિધવા	૦-૨
૩૪ સ્ટવનું શાખ	૦-૩	૭૦ સાચાં સહેદર	૧-૮
૩૫ ઓં છદ્ય	૦-૩		

સ્ત્રીશક્તિ બ્રંથમાળાનો આખ્યા સેણ આજેજ વસાવો. કુલ ૭૦ પુસ્તકો.  
ખાંડાર પરયાં છે. તે દા. ઉરમાં મળે છે. પુસ્તકો છુટાં પણ મળી શકશે. નૂર જૂડી.

દાખો: સ્ત્રીશક્તિ, ડેળાંપીઠ, સુરત

## કેટલાક અભિપ્રાયો

‘સુવાસ’ પોતાની ઉચ્ચ કોટિ હજુ સુધી સાચવી રહ્યો છે. તેના અગ્રલેખો ખરેખર ચિત્તનશીલ અને કાલ્પનિક લરેલા હોય છે.

—રમણુલાલ વસ્તુતાકાશ દેસાઈ

દેખો એકદિન સારા ..... અભ્યાસપૂર્વક લખાયલા છે.

—અરદેશર પ્રરામજી અખરદાર

વડોદરેથી એક વર્ષથી પ્રગટતા આ ઉચ્ચગ્રાહી માસિકનો ચૈત્ર-૧૬૬૫નો અંક શ્રીમદ્ હૃમયન્દ્રાચાર્ય વિશેષાંક તરીકે નીકળ્યો છે.... જેવા સુલેખડાનાં ઉપયોગી વિચારણીય લખાણો તાં ‘ત્રી... મેળવી શક્યા છે એ આનંદનો’ વિષય છે. હૃમણીએ ધીએ કે શિક્ષિત ગુજરાત ‘સુવાસ’ જેવા સત્પ્રયાસને આવકારે, પોષે અને સંપૂર્ણ સુવિકાસની તક આપે.

—માનસી

ગુજરાતને એક સારું માસિક મળું હોવાનો સંતોષ થાય છે.

—જન્મભૂમિ

એ વિશિષ્ટ પ્રકારનું સ્થાન સાહિત્ય-જગતમાં મેળવશે એવી આશા બંધાય છે.

—ચુલ્હા

આ નેવા ફાલ અન્ય સામયિકો જેમ ખાલી નજીર કરી હુંકા હેવા જેવો નથી. ‘ધ્યાનામા તથા ગુણ્ણા’ની જેમ ખાસ વાંચવા જેવું છે.... લેખાની શૈલિ જિતમ કલાપૂર્વક નવી છે. ખાસ મહત્વતા ભાષાશુદ્ધ અને જોડબુની આપેલી છે.

—ઘેલીબાડી વિજ્ઞાન

‘સુવાસ’નું ધોરણ આમ વધુ વ્યાપક બનતું જથ છે તે જોઈ આનંદ થાય છે ... તેના સંચાલકોને ધન્યવાદ છે.... આ પદ્ધતિનો બધાં સામયિકોઓણા સ્વીકાર કરે તો? અત્યારે કચરાની ટોપલીમાં નાખવા જેવું સાહિત્ય પ્રસિદ્ધ થાય છે, તે નજ થવા પામે.

—ગુજરાતી

તેમાં પીરસાયલી વિવિધજાતની વાતનીઓ સાહિત્ય-પ્રેમીઓને સારો ખોરાક પૂરો પાડે છે.

—ક્ષણિય ચિત્ર

સામગ્રી સંતોષપ્રદ છે.

—પુસ્તકાલય

વિદ્યાલયેલા દેખો, વિચારણીય સાહિત્યસામગ્રીથી આ માસિક વડોદરાના બંધ પડેલા સાહિત્ય માસિકની જોટ પૂરશે એવી આશા બંધાય છે.

—ખાળક

જીવન, કલા, સાહિત્ય વગેરે વિષયો પરના લેખાથી બરપૂર છે.

—સયાજીવિજય

‘સુવાસ’ એના નામ પ્રમાણે સુવાસિત છે.

—તાંત્રી - દેશીરાજ્ય

‘સુવાસ’ના કેટલાક અગ્રલેખોમાં જળવાયલ રસ, તરતસાન અને કવિતાત્મક ગદ્યનો સંયોગ ટાગોર સિવાય કંચાંય નથી અનુભવ્યો.

—અ. મ. પરીઅ

લાગે છે કે ‘સુવાસ’ સ્વ. મઠુલાઈ કાંટાંવાળાના ‘સાહિત્ય’ જેઠલું ઉદ્ઘાર દશ્ચિવાળું પત્ર થશે. તેના લેખાની પસંદગી ધથ્યા ડીચા પ્રકારની છે.

—જ્ઞતુનાં કુસુમાકર :

‘સુવાસ’ના કેટલાક વિષયોની ભાષા એટલી તો હફ્ટાંગમ છે, કે ગુજરાતી ભાષાના ક્રાઇપ્શિય સાહિત્યરસિકને અનેક વખત વાંચ્યા છતાં ફ્રીવાર તેના વાંચનની તૃપ્તા જ લાગી રહે.

—મિનિયિ



अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया ।

नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ॥

પુસ્તક ૨ નંબર ]

વિ. સ. ૧૯૯૫ : શ્રાવણ

[ અંક ૪

## વન્દે માતરમ्

ન

**માતાને વંદન.**

પણ માતાનો અર્થ નથી ડેવળ ભૂમિ, તેમ નથી ડેવળ જનતી. વંદનનો અર્થ ન હોય ડેવળ પૂજન—અર્થન—સ્તવન.

માન્યતે ઇતિ માતા એ માતાનો વ્યુત્પન અર્થ; એનો ઇદ અર્થ જનતી. પણ એનો સંસ્કારિત અર્થ તો ‘જે જીવનસત્ત્વ અક્ષતું હોય એવું પૂજનીય ખીતત્ત્વ.’

વન્દનનો શબ્દાર્થ જલે રહુતિ કે અભિવાદન હોય. પણ એનો સંસ્કારિત અર્થ તો વન્દના રક્ષણુની જવાબદારી પણ પોતામાં જ સમાવી હો છે. જનતીને પ્રતિહિન નમન કરનાર પુત્ર જનતી પર આવી પડતી આદેતના પ્રસંગે જે મૌન સેવે તો તે કરતાં નમન ન કરનાર છતાં એ આદેતને વિદારનાર પુત્રનાં વંદન વધારે સાચાં લેખાય છે. સરસ્વતી કે સંસ્કૃતિનાં પૂજન તો હંમેશાં હજારો કરતા હશે પણ એને જળવાય જીવનના ખેલ ખેલનાર પ્રતાપ કે શિવાળનાં જ પૂજન જીવાયાં છે. જન્મભૂમિને વંદન તો લાગે કરતા હશે પણ નોંધપાત્ર વંદન તેમનાં જ લેખાય છે જેમણે ભૂમિના રક્ષણ માટે કુરબાની કરી હોય.

સંકુચિત દાખિના માનવીને મન માતા એટલે જનતી; રાષ્ટ્રિય દાખિના ગાનવીને મન માતા એટલે જનતી ઉપરાંત જન્મભૂમિ; મહાત્માને મન માતા એટલે જગતનું પ્રત્યેક ખીતત્ત્વ. આમાં પરમ વિશુદ્ધ ભાવના તો મહાત્માની છે; પણ દરેક માનવી મહાત્મા ન અની શકે. છતાં જીવનના, સંસ્કારના, દેશના, ધર્મના, પ્રગનના, શુદ્ધ સ્વાર્થના રક્ષણુને આતર ઓછામાં ઓછાં ચાર ખી-તત્ત્વોને તો દરેક માનવે માતા તરીકે સ્વિકારી લેવાં અનિવાર્ય છે. એ ચારે એને જીવનનું સત્ત્વ બક્ષે છે. એમની વિશુદ્ધ અને એમના સંરક્ષણમાં જ એના જીવનની કિંમત છે.

## ૧૫૬ .. સુવાસ : આચણ ૧૬૬૫

ગર્ભમાં પોષનાર, જન્મ આપનાર, એળે ઉછેરનાર, અમૃતસમાં દૂધ પાનાર, ખાળ-પણે સંસ્કારથી સિદ્ધનાર જન્મભાગીને માનવી ગર્ભપુત્ર છે. માતા પણ જ્યારે દૂધ ન પાઈ શકે, યૌવન બિહારું હોય કે જીવનનાં સર્વો મુસાઈ ગયાં હોય, હાથમાં સમશેરો રમતી હોય કે પગતું કોવત પણ આથી ગયું હોય ત્યારે પણ જે એવા એકને જ નહિ અનેકને નિરંતર દૂધ પાયા કરે છે; જે માનવીની જ નહિ, પૃથ્વીમાતાની પણ માતા છે; સંતાનધૈકણાના પૂર્વસંસ્કાર સંતોષવાને જેને પ્રાણીની છતાં જગતમાતાની પવિત્ર જાતિમાં જન્મ ભલ્યો છે; જેનામાં શાંતિ-ગૌરવ-સહિપુણ્યતા માનવમાતા કરતાં પણ વિરોધ પ્રમાણુમાં જગતું છે તે ગાયમાતાનો માનવી દૂધપુત્ર છે. જેણે આજીવન સંસ્કાર સિદ્ધ્યા, તેજ બદયું; માનવતા શાખવી, ધર્મ સમજાવ્યો; અનેકને જેણે એક સાંકળે ગૂઢ્યાં, અદ્યમાં પણ જેણે આત્મભાન પ્રેર્યું; ડલા અને સાહિત્ય, રથાપય અને શુંગાર-જીવનનાં અનેક મધુર અંગો જેની સહાયથી જગમગ્યાં એ અદેહી છતાં પ્રત્યેકના હૃદયમાં વિરાજતી સંસ્કૃતિ-સરસ્વતી માતાનો માનવી સંસ્કારપુત્ર છે. જે જડ છતાં ચેતનમાત્રનો આધાર છે, કુદરતની રમણીય લીલાઓનું મંદિર છે; જે જળ પાય છે, જીવન રક્ષે છે; જે મૃત્યુ પછીની પણ શયનભૂમિ છે; સમસંસ્કારી બંધુઓની સાથે વસવાતું જે ગુહાંમંદિર છે એ જન્મભૂમિનો માનવી દેશપુત્ર છે. આ ચારે માતાઓ પ્રત્યે માનવીની સમાન જવાંઘારી છે. એ ચારેમાંથી એકની ડિમત એાછી આંકનાર બાકીનાંતી વિશુદ્ધ પર વ્રાપ મારે છે.

જનની અને જન્મભૂમિને તો જગતનાં પ્રયોક રાષ્ટ્રોએ વંદીય ગણેલ છે. પણ એ ભાવનાએ ડેવળ એ લાલસાજ જન્મભાવી જેને અનુસરી તેમણે ધડેલા નિયમોને સંસ્કૃતિનું નામ અયાસું-જે સંસ્કૃતિ આજે જગતની વિરલ પ્રગતિને એકીભૂમાં પીસી રહી છે. પણ હિંદુ જનની અને જન્મભૂમિ ઉપરાંત ગાય અને સરસ્વતી-સંસ્કૃતિને પણ વંદીય ગણ્યાં. ગાયને માતા ગણુવાથી હિંદની મહાન પ્રગતિ આજીવન માતાનું દૂધ મજયું-જેણે એના જીવનમાં અન્યાયને આવતો અટકાવ્યો, જેના વિશુદ્ધ પ્રભાવથી એનામાં શિશુનો સમભાવ ને માધુર્ય ડુળવાયાં. સંસ્કૃતિને માતા ગણુવાથી તેનામાં એવું સ્વતંત્ર વ્યક્તિત્વ વિકસયું જે હળરો વર્ષોના આકમણું અને નીચ યુક્તિઓ સામે હજુ પણ ડેટલેક અંશે અવનત બિલું છે. અને હિંદની સંસ્કૃતિ વધારેમાં વધારે ઉનત, સંરક્ષણીય અને પ્રભાવશીલ એ માટે છે કે તે ડેવળ લાલસાએ સંતોષવાને કે અન્યને લક્ષ્યવાને નહિ પણ સંસ્કાર, ન્યાય ને તેજને ભીલવવાને, પ્રાણીમાત્ર પ્રત્યે બન્ધુભાવ ડેળવવાને, ભૂમિને રક્ષવાને, સમૃદ્ધિને વિકસાવવાને, માનવતા જાળવવાને રચાઇ છે.

હિંદની મહાત્મા જેટલી એના ભૂમિ-સ્વાતંત્ર્યમાં છે એટલી જ એ એવા ગાય પ્રત્યેના ભાતૃભાવમાં, જનનીપૂજામાં ને સંસ્કૃતિરક્ષામાં છે. જ્યપરાજ્ય તો લાયને આધીન છે. પણ માનવીની ડિમત તો ન્યાયની, સંસ્કૃતિની, પવિત્રતાની કે સંસ્કારની જળવણી મારેની એવી તમજામાં છે. અને જ્યારે એ તમજા પૂરેપૂરી જગમગી ભાડે ત્યારે જ —

વંદે માતરમ् પદ્ની લાવનાને તે સાર્થક બનાવી શકે.

જીવનતું એક મોંધુ અને મધુર છતાં હળવું અને કશણું

## સંસ્કરણ

મોહન વ. ઠાકેર

કોલેજમાંથી છૂટીને અપોરે ધરબણી વળતો હતો ત્યાં અજૂર ભરેલી ટેલણુગાડી ટેલી જતા કોઈ વૃદ્ધ ઇસ્રિયાનો સાદ મારે કાને પડ્યો: “અજૂર...લ્યો મસ્કતી અજૂર...” અને અધમધરાતે વાંચતાંવાંચતાં એકાદ એલું આવતાં હાથમાંતું પુસ્તક સરીને બોંધે પડી જાય એમ માંદું યૈવન સરી પડ્યું; હું ચારપાંચ વરસનો શિશુ થઈ ને ચેલી ટેલણુગાડીના ખાલી લંડકિયામાં પોઢી ગયો !

બા તો મને ધાવણો મેલિને જ ધામમાં ચાલી ગઈ’તી એટલે મારે મન તો, બા કે આપા જે કહ્યો તે, એક ‘અધા’ જ હતા. હેલી પરોઠે, હજુ તો મોસુજણ્ણું માંડ થયું હોય ત્યાં, કિયાળાની ગુલાભી ટાઢમાં એમની હુંકાળી જોદમાં અધી જિધમાં, અધો જગતો-

‘મારે દેર આવને માવા, સવારે ઢેઅરાં આવા’

એ મધુર પરલાતિયું સંભળતો પડ્યો રહેતો અને હજુ આન્દેય મને એ પરલાતિયું અને એના ગાનાર હેતાળ ‘અધા’ બને, એવાં ને એવાં જ સંભારે છે !

મિશનરેઓ પરના વાડામાં, એક ઘટાદાર લીમડાની ભીડી છાંયે ગુણુપાટ, અપાટિયાં અને પતરાંમાંથી જિલ્લા કરેલી નાનારી જૂંપડીમાં એમે બાપદીકરા સુધે રહેતા !

સવારમાં હેલા જિંદી, દાતણુપાણીથી પરવારી, સૌપ્રેહણું કામ ‘અધા’ની આંગળીએ વળળી, કે એમને આંધોલીએ ચરી, લીમા કહોઈની હાથેથી ગરમાગરમ ફડ્ફડિયા ગાંધિયા, અને મોનથાળ લેવા જવું એ ! મને ત્યારેય મોનથાળ ખૂબ લાવતો, મોહન ખરાને ! અને ‘અધા’ નેથ અર્થાણુની જોળી પછી એ હુંગો હીક માઝક આવતો !

દેર આવી ‘અધા’ મંગણા ઉપર ઝટપટ એ રોટલા ટીઝી કાઢતા, ને હુંગળીનું ડયકું ને રોટલાનું બદ્દું રીરાની ગામમાં ફેરીએ ભોપડતા. ટેલણુગાડીના થાળા ઉપર અજૂરનું વાડિયું જોડવાનું, ને નીચે, લંડકિયામાં બંદ ! ‘અજૂર લ્યો મસ્કતી અજૂર’ આમ સાદ હેતા બાપા શેરીએશેરીએ ધૂમતા હોય, ને હું લંડકિયામાં આરામથી ધોંની ગયો હોઉં !

ધોામ ધખણા હોય, ત્યારે કોઈ વડ કે લીમડાને છાંયે ગાડી જિભી રાણી ‘અધા’ ધૂક પોરો જાતા. હું જગ્યો હોઉં, ને ખૂબ લાગી હોય તો, સામેની હોટેલમાંથી ચા-ગાંધિયા મંગાની રોંટો કરતા, અને પાછા ફેરીએ ભોપડતા ! દિવસ નમતાં હુંય ટેલણુગાડીના થાળા ઉપર એઠો એઠો ‘અજૂર લ્યો મસ્કતી અજૂર’ ની ઝીણી ખૂસો પાડતો.

સાંને પાઠી-દ્દર ઉલાળતા નિશાળિયાએઓ નિશાળમાંથી નીસરી પાંસરા દેર જતાં મને ગાડીના થાળા ઉપર એઠો એઠો એકલો ‘હુકાન હુકાન’ રમતો જોઈ તાજુખ થતા ! કોઈ પૂછતા ‘વલુકાકા અને રોજ સાચે જ કં ફેરવો, દેર કેમ નથી રાખતા ?’

કોઈ ધરાક વળી પૂછતું: ‘આ તમારો દીકરો કે, કાકા ?’

“દીકરો તો પ્રલુનો, ભાઈ, આપણે તો જોવાળિયા રહ્યા, જોવાળિયા !’ અધા જવાય વાળતા. એમની આ વાતો સમજ શકું એટલે સમજણો ત્યારે નોંટો થયો, એટલે હું તો મારી સીગારેટના જોળ ઉખાનાં ઢાંકણું ને સાંઠીકડાંની બનાવેલી તાકડી ને પથરા-ઢોકરાનાં તોલાં વડે ‘હુકાન હુકાન’ રમવામાં જ વધુ મોજ માણતો.

...આજે, વીસસીસ વરસ પછી, જ્યારે એ બધું સંભારવા એસું હું ત્યારે આંખમાં ઝળજળિયાં ભરાઈ આવે છે, ‘પ્રલુના બાળક’ને લાડકોાંથી ઉછેરનાર એ ‘ગોવાળ’ આજે નથી; છે, હૈયામાં સહાને મારે જડાઈ રહેલું એતું મધુરું સંસ્કરણ !

## સર્વસિદ્ધ ન્યોદશી

શ્રી. જેઠાલાલ વિવેકી

પુંચાંગદૈખડો ઉપર હેઠેન મજમુદારને ભૂળથી જ સ્વાભાવિક રોષ હતો. ભગવાને સરનેલા દિવસોમાં શયની વાઢકાપ કરનાર ડોકટરોની ચેટે યથેચુછ કાપ્રૂપ કરવી એ હરેનની દિશિઓ અયોગ્ય લાગતું. વિષુડો, વ્યતિપાત, શનિની દશા વજેરમાં હરેનાખું અધિકુલ માનતા નહિ. એવા કુસંસકાર અને વહેમમાં એમના જેવો વિદ્યાન માણુસ આરથા રાખે તો થઈ રહ્યું? જે રીતે હરેનાખું પંચાંગમાં લખેલા નિષેધદિનોને માનતા નહિ, તે જ રીતે તેમાં ઉલ્લેખ કરેલા શુદ્ધ દિનોમાં કામ કરવા માટે પણ ઈચ્છા રાખતા ન હતા; પોતે કાઈ કામ માટે ખફાર નીકળે તે વખતે કાઈ તેમને કહે કે ‘આજ સારો દિવસ છે તેથી કાર્યસિદ્ધ થશે,’ તો તે જ વખતે તેઓ કુદ્દ થઈ ઘેર પાછા ફરતા. પછી તે દિવસ તેમને કામ કરવા માટે નકોમો સમજવો.

આ વિષયમાં તે તેમના સાહિત્યક બંધુ પ્રમથને ડેટલો અધ્યા ચીડવતા ને સમજનતા તેની તો ગણુની જ ન થઈ શકે. ઊગતો લેખક હોવા છતાં પ્રમથ, એવા વહેમમાં માને છે એ તેમનાથી સહન થઈ શકતું નહિ. પરંતુ હજરોવાર પ્રયત્ન કર્યા છતાં પણ તેઓ પ્રમથને પોતાના પક્ષમાં લેળની શક્યા નહિ.

હેઠેન પોતે પણ લખતા હતા. એ વિષયમાં તેઓ પ્રમથ પાસેથી પ્રેરણ્યા પણ મેળવતા હતા. પરંતુ અધારપિર્યેત્ત પત્રસંપાદકોનો કૃપાલાલ તેમને નસીમે લખાયા હોય એમ લાગતું નહિ. તેમણે લગભગ એ ડાન ટૂંકી વાર્તાઓ લખી, અધીઓ એક પછી એક તમામ પ્રચલિત માસિક પત્રોના તંત્રોએ તરફ મોકલાની હતી. પરંતુ અધાની તરફથી તે વાર્તાએ “સાલાર પરત”ના શેરા સાથે પરત કરવામાં આવી હતી. પરંતુ તેથી હેઠેન હારી જાય તેમ ન હતું. આ વખતે તેમણે પત્રના ઉત્તર-પ્રત્યુત્તરના ઇપમાં ટૂંકી વાર્તાએ લખવાની નવી રીત શોધી કાઢી. એ નવી વાર્તા એમને એટલી ગમી ગઈ કે, હવે તે વાર્તા કાઈ સંપાદક પાણી નહિ મોકલે એવી દદ ધારણ્યા તેમના મનમાં બંધાઈ ગઈ. પરંતુ ભૂતકાળની નિષ્કળતાની સ્મૃતિ તેમના મનમાંથી હજુ ભૂસાઈ ગઈ ન હતી. આથી તે વાર્તા રવાના કરતાં પહેલાં તેઓ એકવાર પ્રમથની પાસે ગયા ને પૂછ્યું: “તું શું ઉપાય કરે છે કે તારો કાઈ લેખ પાછો આવતો નથી? જેવો મોકલાવે છે તેવો જ છુપાઈ જાય છે. તેનું કારણ શું?”

પ્રમથ સરળ ભાવે આવ્યો: “ભાઈ હું કાંઈ ઉપાય-શુપાય જાણુતો નથી. પરંતુ એટલું બહિ કે, શાસ્ત્રવાક્યમાં વિશ્વાસ કરીને સર્વસિદ્ધ ન્યોદશીને દિવસે હું મારા લેખો રવાના કરું છું.”

“એ બધા કુસંસકાર” કહીને હેઠેને દલીલ ચલાવવા ઈચ્છા કરી. પણ સામો માણુસ પ્રતિવાદ કરવા તૈયાર ન હોય ત્યાં દલીલ શી રીતે ચાલી રહેકે? હેઠેન છાતોમાનો જિઠીને ખર તરફ વિહાય થયો.

## સર્વસિદ્ધિ ત્રયોદશી .. ૧૫૮

દેર આવીને હરેન વિચાર કરવા લાગ્યોઃ ‘શું પ્રમથ તેના લેખ ત્રયોદશીને દિને રવાના કરે છે માટે પાછા નહિ આવતા હોય ? ત્યારે ખરેખર એ તિથિમાં કાંઈ રહસ્ય હો ? ત્યારે પોતે પણું તેની આત્મી કરવા માટે પોતાનો લેખ એકવાર ત્રયોદશીએ રવાના કરે તો ?’ પરંતુ બીજી જ ક્ષણે તે મન સાથે જોલી જાઈયોઃ ‘તેમ ન થાય. એતો વહેમ. કુસેસ્કાર ! કુસેસ્કાર !’

ડેટલાક દિવસ સુધી એ બને વિરોધી વિચારોમાં તેનું મન જોલાવા લાગ્યું; પરંતુ માસિકમાં વાર્તા છપાવવાનો નશો તેના પર કાખું જમાવી જોડો હતો. તે મન સાથે વિચાર કરવા લાગ્યો કે, ‘પોતે તો તિથિ-નક્ષત્રમાં ખરેખર માનતો જ નથી. પરંતુ એકવાર પરીક્ષા તો કરી જુઓ ! એમાં દોષ શું ?’ આ રીતે છેવટે સર્વસિદ્ધિ ત્રયોદશીનો જ જય થયો. જણુના પ્રમાણે હરેન પહેલીજવાર પંચાગ જોલી તિથિ જોઈ, એક આનાની પોષ્ટ-ટિંટ સાથે પોતાની લખેલી નૂતન વાર્તા એક પ્રભ્યાત માસિકના તંત્રી તરફ રવાના કરી દીધો.

સાધારણું રીતે વાર્તા પાછી આવવાનો સમય પસાર થઈ ગયો, પરંતુ વાર્તા આ વખતે પાછી આવી નહિ. હરેનાખુના મનમાં આશાનો અંચાર થવા લાગ્યો. હરેન માન્યું કે, પોતાની વાર્તાનો આ વખતે સ્વીકાર થયો છે. ખરેખર ત્રયોદશીમાં સિદ્ધિદાનતી શક્તિ છે. પરંતુ આનંદદાયક સમાચાર ન આવે ત્યાંસુધી નિશ્ચિત થવાય નહિ. હરેનજ મધ્યાનહે તે પોષેમેનની પ્રકાશક કરતા એસતા. એ પ્રમાણે એ માસ વીતી ગયા. હવે તે સંપાદક તરફ ઉધરાણી કરવાનો વિચાર કરતા હતા. પરંતુ ‘એક દિવસ વધારે રાહ જોઈને લખીશ’ એમ વિચાર કરતાં કરતાં સાત દિવસ વીતી ગયા. એક દિવસ એકએક એક પોલીસ કર્મચારી હરેનાખુન પાસે આવ્યો. તે હરેનાખુને વોરાંટ હેખાડી પકડીને થાણુમાં જેણી ગયો ને ત્યાંથી કચેરીમાં લઈ ગયો.

કચેરીમાં ગયા પછી હરેનાખુંએ જાણ્યું કે, એક યુવક ડેટલાક દિવસ પહેલાં આત્મ-હત્યા કરી હતી. એ સંબંધે તપાસ કરતાં તે યુવકના ધરમાંથી હરેનાખુંએ લખેલો પત્ર મળ્યો આવ્યો. હતો. હરેન આ વાત જણુંતો જ જોલી જાઈયો કે, ‘આ પણ એક જતની હીટેકીવ વાર્તા છે કે શું ?’

નિદ્દિષ્ટ તારીખે સુકદમાની શરૂઆત થઈ. હરેનને ડોર્ટમાં લઈ જઈ આરોપીના પોજરામાં જિલ્લે કરવામાં આવ્યો. સર્વેઠી પહેલાં શાપથ આપવામાં આવ્યા. પછી ન્યાયાધીશે હરેનનું નામઢામ વગેરે પૂછ્યા બાદ પ્રશ્ન કર્યો: “તમે મણીમય રોય નામના ડોઈ યુવકને એળજો છો ?”

હરેન જોલ્યો: “ના જી.”

ન્યાયાધીશ:—જે યુવક પલાશપુરમાં આત્મહત્યા કરી છે તેને તમે ઓળખતા ન હતા ?  
હરેન:—ના, જી.

ન્યાયાધીશ તુરત એક પત્ર જતાવી હરેનને પૂછ્યું: “જુઓ આ લખાણ આપના હાથે લખાયું છે કે નહિ ?”

હરેન પત્ર દેખી રચિત થઈ ગયો. તે તેણે છેલ્ખીવાર લખેલી ટૂંકી વાર્તા છપાવા મોકલી હતી અને એ પાછી નહિ આવવાથી તે એમ માનતો હતો કે, માસિકના સંપાદક તે સ્વીકારી છે, તેનું એક પૃષ્ઠ હતું. તેમાં એક જગ્યામે લખેલું હતું:—

## ૧૬૦ .. સુવાસ : આવણુ ૧૬૬૫

“ભાઈ મણિમય, તમારા મનની એ અવરસ્થામાં, તમારા કર્તવ્ય સંબંધે મારો અલિપ્રાંય માગો છો ? તમારા ગંભીર દુઃખથી ખરેખર હું દુઃખી થાડું છું. કિનું તમને કાંઈ પણ કંઈ શકતો નથી. તમારું મન પોતેજ તમારો માર્ગ બતાવશો...”

x                    x                    x

ભાઈ તમારું દૈર્ઘ્ય અરીમ છો. તમારા જેવી અવરસ્થામાં હું જે પડ્યો હોંઠ તો મારે મારે તો આત્મહત્યા સિવાય બીજે કોઈ ઉપાય રહે નહિ.”

હરેન ન્યાયાધીશને કહ્યું કે, “હું એક લેખક છું. પત્રના ઉત્તર-પ્રત્યુત્તરના ઇપમાં એક વાર્તા લખી એક મસિકના સંપાદક તરફ મેઝલાવી હતી. આ પત્ર તે વાર્તાનો એક ભાગ છે.”

ન્યાયાધીશ પૂછ્યું:—“ત્યારે તે સંપાદક સાથે આપને શવૃતા હતી, તેથી આપને વિપદ્માં નાંખવા આ પત્ર તેણું પોલીસ તરફ મેઝલાવ્યો છે, એમ આપ કહેવા માગો છો ?”

હરેન કહે, “ના જી.”

ન્યાયાધીશ કહ્યું: “ત્યારે એમ કહેવા માગો છો કે, પોલીસની સાથે આપને શવૃતા છે. જેથી સંપાદકની ઓશીસમાંથી તેઓ તમારી વાર્તામાંથી આ પૃષ્ઠ કાપી લાવ્યા છે ?”

હરેન કહે, “ના જી.”

ન્યાયાધીશ કહે: “ત્યારે શું કહેવું છે ? હું તમારી લેખક તરીકે પરિચય આપવાની પ્રત્યુત્પન્ન મનીની તારીફ કરું છું. હું જાણું છું કે, આજકાલના જીવાનોમાં તે વરતુનો અભાવ નથી.”

હરેન નિરુત્તર રહ્યો. ન્યાયાધીશે ઇરી પૂછ્યું: “આપ એમ કહેવા માગો છો કે, પત્રમાં લખેલો મણિમય આપની ડાયપનાસુદ્ધિનું એક પાત્ર માત્ર માત્ર છે ?”

હરેન એલ્યો: “નિશ્ચય, એમ જ છે.”

ન્યાયાધીશ કહે: “અને ડાયપન મણિમયની સાથે આત્મધાતી મણિમયના નામનો મેળ એક અક્સમાત માત્ર છે. એવી ઘટના પણ ઘટી શકે. એમ જ કહેવું છે ને ?”

હરેન આશ્વાસિત થઈ એલ્યો: “હા જી. એ એક અક્સમાત માત્ર. બીજું શું ?”

ન્યાયાધીશ એલ્યો: “ત્યારે આપ એમ પણ કહેવા માગો છો કે, આપનો આ પત્ર મણિમયના ઘરની તપાસ દરમ્યાન મળી આવ્યો એ પણ એક અક્સમાત હોવાનો સંભવ છે ?”

હરેન ચૂપ રહ્યો. ન્યાયાધીશ ધીમું હસીને એલ્યો: “પત્રમાં આપેલા ડાયપન નામ સાથે આપના પોતાના વાસ્તવિક નામનો મેળ પડે છે એ પણ એક અક્સમાત છે ? શું કહેવું છે ?

હરેન કહે: “આપનું કથન બરેખર સમજાતું નથી.”

ન્યાયાધીશ: “એમ પૂછું છું કે, આ પત્રની નીચે હરેન્દ્ર નામથી આપની પોતાની સહી કરેલી છે. એ પણ કાલ્પનિક છે ?”

હરેન અત્યારસુધી તે સહી જોઈ ન હતી. તેણું તે પત્રમાં એકવાર જોઈ લાધી, પછી તે એલ્યો: “જી, એ નામ મારું છે, પરંતુ મેં લખેલું નથી. મારી લખેલી વાર્તામાં પત્રની નીચે ઇતા “તમારો ગુણસુગ્ય અધ્ય” એટલું જ લખેલું હતું. બીજું કંઈ લખ્યું ન હતું.”

ન્યાયાધીશ: “આ પત્રમાં નીચે આપના હાથની સહી કરેલી હેખાય છે. તે આપના હાથે થયેલી નથી એમ કહેવું છે ?”

હરેનઃ “ના, જી. આ સ્થળે મારી સહી કરવાની જરૂર ન હતી. આ સ્થળે નામ લખવાની જરૂર હોતું તો કાલ્પનિક ભણિમયના કાલ્પનિક મિત્ર રાધાકાનતનું નામ લખત. પરંતુ આ સ્થળે અનાવસ્યક લાગવાથી મેં ડોઈનું નામ લખ્યું ન હતું.”

ન્યાયાધીશઃ “ઠીક, આપ આ કાગળના કુકડા પર આપની સહી કરો.”

હરેને સહી કરી આપી એટલે ન્યાયાધીશ તે સહીમાં અને પત્રમાંની સહીમાં કાઈ બેદ છે કે નહિ તે જેવા લાગ્યો, પરંતુ કંઈ બેદ જણાયો નહિ તે પછી હરેન તરફ જોગળે ન્યાધીશ બોલ્યો: “આપ પોતે જ ખાત્રી કરી જુઓ કે આ બંને સહીમાં કાઈ ફેર માલમ પડે છે કે કેમ?”

હરેન બ્રોબર પરીક્ષા કરી, પણ કાઈ ફેર માલમ પડ્યો નહિ. પછી તે જેરથી બોલ્યો: “એ મારી સહી નથી. આપને મારી વાતમાં વિશ્વાસ ન આવે તો, આપ ચોણ્ય સમય આપો. તે સમય દરમ્યાન હું મારી વાતની સત્યતા સાબિત કરી આપોશ.”

ન્યાયાધીશઃ “શા રીતે સાબિત કરી આપોશ?”

હરેન: “મારી વાતનું જોખું લાવી આપને બતાવું, એથી મારી વાત આપને સાચી લાગશે, એમ આશા રાખું શું.”

ન્યાયાધીશઃ “તેમ કરવાથી તો તમને વખત મળે એટલે આ પત્રને બંધખેસતી એકાદ વાર્તા લખી લાવો. કેમ અર્ઝે ને?”

હરેન: “આપને મારી વિશ્વાસ ન આવે તો આપ જ મારે ધેરથી વાતનું જોખું મંગાવવા તજીવીજ કરો.”

ન્યાયાધીશ તે પ્રમાણે કરવા કુભૂલ થયો. કારણું એમ કરવાથી પક્ષકારને પોતાના અચ્યાવના સમર્થનની તક મળશે એમ તેને લાગ્યું. મુક્કદમાની બીજી તારીખ પડી.

ચારપાંચ દિવસ પછી હરેનને અખર ભળ્ણ કે, ન્યાયાધીશ તેને ધેરથી વાતનું જોખું મંગાવવા વ્યવસ્થા કરી હતી. પરંતુ તે હાથ લાગ્યું નથી. વિશેષમાં તેને જણાવવામાં આવ્યું કે તેની પોતાની ધર્યા હોય તો તેને જોખું મંગાવવાની તજીવીજ કરવા શુટ છે.

હરેન અગાઉની ધરના વિગતવાર વર્ણવીને તેના મિત્ર પ્રમથને ધરમાંથી વાતનું જોખું શોધી કાઢી મોકદી આપવા લખ્યું. પ્રમથે ઉત્તરમાં લખ્યું કે તેની વાતનું જોખું મલ્લી આવ્યું નથી. પોલીસે ધરની તપાસ કરી તે વખતે તે પોલીસને હાથ લાગ્યું છે કે નહિ તેની પણ પ્રમથને ચોક્કસ અખર ન હતી.

નિર્હિત દિવસે મુક્કદમાની ફરી સુનાવણી થઈ. પરંતુ હરેન પોતાની વાતની સાબિતી આપી શક્યો નહિ. છેવટે ન્યાયાધીશને તેની વિરુદ્ધ સુકાદો આપવાનો રહ્યો. હેઠળારી કાયદાની કલમ ૩૦૬ અનુસાર હરેનને આત્મહત્યાના પ્રયારક તરીકે છ માસની આસાન કેદ તથા ૫૦ રૂપિયા દંડ કરવામાં આવ્યો. હરેનના પત્રથી મણિમય આત્મહત્યા કરવા ગ્રેરાયો હતો. છતાં હરેન અત્યક્ષ સહાયકીની નહિ હોવાથી આટલી એઠાં શિક્ષા કરવામાં આવી હતી.

પોલીસ હરેનને કાર્યમાંથી થાણામાં ને ત્યાંથી જેલમાં લઈ ગયા. જેલમાં જતાં રસ્તામાં જરા આગળ ચાલતી એ વ્યક્તિએની વાતચીત હરેને સાંભળી. એક જણ બોલ્યો: “હે મારું પ્રમોશન કોણ અટકાવશો? છેવટે સર્વસિદ્ધ નાચાદશી સાધવી પડી. બીજું શું કરે?”

બીજો માણુસ બોલ્યો: “હીકીત શી ઘની હતી, તે જણાવ તો અરો.”

પ્રથમ વ્યક્તિ: “તો સાંભળા લે. મણિમય રોયની આત્મહત્યાના ડેસના તપાસનો ભાર મારી ઉપર પડ્યો. તે હિવસે એકાદશી હતી. તે પછી એકમે હિવસ ખાદ સર્વેસિદ્ધિ નયોદશીને હિવસે મણિમયના ગમે તપાસ કરવા માટે ગયો. સદ્ગુરાજે એજ રાત્રે એક ટપાલ લુંટાઈ. જીને હિવસે સવારે થાણુભાઈ ટપાલની લુંટની ખબર આવી. થાણુના દોરાગા સાથે હું પણ તપાસ કરવા માટે ગયો. તપાસમાં મારા હાથમાં હરેનાયાખું એક કવર આવી ગયું. તેમાં એક વાર્તા લખેલી હતી. બ્યોરે જની પરવારીને એ વાર્તા વાંચી. વાર્તામાનો એક પત્ર વાંચ્યતાં જ મારા લેળમાં એક વિચાર રક્ખ્યો. મનમાં વિચાર કર્યો કે મણિમયના ડેસમાં કાંઈ પુરાવો હાથ નહિ લાગે તો છેવટે આ પત્ર ઉપરથી ડેસ જિબો થઈ શક્યો. થયું પણ તેમ જ.

ભીજુ વ્યક્તિ: “હરેનાયાખુંએ ડોર્ટમાં જે માથાડીક કરી હતી તે બધી સાચી હતી કે શું ? ”

પ્રથમ વ્યક્તિ: “જરૂર સાચો.”

ભીજુ વ્યક્તિ: “ત્યારે તેના હસ્તાક્ષર એ પત્રમાં કચાંથી આવ્યા ? ”

પ્રથમ વ્યક્તિ: “બુદ્ધિ હાય તો બધુંય ચાય. વાતાને છેવટે લેખડો પોતાનું નામ ડેકાણું વગેરે લખે છે તે નથી જાણુંતો ? તેનું અનુકરણ કરવું કંઈ અધિક નથી. હરેનાયાખુના મનમાં એમ હતું કે વાતાનું કાચું ટિપણું ખતાવી, મારા જિબો કરેલો ડેસ તોડી પાડવો. પરંતુ હું તેનાથી ક્યાં કાચો હતો ? ધરની જડતાને બહાને તે વાતાનું જોણું મેં પ્રથમથી જ હરેનાયાખુના ધરમાંથી સેરવીને હાથ કરી લીધું હતું. ભાગ્યઅને એ હિવસ રાહ જોઈને નયોદશીને રાજ તપાસ માટે ગયો. તેથી જ આ બધો મેળ એઠા. ”

પાછળ ચાલતાં આ બધો ઘરતિહાસ સાંભળા રહેલા હરેનાયાખુના મુખ પર હુંખ્યું હારય જવાયું. તે મન સાચે જ જોત્યા: “હાય, રે નયોદશી, પ્રમથની નિર્દીષ સાહિત્યલોચના વેળાએ પણ તું સર્વેસિદ્ધિ, વળી આ લોકના પાપકર્મ વખતે પણ તું સર્વેસિદ્ધિ. ડેવળ મારી વખતે જ તું સર્વનાશી ? ”

તે હિવસે હરેને પ્રતિશા કરી. વાર્તા જપાવવાના નશાગમાં તથા સર્વેસિદ્ધિતની પરીક્ષા કરવા જતાં જીવનમાં આ એકવાર જ તેણે નયોદશીને માન આપ્યું હતું. તેનું ઇન્દી પણ તેને હાયોદાય મળ્યું. ડેવળ અર્થદંડ જ નહિ; પરંતુ એકીસાથે છ માસની જેવ પણ સાથે સાથે મળા. માટે આ પ્રથમ અનુભવ તે જ છેલ્દો માનીને, હે આ જીવનમાં પોતે કઢી નયોદશીની આડે પણ નહિ જિતરે એવી તેણે પ્રતિશા કરી.\*

—————○—————

\* શ્રી. ભક્તાનંદેનની અંગાળી વાર્તા ઉપરથી.

# વટપ્ર (વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખો

[ પં. લાલચંદ્ર ભગવાન ગાંધી. પ્રાચ્યવિદ્યામંહિર, વડોદરા ]

[ ૮ ]

વિક્રમની સતતરમી સહીના ઉત્તરાર્ધમાં થઈ ગયેલા તપાગચ્છના ઉપાધ્યાય નેમિ-  
સાગરજીએ રાધનપુરથી માંડવગઢ તરફ વિહાર કરતાં રાજનગરથી  
૬. નેમિસાગરજીનું<sup>૧</sup> વડોદરામાં આવી હેવ-વંદન કર્યું ૧૬૪૩, માંડવગઢમાં પાતશાહ  
વડોદરામાં હેવ-વંદન જણાંગીર વિજયહેવસુરિને 'સવાઈમહાતપા' મિદ્દ આપું, ત્યારે  
ઉપર્યુક્ત નેમિસાગરે 'જગ-લ્યાક સવાઈ' પદ મેળવ્યું હતું—  
એમ નિ. સં. ૧૬૪૮માં સ્વર્ગદાસી થયેલા એ ઉપાધ્યાયના નિર્દાશુ-રાસમાં સૂચન છે.

નાકર કવિ—વિક્રમની સોણમી સહીના ઉત્તરાર્ધથી સતતરમી સહીના આરંભ સુધી  
(વિ. સં. ૧૬૫૦ થી ૧૬૧૫) વિદ્યમાન મનાતા વડોદરાના  
વડોદરાના કવિઓ દ્વી (૩) સાચાલ વખ્ટિક વીકાના સુત વૈષ્ણવ કવિ નાકરનો  
અંદી પહેલાં ઉલ્લેખ કરવો જેધાં; જેણે ૧ શિવવિવાહ,  
૨ મુખવાચ્ચાન અને ૩ આદિપર્વ, ૪ ગદાપર્વ, ૫ વિરાટપર્વ જેવાં શુજરાતી કાવ્યો રચ્યો  
વડોદરાના વડનગરા નાગર ધાર્ઢાણ અદનસૂત જેવા કથાકારને આખ્યાન કરવા કૃષ્ણાર્થા  
કર્યો હતાં.

કવિ પ્રેમાનંદ—શુજરાતની જનતામાં ધર્ણા જાણીતા થયેલા અને શુજરાતના  
આધુનિક સાક્ષરોદ્ધારા જ્યંતીએ અને ચર્ચાએ દારા પ્રેમ અને આનંદપૂર્વક પ્રસિદ્ધિમાં મૂકાયેલા  
લાટ કવિ પ્રેમાનંદની જન-મલ્યાંભ તરીક વડોદરાની વાડી વિઘ્નાત થયેલી છે. પ્રેમાનંદની  
ખડકી, પ્રેમાનંદની પોળ તરીક પ્રભ્યાતિમાં મૂકાઈ છે. જે કે આ કથાકાર કવિએ બાલ-  
વધ્યથી મોસાણ-નંદુરભાર (ભાનદેશ) માં આશ્રય લઈને અને સૂરતમાં વાસ કરી પોતાની  
કૃતિયોનો અને આખ્યાન—કથાયોનો અધિક લાલ ત્યાંતી જનતાને આપ્યો જાણ્યાય છે; તેમ  
છતાં તેણે પોતાને વટપ્રવાસી અને કેટલીક કૃતિયોમાં 'વીરદ્ધેન્દ્ર વડોદરા' સૂચિત કરેલું છે.

વડોદરામાં તેણે નિ. સં. ૧૭૨૦ (૧ અનિરુદ્ધ (એચાઓ) હરણ-કથા,) માં લક્ષમણા-  
હરણ, વિવેકવણુંઝારો, માર્કિનેય પુરાણ, વિ. સં. ૧૭૨૭ માં ચંદ્રાસનું અને અભિમન્યુનું  
આખ્યાન રચ્યું હતું; તથા વડોદરામાં નાગરી ન્યાતની પાટે ગયેલું મામેરે અદ્યાર્થિ  
નારી—સમાજમાં પ્રેમપૂર્વક બહુધા ગવાય છે.

વડોદરાના વખ્ટિક હરિદાસ જેવા કવિ-શિખ્યો દારા અને કવિ વલ્લબ્ધ જેવા પુત્ર દારા  
કવિ પ્રેમાનંદની છષ્ટ કૃતિયોમાં સારી વૃદ્ધિ પુષ્ટિ થઈ જાણ્યાય છે.

વિક્રમની અદારમી સહીના મધ્યક્ષાગને શાલાની ગયેલા, પુરાણોના આખ્યાનકાર શુજ-  
રાતી જાણાના પ્રેમી આ કવિ સંબંધમાં વિશેષ જિજ્ઞાસુએં, વડોદરા સાહિત્ય સલા તરફથી  
સં. ૧૬૩૮માં પ્રકાશિત થયેલ 'સાહિત્યકાર' પ્રેમાસિકનો પ્રેમાનંદ અંક જેવો જેધાં.

<sup>૧</sup> "રાજનગરથી ચાલે, મુનિવર-મારગે માહાલે; વહાલે એ વાંદ્યા હેવ વડોદરે રે."

(મા. ફ. દેશાઈ જી. કેનરાસમાળા ભા. ૧, પૃ. ૨૫૦, ગા. ૭૪)

અંગ્રેજીમાં થયેલા જ્ઞાનસાગર કવિત્રે વિ. સં. ૧૭૨૭ માં ચૈત્ર શુ. ૧૩ સોમવારે ગોડી પાર્શ્વનાથના સાંનિધ્યથી રચેલ ૧૬ ઢાલવાળા અાર્ડ્ઝકુમાર આર્ડ્ઝક ઋષિ ચોપાઈ (ઋષિ)ની ચોપાઈ લધુ વટપદમાં રચેલી જણ્યાવી છે, તે કદાચ બીજા નાના વડોદરામાં રચી હશે-તેમ જણ્યાય છે.<sup>૧</sup>

મરુધર (મારવાડ)ના સિવાણથી નગરમાં વાસ કરનાર છાજડ ગોત્રવાળા એસવાળ ગૃહસ્થ શા. હેમરાજ, પોતાની પત્ની રામનાઈ સાથે સ્તાંભતીર્થ (ખંભાત)માં વેપાર ભાડે આવ્યા હતા. ત્યાં વિ. શે. ૧૭૨૮માં ચૈત્ર શુ. ૫ બનજી નામે લક્ષ્મીસાગરસ્કૃતિની ખુત્ર પ્રાપ્ત થયો હતો. આડ વર્ષના તે પુત્રને લઈ તેઓ વટપદ (વડોદરા)માં આવ્યા હતા.<sup>૨</sup> અહિ રહેલા તપાગચ્છના વૃદ્ધિસાગર-સુરિની ધર્મ-દેશના સાંભળી બનજીએ વિ. શં. ૧૭૩૬માં વૈ. શુ.

૩ દીક્ષા સ્વીકારી હતી, તે સમયે તેનું નામ નિધિસાગર રાખવામાં આવ્યું હતું. વિ. શં. ૧૭૪૪માં વૈ. વ. ૨ રાજનગરમાં વૃદ્ધિસાગરસ્કૃતિએ તેમને સુરિપદ આવ્યું ત્યારે લક્ષ્મીસાગર-સુરિ નામથી પ્રસિદ્ધ કર્યા હતા. તે સમયે પાતશાહના ભાનીતા, શાહ શાંતિદાસના સુત લક્ષ્મીયંતે ધાણું દ્રવ્ય અચી મહોત્સવ કર્યો હતો.<sup>૩</sup> તેઓઓ અનેક લિર્ણીની યાત્રા કરી હતી, ઉપરેશાહિયા લોકો પર ઉપકાર કર્યો હતો. વિ. શં. ૧૭૮૮માં સૂરજપુર(સૂરત)ના ભીજ ચોમાસામાં શરીર અસ્વસ્થ થતાં સંઘની વિનિતિને ભાન આપી તેઓએ વિજયદશમિએ પ્રમોદસાગર જ્યોત્સ્નાયને આચાર્યપદ આપી કલાણસાગરસુરિ નામ સ્થાપી તેમને પોતાના પદ્ધત તરીકે પ્રભ્યાત કર્યા હતા. અંત સમયે ઉપરેશ ઉપરેશ આપી તેઓ આસો વદિ ઉસર્ગનાસી થયા હતા. સંચે અહુમાનથી અતિમ સંસ્કાર કર્યો હતો. વૃદ્ધિસાગરસુરિ યુરૂતી નેમ આ લક્ષ્મીસાગરસ્કૃતિએ પણ, અતિમ સમયે રાજનગર, રાધાનપુર, પાઠણ, ખંભાત, અહિનપુર વિગેરે નગરોના ભંધોને તથા વટપદ દર્ભાવતી (ઉભોઈ), લક્ષ્મીય વિગેરે એજ રથનોમાં વસતા આવડાને ધર્મલાલ કહેનરાયા હતા; તેમાં વટપદ નગરના આવક-સંબનો પણ ઉલ્લેખ છે.<sup>૪</sup>

- ૧ “તે શુદ્ધને સુપસાયે આવ્યા, આર્ડ્ઝક ઋષિ ગુણવંન. ૧૧  
સત્તર સત્તાલીસે ચૈત્ર, સુરી તેરસ શશિવારે;  
પૂર્વશાલ્યુની દ્વજયાગે, લધુવટપદ મભારી રે. ૧૨  
એમ ચોગણીસમી ઢાલ ધન્યાશી, જ્ઞાનસાગર કહી નેહે;  
ધવલ ધોંગ જોડીની સાનિધ્ય, દિન પ્રતે હોલત ગેહ રે. ૧૩  
—નૈન ગુર્જી<sup>૨</sup> કવિત્રે (ભા. ૨, પૃ. ૭૬-૭૭)
- ૨ “એક દિન સુત સંધાતે લેધ, તિંદંથી તે નીસરીયા;  
વડ વખતે વટપદમાં આવ્યા, શુભ શુણ્ય—રથણે તરીયા.”  
—લક્ષ્મીસાગર સુરિ—નિર્વાણ રાસ (એ. નૈન રાસમાણા ભા. ૧, પૃ. ૧૬૬ )
- ૩ વૃદ્ધિસાગરસુરિ અને લક્ષ્મીસાગરસુરિના નિર્વાણરાસમાં એનો ઉલ્લેખ છે.
- ૪ “અપાણ રાધાનપુર વલી વટપદ નથર વર એહ. <sup>૫</sup>  
ધર્માહિક પુર બંહિરદી નગર અનંદ બહુ ગમિ; ધર્મલાલ પહોગાડયો લેદ અહાં નામ.”  
—દીપ્સૌકાન્યે રચેલા વૃદ્ધિસાગરસુરિ—નિર્વાણરાસમાં (એતિહાસિક રાસસંગ્રહ ભા. ૩,  
પૃ. ૭૧ અ. વિ. અ.).

## વટપદ(વડોદરા)ના ઐતિહાસિક ઉલ્લેખાં .. ૧૬૫

નિ. શ્રી. ૧૭૫૫માં વિજયદશમાં વટપદ(વડોદરા)માં પાર્થીનાથના પ્રસાદથી ત્યાંનાયક વિજયરતનસુરિના અધિકાર સમયમાં ગોડીદાસ નામના આવક કવિએ ૨૪ દાણામાં ૭૮૧ શ્લોક—પ્રમાણું નવકાર-રાસ રચ્યો હતો. ૧ વિક્રમની કવિ ગોડીદાસ તેરની અદીમાં તપાગચ્છમાં થઈ ગયેલા દ્વારાદ્વારા રચેલી નવકાર-રાસ શ્રાવકપતિકમણુસુત્ર-વૃત્તિ, જે વંદારુવૃત્તિ નામથી એણાખાં છે, તેમાં સંસ્કૃતમાં જણાવેલી નવકાર-પ્રભાવની રાજસિહ-રતનવતી વિગેર કથાને ઉપર્યુક્ત રાસ દ્વારા યુજીરાતી ભાષામાં કવિતાર્થે ઉતારવાનો પ્રયત્ન થયો છે.

“વટપદ ને હર્ષાવતી ભર્ય છે તિમ વર્તી x x x x x

ધત્તચાહિક વરક્ષેત્રમાં ભાવક ને વસે, તેહને તુમે ધર્મદ્વાલ કહેલે અતિરસે.”

—પં. સુમતિવિજયના શિષ્ય ચાચક રામવિજય રચેલ ભક્તમીસાગરસુરિ—નિર્વાખરાસ (શ્રી. જૈન રાસમાણ ભા. ૧, પૃ. ૨૦૮ અધ્યાત્મમાન પ્રસારક મંડળ કુદ્રિ. અ. ૨૪—ત્યાં ડિંપણુમાં વટપદને વડનગર નામથી જણાવવામાં ભૂત થઈ છે).

૧ “હુમ ને નવ પદને ધ્યાવે, તે નિષે શિવ-પદ પાવે હો; ધિ  
મન-કામિત પૂરે આસ, હુમ પદાણે ગોડીદાસ હો. ૧૫

\* \* \*

દાસ ચોલીસ પૂરી થઈ, શ્રીગૌડી ગિરણ ગાને રે;

સફલ સી(સ')ધ મંગલ કરો, હિન દિન અધિક દિવાને ૧૬ ગિ.

\* \* \*

સુવિહિત ગચ્છ-રથણુયર, શ્રીવિજયપ્રભ ગુર ઈશ રે;

તાસ પદોધર જગ-જયવંતા, શ્રીવિજયરતન સુરીસ રે. ૧૭ ગિ.

તેઠ તણે રાને એ રચીયો, નવપદ-રાસ રસાલ રે;

ઇહ લખ પરલખ સુખનો દાતા, નિત્ય નિત્ય મંગલ-માલ રે. ૧૮ ગિ.

પદસે હૃપરિ પંચ મનોહર, બાથ ગુણ-મણિ-માલા રે;

ભવિજન-માનસ-કંઠ સોહિના, હીસે બાધ અમાલા રે. ૧૯ ગિ.

અક્ષર-ગણના અંધે કાધી, લો(શ્લો)ક હુઆ સુઅહાય રે;

સાતસો ને ઉપરિ એકાદસી, લખતાં સોહિદો થાય રે. ૨૦ ગિ.

સંવત સતતર પંચાયને, આસો સુહિ દરશી કુજાર રે;

વટપદ પાસ-પસાડલિ, રાસ રચ્યો નવકાર રે. ૨૧ ગિડાણ.

કલસ.

એ રાસ નવ પદ ભાગે નિસુણે, મંગલ-માલા તસ ભરે;

નવ નિષ્ઠ ઝાંખી સભુંખી લીલા, કુવસ-કમલા તે વરે.

શ્રીવિજયરામી વિજયમુહુરત, રાસ રચ્યો અતિસુંદર,

પ્રભુ પાસ ગોડીદાસ પદાણે, સફલ સિં(સ')ધ-મંગલકર. ૨૨

ઇતિ શ્રીપદપત્રમેષી મહામંત્ર નવકાર-રાસ સંપૂર્ણ. શ્રીપાર્થીનાથપ્રસાદાતું શુલ્ષ ભવતુ.

[સં. ૭૭૪ વર્ષમાં શ્રીતિવિમલ-શિષ્ય કનકવિમલ-શિષ્ય લ્લર્ણિમદ્ય વિરપુરમાં લખેલી વડોદરામાં પ્રાચ્યવિદ્યામંહિરમાં રહેલી ૨૭ પત્રવાળી ચોથીના આધારે]

## ૧૬૬ .. સુવાસઃ : આવણુ ૧૬૬૪

અચલગઢમાં થઈ ગયેલા કવિ ન્યા(જ્ઞા)નસાગરે વિ. સે. ૧૭૨૬માં સૌખ્યપુરમાં  
સિક્ષયક-માહાત્મ્ય વિષય પર શ્રીપાલનૃપની ચોપાઈ રચી હતી, તેની એક પ્રતિ વિ. સે.

**ભીજ ઉલ્લેખો** ૧૭૭૦ વર્ષે ભાડ. શુ. ૧૫ વટપદનગરમાં લખાઈ હતી, તે હાલમાં  
લાવનગરમાં નૈનલાલારમાં છે.

તપાગઢના અધિપતિ વિજયકુમારસુરિએ વિ. સે. ૧૭૭૪માં પોતાની આજામાં રહેલા  
સાધુઓને જૂદા જૂદા સ્થાનોમાં ન્યેષિસ્થિત(ચોમાસું રહેલા)ના જે આદેશપદ્ધો (આજાના  
પક્ષા-કુરમાને) આયો હતા, તેમાં પ. લખિધવિજય ગણિને વડોદરાને ક્ષેત્ર કુરમાવામાં  
આયું હતું.<sup>૧</sup>

વિ. સે. ૧૭૮૦માં પોષ શુ. ૫ શુક્ર વટપદનગરમાં કુતુઅપુરમાં પ. કાંતિવિજયગણિએ  
રસતરંગિશીવત્તિની પ્રતિને પોતાના વાચન માટે લખી હતી.<sup>૨</sup>

જેના પ્રાચીન મંડપનું પહેલાં કવિ વિનયવિજયે કરેલું વર્ણિત ઉપર દર્શાવેલું છે, શ્રીમતં  
સરકુર ગાયકવાડનો રાજ્ય-ધ્વજ લગવો ઝડો જ્યાં કરેલું છે, તે રાજધાની વડોદરાને

**શ્રીપીલાળશરાવના સુપુત્ર શ્રીમતં દામાળશરાવ મહારાજાનો સન**  
**વડોદરાનો માંડવો** ૧૭૩૪=વિ. સે. ૧૭૬૦માં સ્વાધીન કર્યા પછી ત્યાં એ વર્ષમાં-વિ. સે.

૧૭૮૨માં તેમની આજાથી આ વટપત્તન (વડોદરા)ના અધિપતિ  
(અધિકારી) ધીર સુયુક્ષ્માન કૃપાવંત શ્રીમદ્દહાર(માલ્હોળ)એ અત્યંત મનોહર લોકપ્રિય મંડપ  
(માંડવા)ને સારી રીતે-સુંદર કર્યો હતો.-એમ ત્યાંના સં. શિલાલેખ પરથી જણાય છે.<sup>૩</sup>

વિકલ્પની અદ્દારમી સહીના ઉત્તરાધ્માં વિદ્યમાન વિ. સે. ૧૭૭૩, ૧૭૯૫માં પારણ,  
રાજનગર વિગેરમાં રહી ચોનીશા-સ્તવનાદિ રચના કરનાર અને વિ.  
**પ. જિનવિજયનું** સ. ૧૭૯૮ માં પાદરામાં સર્વગ્રસ્થ થયેલા નૈનલેખ. તપાગઢના કવિ  
**આગમન** જિનવિજય વિ. સે. ૧૭૮૭ લગભગમાં વડોદરામાં પદાર્થ હતા.<sup>૪</sup>  
(ચાલુ)

૧ નૂંથી જૈનસાહિત્યસંરોધક ખં. ૧, અં. ૩, પુ. ૨૦૭ ક્ષેત્રવાદેરાપદ્ધક ૧

૨ પ્રશાસ્તિસંશોધ લા. ૨, પુ. ૨૬૭

૩ [પ. ૨] “શ્રીપીલાળિનૃપોદ્વકો વિજયતે દામાજિસંહો રૂપઃ ।

[પ. ૧૩] શ્રીમાન् દામાજિસંહો નિખિલનૃપવર: સ્તાવ્ચિરાયુ: સ ચાચં ॥

[પ. ૧૭-૧૮] તસ્યાઙ્ગપરિપાલકો નરવરક્ષાતુર્યરત્નાકર: શ્રીમલહાર:

[પ. ૧૦] તેન શ્રીવિષ્ટપત્તનાધિપતિના ધીરેણ સમ્યક્કૃત:

શ્રીદામાજિનૃપાક્ષયા સુશચિરો લોકપ્રિયો મંડપ: ।

મલ્હારેણ સુદુર્ધિનાત્ર જગત: કાશ્યપાથોધિના

[પ. ૨૪] સ્વસ્તિ શ્રીચૃપવિકમક્રસમયાદાતે શિવે વત્સરે

દ્વાર્થકાદ્રીદુમિતે[ડ]ષ્વારાણરસભૂયુકે[ડ]થ શાકે શુમે...”

[વિ. સે. ૧૭૯૨-શક સં. ૧૬૫૮=ઇ. સન. ૧૭૩૬]

— અન્યુચલ રિપોર્ટ-ડા. આર્કિઓલોજી, અરોડાસ્ટેટ ૧૬૩૮-૩૫ (પુ. ૨૨)

૪ “અમ્ભુર ચોમાસું કરીને, વિહાર કરે મુનિરાયળ, ગામ નગર પાવન કરતાં, વડોદરે ગુરુરાયળ;  
ધ્વજ ધન્ય એં ગુરુ જગે જયકારી.”

—૫. ઉત્તમવિજય રંધેલ પ. જિનવિજયનિર્વાલુરાસ (ચૌ. જૈનરાસમાળા લા. ૧૬૧, પુ. ૧૫૦)

આધુનિક નેપાળનો સાંયચિત્રાતા, સાહુસશિરોમણી, નરકેસરી

## રાણી જંગભાઈ

ચીમનલાલ સંઘડી

[ અનુસંધાન ગતાંક પૃ. ૧૪૦ ]

રાણીએ જંગને વડો-પ્રધાન બનાવ્યો, પણ રાજને અનુમતિ આપવા ના કહી. તેણે જંગ અને રાણી પાસે ગઢ રાતે રેડાયલ ખૂનનો હિસાય માર્યો. રાણીએ તીક્ષ્ણતાથી કહ્યું, “ને પૂછવા જરૂર તો હવે જે લોહી રેડારે એની આગળ આ લોહી તો કશીની વિસતમાં નથી.” રાજ બિચારો હતાશ બની ગયો. તેણે યાત્રાના બહાને કાશીનો રેસ્ટો પકડ્યો. પણ પાટનગરની અહાર તો રાજનો માર્ગ ભેલટો મોડેણો બનશે માની જગે તેને યુક્તિથી પાછો વાલ્યો.

ભીજનજ હિસથી જગે પોતાના પક્ષને મહભૂત બનાવવા માંડ્યો. રાજકુમારેના રક્ષણને માટે તેણે રાણીને શંકા ન જય એ રીતે સુયોગ્ય વ્યવસ્થા કરી, લશ્કરમાં પોતાના પક્ષનાં માણુસેની ભરતી કરી, જવાઅધાર હેઠાએ પર યુક્તિથી પોતાનાજ પક્ષકારે કે સંબધીએને ગોઠવવા માંડ્યા. જંગની પ્રતિભામાં અંગયલ રાણી તેને પોતાનાજ માની તે જે ફેરફાર કરે તેને અનુમતિ આપવા લાગી.

પણ થોડાજ વખતમાં જંગ ઉધાડો પડી ગયો. રાણીએ તેને પાટવીકુંવર અને તેના ભાઈનું તત્કાળ ખૂન કરાવી પોતાના પુત્રને રાજગાહાએ બેસાડવાનો આચ્છા કર્યો ને જંગે એવા અધર્મમાં ભાગ લેવા સીધી ના સંભળાવી. છંદેઝાયલ રાણી વધારે ઉસ્કરાદ. તેણે જંગનું ખૂન કરાવી હવે એવા માણુસને વડો-પ્રધાન બનાવવાનો નિશ્ચય કર્યો કે જે પોતાના પુત્રને ગાદીએ બેસાડવાનું પહેલેથી લિખિત વચન આપે. વીરધજ નામનો એક યુક્તિમાન છતાં તીક્ષ્ણ મહરવાકાંક્ષી પુરુષ એ વિરલ પદની લાલને રાણીની અધ્યાત્મિક શરતો સ્વીકારવાને પણ તૈયાર બન્યો. રાણીએ તેની સાથે મળી જંગના ખૂનની યુક્તિએ રચા માંડી.

પણ જંગનું ભાગ્ય બળવાન હતું. ખૂનની ડેટલીડ ચોજનાએ નિષ્ઠળ ગઈ, તો ડેટલીક પડતી મૂકાઈ. આખરે જંગના સંઘ્યાંધ વિરોધીએની સહાયથી રાણી અને વીરધજને જંગને નાનકડા યુક્તિમાંજ હેમા દેવાની યુક્તિ વિચારી. પણ તે અમલમાં મૂકાય તે પહેલાંજ તેને પકડી પાડી નંબે વીરધજની સાથે તેના મહદ્દગારેનો પણ વધ કરાવી નાખ્યો ને રાણી પર પોતાના અને પાટવીકુંવરના ખૂનના પ્રયાસનો આરોપ મૂક્યો.

રાજ અને કુંવર બંને તો રાણીથી ડરતા હતા. પણ જંગનો ટેક મળતાં તેઓ ઉત્સાહી બન્યા. તેમણે સંયુક્ત સહીથી એક આજાપત્ર અહાર પાઠયું કેમાં રાણીને, તેના અમર્યાહિત ખૂની પ્રયાસના પરિણામે, તેની સત્તા છીનવી લઈ, દેશની શાંતિ અને તેની મનશુદ્ધ માટે દેશનિકાલ થઈ, કારીમાં વસવાની સજ ફરમાવવામાં આવી.

દુર્ઘટા છતાં મનરસી રાજને પણ એજ પ્રસંગે પોતાનું રાજપદ કાયમ રાખી કારી

## ૧૬૮ .. સુવાસ : શ્રાવણ ૧૯૬૫૪

નિવાસની ઈચ્છા દર્શાવી. જંગે તેને વાર્ષી પણ તે ન માનતાં તેને પણ, રાણી સાથે કોઈ કાવત્રામાં સામેલ ન થવાની ચેતવણી આપી, કાશીએ વળાયો. પણ ઘેલો રાજ થોડાક દિવસ કાશીમાં ગાળી પાછો નેપાળને માર્ગે વળ્યો.

પણ એ સમયે રાણીએ, તેના ભળતિયાઓએ ને જંગના વિરોધીઓએ તેને જંગની સામે કાવત્રામાં સામેલ થવા લલચાયો. રાજ ઇસાઈ પડ્યો. નેપાળની સરહદ પર જવણી જમાવી, કાવત્રાંબાળેની પ્રેરણ પ્રમાણે, નેપાળની નિનેરીમાંથી જ ભલેલ નાખુંની મહાંથી તે, જંગની સામે ધર્સી જવાને, સૈન્ય એકત્ર કરવા માંડ્યો.

જંગને આ સમાચાર મળી ચૂક્યા હતા. તેણે રાજને તરતજ પાટનગરમાં પાછા ફૂરવાનો વિનંતિપત્ર મોકલ્યો. પણ રાજએ તે ન ગણુંકારતાં ઉલંડું એ મારાઓને પોતાની વિભિત્ત આજ્ઞા સાથે જંગનું ખૂન કરવા મોકલ્યા. એ મારાઓ જંગના જસુસોના હાથમાં પદ્ગાધ જતાં તેમણે ખૂનનું કાવત્રું કખૂલી તે સંઅંધી રાજનો આજ્ઞાપત્ર રણું કર્યો. જંગ એ જાત્યાપત્ર લઈ નેપાળના સૈન્યની સામે ડાંબો રદ્દો અને રાજની આ ખૂની આજ્ઞા તેમાંના ડાઢતે માન્ય છે કે ડમ તે વિષે પુછપરછ કરી. આખા સૈન્યે એક અવાજે એ આજ્ઞાને અસ્વીકાર્ય જણાવી. જંગે તેજ ક્ષણે રાજને પદભષ્ટ જાહેર કરી પાટવીકુંબર સુરેન્દ્રવિહિમને નેપાળનું સિહાસન સોષ્યુન.

આ રીતે શાંત રાજકાનિત પછી જંગે નેપાળના ૩૭૦ જવાઅહાર અમલહારોની સહીથી માઝ મહારાજને એક પત્ર મોકલ્યાયો, જેમાં જણાવવામાં આવ્યું કે, ‘અનેક ખૂની પ્રયોગમાં ભાગ લઈ મહારાજનએ પોતાની માનસિક નાયાદ પ્રદાશિત કરેલી છે. એ સિથિતમાં તેમને નેપાળના સિહાસને ચાલુ રાખવા એ ભયબહેરું હોઈ તેમના પાટવીકુંબર સુરેન્દ્રવિહિમને પ્રણામે પોતાના મુગટમણિ તરીકી સ્વતીકાર્ય છે. મહારાજની ઈચ્છા જે નેપાલ અહાર વસવાની હોય તો તેમને સારું વર્ષાસન આપવામાં આવશે અને જે તેમને પાટનગરમાં વસવું હોય તો તેમની માઝ મહારાજને ગોપ્ય સેવા ઉડારવામાં આવશે.’

પણ હીલો રાજ ન માન્યો. તેણે નષ્ટાંકે પોતાના મુખ્ય સેનાપતિને સામગ્રી સાથે રાજને કાખૂમાં લેવાને મોકલ્યો. એ સેનાપતિએ રાજના લશ્કરને મારી હડાવતાં તેના ખુશામતિયા હાથમાં રાજનો જે કંઈ માલ આવ્યો તે લઈ નાસી ગયા. સેનાપતિ રાજને એક પાટખીમાં એસાડી સન્માનપૂર્વક પાટનગર અટમંડુ લઈ ગયો. ત્યાં તેને નિવાસ માટે એક સ્વતંત્ર મહેલ આપવામાં આવ્યો. પણ છતાં રાજની કાવત્રાાજ ચાલુ રહેતાં એ જ મહેલમાં તેના પર સન્માનનીય નજરકેદારીને ઘોય સખત ટેબરેઅ ઘોઠવાણી.

રાજની આ સિથિત છતાં રાણીએ, તેના મુખ્ય મદહગાર ગુરુપ્રસાદ અને તેના ભળતિયાઓએ જંગના ખૂનને માટે હરેક પ્રયાસ ચાલુ જ રાખ્યા. પણ જંગની કુનેહાયાજીથી એવો એક પણ પ્રયાસ સફળ ન થઈ શક્યો. વિરોધીઓએ મોકલાવેલ મારામાંથી ફેટલાકને જંગે એવી કઢક મળ કરી, તેને એર આપવાનો પ્રયાસ કરનાર ફૂટેલાં હાસદારીઓની તેણે એવી કઢેડી સિથિત કરી કે પછી ગમે તેટલી લાલચો છતાં પણ વિરોધીઓને મારાઓ મળજા જ મુશ્કેલ થઈ પડ્યા. રાણી નિરાશ બની, ભળતિયાઓ વિખરાઈ ગયા. ગુરુપ્રસાદ કટાળીને જંગને શરણે આવ્યો. જંગે તેને લશ્કરમાં ઘોય હોય આપ્યો.

આ વખતે જંગનું ભાગ્ય સેલે કુળએ ખીંદો નોકાયું હતું. શક્તિ અને પ્રભાવ, સમૃદ્ધિ અને સત્તા, વિજય અને ઝર્તિ તેના મુગટમાં મદાયાં હતાં. રાજ તેના હાથમાં રમકું હતો; પ્રાણ તેના પર મુખ બની હતી; તેના વિરોધીએ ઉચ્ચરાઈ ગયા હતા. યથસ્વી પગલે તે નેપાળના ભાગ્યવિધાતાને પહેં ચડી રહ્યો હતો. તેનું મધુર અને સ્વાભાવિક ઔદ્ઘર્ષ પણ તેને તેમાં સહાયક બનતું.

એક વખતે તે પોતાને માટે થાપથલી મહેલની આસપાસ એક સુંદર અગીચો અનાવતો હતો. તે અગે એક માળાની માલિકીની થોડાક એકર જમીનની તેને જરૂર પરી. રાજ્યના ચાલુ નિયમે તે જમીનની આંકણી કરાવતાં તેની ડિમટા ૩. ૭૦૦ રૂ. પણ માળાએ ખરીદનાર સમૃદ્ધિસંપત્ત વડાવજીર છે એ જાણતાં ૩. ૧૫૦૦ માઝા. જંગે એ કખૂલનાં માળાએ ૩૦૦૦ માઝા; ૩૦૦૦ કખૂલનાં ૫૦૦૦ માઝા; તે કખૂલનાં ૫૦૦૦ ઉપરાંત પોતાના સાતે દીકરાએ માટે તેણે અડેક ધર પણ માયાં. જંગે એને પોતાની પાસે બોલાવી, મોદાશથી સમજાવી રૂ. ૫૦૦૦થી તેને સંતોષ પમાડ્યો. માળા જંગનો ચુણુપૂજક બન્યો.

કાઈ પ્રસંગે તે શિકારેથી પાછા ફરતાં તરસ લાગવાથી એક કુપડી સમીપે જરૂર થોબયે. બારણે એઠેલ તાણી પાસે તેણે પાણી માયાં. તોશીના મુખ પર ઉદાસીનતા હતી પણ અજાણથ્યા મુસાફર-મહેમાનને જેતાં જ તેણે રિમતલર્યા જડીને તેને મધુર પાણી પાયું. જંગ તોશીની આદરશુત્તિ પર મુખ બન્યો. તેણે યુક્તિથી તાણી પાસેથી તેની દર્દ્દલરી કથની કઢાવી. ને એ દર્દીને ફૂર કરી, એની કંગાલિયતને પાછી હડાવી, એને અને એના કુંદને સુખમાં રમતું જેયા પછીજ તે મહેલે પાછો ફર્યો.

એક દિવસે નેપાળમાં સૈકાઓથી બયાનક લેખાતા ભાર્ગ પર એક જન લુટાયાના જંગને સમાચાર મળ્યા. આવા અનાવો એ પ્રદેશમાં અને તેમાં પણ એ પન્થ પર તે સામાન્ય થઈ પડ્યા હતા. પણ જંગે તરતજ એ લુટારાએને પકડવાનો, અને એ રસ્તા પર પાકી સહક બંધાવી પ્રજાની સલામતિનો બદોબસ્ત કર્યો.

એ અરસામાં જંગને માથે એક ધર્મસંકટ આવી પડ્યું. બીજા શીખવિશ્વમાં રખુંજિતસિહની હાર પછી તેમનાં મહારાણી ચંદુકુવરને સુનારના ડિલામાં કેદ પૂરવામાં આવેલાં ને રખુંજિતસિહ સંસારત્યાગી-સાધુ બની નેપાળનાં જંગલોમાં ચાલ્યા ગયેલા. કેદ પૂરયલાં મહારાણીને પતિના સમાચાર મળતાં તે અંગેનેની આંખમાં ધૂળ નાંખી નેપાળ નાસી આવ્યાં. રખુંજિતસિહ સાધુ બની ગયેલ હોઈ તેમની પંચાત નહોતી પણ નાસી આવેલાં મહારાણીએ તો નેપાળની સરહદ પરથી રાણું પર પત લખી રક્ષણી ઉલ્લિ માગણી કરી. નેપાળને અંગેને સાથે મિત્રતા હતી ને શીખવિશ્વમાં તો અંગેને મહદુદ્દરાને તે તત્પર પણ બનેલું. છતાં રાજવંશી અતિથિની માગણી તરછોડવામાં જંગને અધ્યમ્ર્ય જણ્યાયો. તે મૂંઝાયો, પણ છેવટે તે સત્યનેજ વળગી રહ્યો. મહારાણીને તેણે દિલાસાપૂર્વી પત્ર લખ્યો અને તેમના સન્માન માટે લાથી, પાલભીએ, સૈન્યની ટૂંકડી વગેરે સામાં મોકલાયાં. મહારાણી માંદાં હોઈ તેમની સારવાર માટે તેણે વૈદો પણ સાથેજ મોકલાયા. થોડાક દિવસમાં તેણો ખાટમંડુ આવી પહેંચતાં જંગે તેમને ધર્ટિત સન્માન આપી, ધર બંધાવવાની આર્થિક સગવડતા કરી આપી રૂ. ૩૦૦૦નું વર્ષસન બાંધી આપ્યું. અંગેજ એલચીએ ખિટિશ શહેનશાહતના એવા અગત્યના અને નાસીકૂટેલા કેદને મંદરવા

## ૧૭૦ .. સુવાસ : આવણ ૧૬૫૪

માટે સુલેહ તૂટવાની જંગને ચેતવણી આપી. પણ જંગ અતિથિધર્મમાં મક્કમ રહ્યો. અંગ્રેજ અધિકારીએ છેવટે મહારાણી કંઈ કાવતું ન જોઈવે એની જવાઅદારી જંગને માથે ઓઢાડી સંતોષ માન્યો.

નેપાળમાં પોતાની સત્તાનાં મૂળ જમી જતાં જંગે પરહેશો પ્રતિ પોતાની દષ્ટિ દોડાતી. ગોરી પ્રજાનું રાજકારણ, તેનો સ્વભાવ, તેની સ્થિતિ વગેરેનું નિરીક્ષણ કરવાની ને તે પ્રજા પર છાપ પાડી તેની સાથે મિત્રતા બાંધવાની તેને ધણા સમયથી લેંશ હતી. તે હેંશ પૂરી પાડવાનો હવે તેને અનુકૂળ અવસર જણાયો. ખિટનાં મહારાણીને નેપાળની મિત્રતાની ખાતરી આપવાના ને બંને પ્રજાઓ વર્ચ્યેના સંબંધને વધુ ગાઠ અનાવવાના બદાને તેણે ઈંગ્રેજ જવાનો નિર્ણય કર્યો. ને થોડા જ સમયમાં યોગ્ય સાધનસામગ્રી ને રસાદા સાથે તે મુસાફરીએ નીકળી પડ્યો.

કલકત્તા સુધી જમીનમાર્ગ અને ત્યાંથી યોગ્ય સ્થળો જોતાં જળમાર્ગ ઈંગ્રેઝ પહોંચવાનો તેનો ક્રમ હતો. કલકત્તા, મદ્રાસ, ડેલ્વાલો, ગોડાન વગેરે સ્થળો અંગ્રેજોએ તેને સ્વતંત્ર રાખ્યાના રાજવંશી પ્રતિનિધિ સરણું માન આયું. જંગ અનેકવાર અંગ્રેજ અમલદારોના સંસર્જમાં આય્યો. હતો, તેણે નેપાળમાં કેટલાક સુધારા કર્યા હતા, પરહેશની મુસાફરીનું તેણે સાહસ પણ એડચુનું હતું છતાં ગમે તેવા પ્રસંગે પણ એક પણ હિંદુ રિવાજને તિવાંજલિ આપવાને તે તૈયાર નહોંતો. તે ખિટિથ અમલદારોનું સન્માન સાચવતો પણ ડોછની સાથે પાણી શુદ્ધાં પણ પીવા ન બેસતો. જમીન પર જાતર્યા વિના તે જોરાકને સ્પર્શતો પણ નહિ, સ્વીમરમાં ડેણણ દૂધ-દૂધથી જ ચલાવી લેતો. તેણે પોતાની સાથે ગાયો. લીધેલી અને પોતાનાં જ માણુસો કિનાવ ભીજને હાથે તે તેમને દ્રોવા પણ ન હેતો. કલકત્તા, મદ્રાસ વગેરે નગરોની પોતાની નોંધપોથીમાં તેણે નોંધ લાધી છે પણ તે તેમનાં પરહેશો નામે નહિ-કાલિધાટ, ચીનાપદ્ધન વગેરે મૂળ હિંદુ નામે.

એડન મૂકી સ્વીમર સુઅ્યેજને બારે જઈ જેલી. સુઅ્યેજની નહેર સહ્યાભાગે એ વખતે જ્ઞાયલ નહોંતી. પરિણામે જમીનમાર્ગે તેમણે ઈંગ્રેઝમાં પ્રવેશ કર્યો. શાહ અધ્યાસપાશાએ જંગને ઘટિત સન્માન આપી તેને તેજવન્ત આરાય થોડાની એક જોડ બેટ ધરી; જંગે શાહને ચરણે કરતુરીના ધાર ધડ ને એક નેપાળી અનુરદ્ધી વળતી બેટ મૂકી. ધ્યામપતિએ જંગને ઉતારે ખીજી પણ રાજવંશી લેટો મોકલાવી. ત્યાં થોડાક દિવસ થોણી, સત્તાધીરો સાથે મિત્રતા ડળવી, જેવા જેવું લેજ લઈ જંગે હરી સ્વીમરની મુસાફરી શરી કરી. આ વખતે તેને અખર પડી કે પોતાની સ્વીમર પર પણ સ્વીમરનાં માણુસોના જોરાક માટે ગાયો કપાય છે. તેણે તરત જ સ્વીમરના કમાનને પોતાની પાસે બોકાવી જણ્ણાંથું કે સ્વીમર પર જો ગાયો કપાવાની હોય તો તેઓ આ સ્વીમર ખાલી કરી ખીજી સ્વીમર રોકી લેશે. કમાને તરત જ જોવધ બધ કરાવ્યો.

થોડાક દિવસમાં તેઓ માટા થધ ઈંગ્રેઝના સાઉધેમ્પ્ટન બંદરે પહોંચ્યા. બંદરના જડાતી અમલદારોએ સામાન તપાસવાની માગણી કરી પણ જંગને બિનલિનુંદ્યો. પોતાના પવિત્ર સામાનને અડકે એ પસંદ નહોંતું તેમ તેને એ પ્રકારના બ્યવહારમાં માનહાનિ પણ જણ્ણાઈ. તેણે પોતાના છ સૈનિકને ઉધારી તલવારે સામાન સાચવવાની આજી કરી ને અંદરના અધિકારીએને તેણે જણાવી દાધું કે જો તેઓ સામાન તપાસવાની હુક નહિ છોડે

તો તે બીજી જ સ્ટીમરમાં અહીંથી પાછો ફરી જશે. અધિકારીઓએ મુંઝાઈને વડાઅધિકારીને પૂછાયું ને તેના તરફથી અનુમતિ મળતાં તેમણે સામાન તપાસવાની હડ છાડી દીધી. કહેવાય છે કે ઈંગ્લિંડને જંગ પાસેથી જડત નહોતી જોઈતી, તેને તો નેપાળના એ વીરતું પાણી જ માપવું હતું.

જંગ થોડાક હિવસ ત્યાં જ રોકાયો અને પોતાના ભાખસોને તેણે લંડનમાં પોતાને મારે શો બ્યાવસ્થા કરવામાં આવી છે તેની તપાસ કરવાને મોકલ્યા. જ્યારે તેને ખખર પરી કે પોતાને ઉતારો રીચમેંડ ટેરેસ નામના એક ભબ્ય મહેલમાં રાખવામાં આવ્યો છે અને તેને યોગ્ય સન્માન મળવાતું છે ત્યારે જ તે લંડન ગયો.

લંડનમાં મહારાણી વિકેટોરિયાએ થોડા જ હિવસ પહેલાં પુન્તે જનમ આપેલ હોઈ તેઓ પડે હતાં; એટલે તેમની સુલાકાત તરત ન થઈ શકી. પણ બીજી નામાંકિત વિકિયાએ કે મેસ્ટથાએએ જંગને પોતાને ત્યાં નહોંનયાનો લાભ ઉડાવવા માંગ્યો. જંગને એ રીતે જયાત્યાં જવું પસેંદ નહોતું છતાં તેને છન્દિયા ચોપીસ, લંડનનાં મુખ્ય નાટયગૃહો, થોડાડાનું મેદાન, ડ્યુક ઓફ વેલિંગ્ટન ને બીજા કેટલાક સેનાપતિઓ, થોડાક ઉમરાવો વગેરેનાં આમંત્રણ સ્વીકારવાં પડ્યાં.

થોડાડાન મેદાનમાં કેટલાક ઉમરાવોએ હોડતા થોડાએ સામે જોઈ જંગને પૂછ્યું: “આપ આમાંથી કયો થોડા આગળ આવી શકે એમ ધારો છો ? ” જંગ એક તેજસ્વી છતાં અણુધાર્ય થોડા સામે આંગળા ચીધી અને બ્ધાની અન્યથી વચ્ચે એ જ થોડા આગળ આવ્યો.

એક ખૂખ્ખૂરત ઉમરાવણીએ જંગને પોતાને ત્યાં આવવાતું આમંત્રણ આપ્યું, પણ પોતાને સમય ન હોઈ તેણે પોતાના ભાડાઓને ત્યાં મોકલ્યા. ઉમરાવણીએ તો બાદશાહી ઢાઠમાઠી આણુનાં રયલો તૈયાર કરવેલાં પણ જંગના ભાડાઓએ સુરક્ષાલી ટાળવાને ઉમરાવણીના જગમગતા ઇપની પ્રશંસા કરતાં કહ્યું, “અમારાં નયન લરાઈ ગયાં છે, ભૂખ જરીક નથી રહી. ’ ઉમરાવણી કંઈ સમજ ન શકી. પણ પાસે એટલા કેપ્ટને તેને સમજ પાડી કે, ‘તેઓ હિંદુ છે; આપણી રફસેલ વસ્તુઓ તેમનાથી ખાઈ ન શકાય.’ —ત્યારે ઉમરાવણીએ હસીને તેમની પ્રશંસા કરી.

એક હિવસે જંગે લંડનના કેટલાક તથેલાએની સુલાકાત લીધી. તે અસંગે તેણે કેટલાક થોડાએની ખરીદી કરી. ત્યાંની એક ગોશાળામાંથી તેણે કેટલીક ગયો. પણ ખરીદી. એક ટેકાણે આનગી વેપારીના એક તેજસ્વી થોડાએ તેનું ધ્યાન આકર્ષ્યુ. તેણે તેના માલિકને તેની કિભત પૂછી તો તે રૂ. ૧૩૦૦ જાણુવામાં આવી. જંગ થોડા કેવું કૂદી શકે છે એ તપાસવા ધૂઢું પણ માલિક જણાયું કે એ સહેલગાહી થોડા હોઈ જાણું કૂદી ન શકે. છતાં જંગે એ થોડાને કુદાવવાનો આગ્રહ સેવતાં જંગના ભાડાએ હૂર એક ખુલ્લી તરવાર રોપી ને થોડાને તુકશાન થાય તો કિભત કરી આપવાની શરતે માલિક પાસે થોડાને છૂટો મૂક્યો. અધા પ્રેક્ષકાની અગ્નયથી વચ્ચે થોડા તલવાર કૂદાવી ગયો. હવે માલિક મેંધા થઈ તેના રૂ. ૮૪૦૦ માણ્યા. જંગે હસીને કહ્યું, “હવે તો તમને એના રૂ. ૪૨૦૦ રૂપિયા જ મળશે અને તેમાં પણ જે ટીલ કરશો તો કિભત ધીમેધીમે ઘટતી જ જશો.” ગુંગવાઇને ગદ્વાંતલ્લાં કરતા એ અંગ્રેજ વેપારીએ છેવટે રૂ. ૨૧૦૦માં જંગને જ એ થોડા વેચ્યો. જંગે તેને રૂ. ૫૦૦ની અક્ષીસ આપી.

## ૧૭૨ .. સુવાસ : શાબદ્ય ૧૬૬૫

ઓને હિંસે જંગે લંડનની મુખ્ય વ્યાયામશાળાની મુલાકાત લીધી. ત્યાં લંડનના એક અદ્દિતીય મલ્લે પોતાની અનુપમ શક્તિનાં બણુંના કુંકાં જંગે પોતાની સાથેના એક કુસ્તિબાજુને એની સામે અભાડામાં જોતાર્યો અને એ નેપાળીએ ઈંગ્લાંડના મલ્લનાં હાડકાં જોખરાં કરી નાંખ્યાં. જંગે એ મલ્લ ઉપર દ્વા લાલી તેને છોડીક સેનામહોરે બક્ષી.

આ પછી જંગે એક ઓછા ઈંગ્લાંડ, ટેમ્પ્સપૂલ, લંડનનાં દ્વાખાનાં, ખાગઘરીચા, સંગ્રહસ્થાનો, લસ્કરી ટુકડીએ વગેરેની મુલાકાત લીધી. કેટલેક સ્થળે જણાતી સુશોભિત બ્યાવસ્થાએ તેને મુખ કર્યો. તેણે કેટલીક નોંધા ટપકાની લીધી. એ પ્રસંગે તે હિંદના માઝ વાઈસરેચ, ઈંગ્લાંડના પરદેશમંત્રી વગેરેના સંસર્જનાં આવ્યો.

એક દિવસે જંગ અક્રમત માંદ્યા પડ્યો. તે પ્રસંગે તે સમયના ઈંગ્લાંડના નામાંકિત વૈદ્ય સર ઐન્ઝમાનને બોલાવવામાં આવ્યા. ઐન્ઝમાનને સુંદર સારવાર કરી જંગને એ વણ હિંવસમાં જ સાંજે કરી દીધ્યો. જંગે વૈદ્યને ૭૫૦૦ ઇપિયા ખામ્બા માંડ્યા પણ વૈદ્ય પોતાની દીના ૩. ૧૫૦૦ ઉપરાત વિશેષ લેવા ના કહી. આવા ડેટલાક પુર્સોએ જંગના મન પર ઘિર્યન અને તેની પ્રણ વિષે સુંદર છાપ પાડેલી.

આ સમય દરમિયાન મહારાણી વિકોરિયા પ્રસૂતિલબન છોડી અહાર આવી ચૂક્યાં હતાં. તેમની સાથે તરત જ જંગની મુલાકાત જોડવવામાં આવ્યા. જંગે પતિની સાથે હિંવનખંડમાં એટલાં મહારાણીને નમન કરીને બેઠણું ધર્યું. મહારાણીએ વળતાં નમન કરી હસ્તિને જંગનું સન્માન ધર્યું; તે તેની સાથે ખુલ્લા દિલે વાતચીત કરી. જંગને મહારાણી ખૂબ જ પ્રભાવશાળી ને આડર્ચક લાગ્યાં.

ઓને હિંસે પણુ મુલાકાત જોડવાઈ. તે વખતે મહારાણીએ જંગને ખાલકુંવરની સંસકારવિધિમાં હાજર રહેવા આમંત્રણ આપ્યું. જંગે આમંત્રણનો સ્વીકાર કરી પ્રસ્તુગ પર હાજરી આપી. મહારાણીએ તેને પોતાની સનીપ જ બેસાડ્યો. અહીં તે લવિષ્યના જર્મન શહેનશાહ પ્રીન્સ વિલિયમ સાથે સંસર્જનાં આવ્યો. મહારાણીએ જંગને નેપાળની ગ્રાહૃતિક લીલા સંખ્યા પૂછપાછ કરી. તે પછી આલકુંવરની સલામતિમાં દાર્દી રંગરેલ આલી પણ જંગે પોતાનો ખાલો સાથેના ફેફનતે આપી દીધ્યો.

થોડાક હિંસ આદ મહારાણીએ એક જંગી મહેશીલ જોડવી. તેમાં તેમણે જંગને પોતાનો સાથે જ જમવાનો આગહ કર્યો પણ જંગે વિનયપૂર્વક એ રીતે જમવાની પોતાની અશક્તિ દર્શાવી.

તે પછી જંગે મિજબાનીએ કે મુલાકાતો, બેટ કે જુદી જુદી આડર્ચક કળાએ—દરેક રસ્તે લંડનમાં મિત્રાનું જુથ જમાવવા માંડ્યું. મહારાણીનો માનીતો મહેમાન હોઢ અનેકોએ તેની સાથે મિત્રતા ડેળવવામાં ગૌરવ નેલ્યું. પ્રસિદ્ધ સેનાપતિ વેલિંગ્ટન ને મહારાણીના પતિ પ્રીન્સ આલ્યર્ટ પણ તેની સાથે સ્નેહનાં અધતે સંકળાયા. જંગના ભાડાઓએ પાર્લિમેન્ટના મુલાકાત લઈ ત્યાં પણ પોતાની છાપ પાડી. રીતે પર જ્યારે તેમને જંગી મહેશીલ અપાણી ત્યારે થેકરીએ આ નેપાળી મહેમાનેના માનનમાં પોતાની જગવિષ્યાત સન્માનકૃતિના રેચેલી.

છેલ્લે હિંસે જંગે રાણીની મુલાકાત લીધી. તે પ્રસંગે મહારાણીએ તેને સ્વતંત્ર રાજ્યના અધિપતિ ભરીભી વિદાય આપી. ઉમરાવો, ઉમરાવજાહાએ ને મરીઓથાથી ચિકાર હિંવનખંડમાં મહારાણીએ જંગના શૌર્યની, તેની પ્રતિલાની, તેની મભતાની પ્રશંસા કરી. જંગે આ રીતે

નેપાળને મારે ઈંગ્લાંડનું હૈયું જીતું પણ દ્વિત્તા ડમનસીએ તે પોતાનું હૈયું પણ ઈંગ્લાંડને આપતો આવ્યો. મહારાણીએ તેના મન પર ઈંગ્લાંડ એટલે સર્વર્ગખંડ અને તેની ગ્રન એટલે દેવ એવી છાપ પારી દીધી. એ છાપ ઈંગ્લાંડને સત્તાવનના ઘણવા પ્રસંગે કામ લાગી.

ઈંગ્લાંડ છોડી જંગ ફ્રાન્સ આવ્યો. તાં પણ તેને પાદશાહી સન્માન મળ્યું. ફ્રાન્સના પ્રસુએ તેનું ભાવભર્યું સ્વાગત કર્યું; અને જંગની સાથે દૂરી પેરેસ અને ફ્રાન્સનાં જેવાકાયક સંગ્રહરથાનો, કલાભનનો, મહેલો કે બાગઅગીચા બતાવ્યા. મહાન નેપોલિયનની દરગાહની જંગના મન પર ધર્યું જાડી છાપ પડી. નેપોલિયનના ભાઈની પણ તેણે મુલાકાત લીધી. જ્યારે તેને ફ્રાન્સના એક લાખ સૈનિકની વિરલ કનાયત બતાવવામાં આવી ત્યારે તેણે ઊડો સેતોષ ને ફ્રાન્સને મારે મધુર પ્રેમ અનુભવ્યો.

ફ્રાન્સની વિદ્યા પછી જંગ માસર અને એડન થઈ સુધીએ બંદરે ઉત્તરો. અહીં પણ તેનું શાહી સન્માન થયું. અહીંથી તે દારકાની મુલાકાતે ગયો ને ત્યાં પ્રલુચરણે રૂ. ૫૦૦૦૦ની બેટ ધરી. તે પછી રામેશ્વરનાં દર્શન કરી ત્યાં પણ ૫૦૦૦૦ની બેટ મુકી તે ડાલેંઓ થઈ કલકત્તા પહોંચ્યો.

કલકત્તાથી બનારસ પહોંચ્યો ત્યાં તેણે કાશીવિશ્વનાથનું ભાવભર્યું પૂજન કર્યું. અહીં વસતાં નેપાળના માણ મહારાણી અને તેમના દુનરો વર્ષને ચાલતી તકરારનો તેણે નીવેડો આપ્યો. અને પછી તરતજ તે નેપાળને પણ પડ્યો. એક વર્ષની ગેરહાજરી પછી તે ખરમંડુના પોતાના નામાંકિત મહેલ થાપથલીમાં આવી પહોંચ્યો.

જંગ આ રીતે પરહેશથી વિરલ કીર્તિ વરીને આવ્યો છતાં કાવત્રાંધાને હજ જંગ્યા નહોતા. પરહેશમાં તેની સાથે રહેનાર એક સાથીએ શુમ અદ્વા ઉડાડી કે જંગે ખ્રિસ્તિએ સાથે બોજન લઈ હિંદુત્વને કંલડ લગાડયું છે. જંગ જેવા નરસીરને હિંદુ સમાજની અહાર કરવો સંભવિત નહોતો; એટલે તેના ઝૂનતી યોજના રચાણી અને તે યોજનામાં જંગના જ બે લાઈ ઉપરાંત નાનો રાજકુમાર વગેરે સામેશ થયા. પણ એક ભાઈનું હૈયું પીગળી જવાથી યોજના અહાર પડી ગઈ તે કાવત્રાંધાને ડેદ કરી ખિચિશ દરમાં મોકલી દેવામાં આવ્યા.

આ પછી નેપાળમાં જંગ બિનહરીએ બન્યો. તે જ નેપાળનો સાચો શહેનશાહ ગણ્યાવા કાગ્યો. રાણુ સુરેન્દ્રવિઠલે તેના વર્યસ્વથી હંટાળી નિવૃત થવાનો વિચાર કર્યો પણ જંગે તેને યુક્તિથી સિહાસન પર ટકાવી રાખ્યો. પ્રાણમાં તેણે જરૂરી સુધારા કર્યા. કાયદાને વ્યવસ્થિત બનાવી દેશમાં તેણે સુખ અને શાંતિની સ્થાપના કરી.

જંગબાહાડુર સ્વભાવે દ્યાળું છતાં નિર્દ્યતાના ડેસોમાં તે કંક ન્યાયાધીશ હતો. એક પ્રસંગે એક મોચીની સાથે પ્રેમમાં પડેલી ડાઈક સ્વીએ પોતાનું દુષ્યરિન ઝુપાવી રાખવાને પોતાના બાળપુત્રને મારી તેનું જ માંસ પતિને પીરસ્યું. પતિને શક જતાં તેણે તપાસ કરવશવી ને પાપ અહાર આવતાં તે ડેસનો છેવટનો ઇંસ્લો જંગની સમીપ આવ્યો. જંગ આ નિર્દ્યતા ન સહી શક્યો. તેણે તે સ્વીને ભૂખ્યા વાધના પોજરામાં ધક્કલી દેવાની આત્મા ફરમાવી. પણ વાધ એ સ્વીને ન અડક્યો. જ્યારે એને ખૂબ ઉશ્કેરવામાં આગ્યો. ત્યારે તેણે એ ચૂંથી નાંખી પણ દિવસો સુધી ખૂબે માર્યા છતાં એ સ્વીના માંસને તો તે ન જ સ્પર્શયો. જંગને આ પરથી પ્રાણુંનોના સ્વભાવ, તેમની ઝુંધી, તેમની મહત્તમા વગેરે વિષે માન પેદા થયું.

જંગબાહાડુરની વિરલ સેવાથી આકર્ષાઈ નેપાળની પ્રાજ્ઞાએ તેનું સ્મારક ઉલ્લંઘનાની મહેરછા દર્શાવી. જંગે પહેલાં તો વાધી જાડાવ્યો પણ પછી ખૂબ આગ્રહ થતાં,

## ૧૭૪ .. સુવાસ : શાબદી કથાએ

એક હાથમાં તરવાર અને ખીજ હાથમાં ન્યાયગ્રન્થ પહેલી જંગની આરસની પ્રતિમા, તેની અનુમતિથી, ક્વાયતખૂમિ ઉપર ખુલ્લી મૂકવામાં આવી.

આ પછી જંગે નેપાળના રાજકારણમાં પોતાની પ્રતિમા અવિચલ બનાવવાને સુરેન્દ્ર વિઝિમની કુંવરી વેરે પોતાના મેટા પુત્રનાં લખ લીધાં. લખ પ્રયોગ વરની ઉંમર આઠ વર્ષની ને કુંવરીની ઉંમર છ તર્થની હતી. લગ્ન પછી તરત જ રાજકુંવરી પોતાના પતિશૃદ્ધ રહેવાને ગઈ. તે પોતાની સાથે લાખોનો કરિયાવર લાવેલી. એ રીતે જંગની મિલકતમાં પણ અપૂર્વ વધારો થતો ગયો. એ જ મહીનામાં જંગે પોતે પણ સ્વ. વડાપ્રધાન ફેલજંગની પુત્રી ને પોતાના વિરોધી પક્ષના સરદાર ગુરુપ્રસાદની નાની બહેન વેરે લગ્ન કર્યો. બંને લખો પ્રેમ કરતાં રાજકારણપ્રધાન હતાં. એ બનેથી જંગનું બળ નેપાળમાં અદ્વિતીય બન્યું.

આ રીતે આંતરિક એકતા થઈ જતાં જંગની નજર બહારના પ્રદેશો પર પડી. તિથેટની સાથે નેપાળને થોડોક સમય જતાં જગડો જગ્યો હતો. વર્ષો પહેલાં જ્યારે નેપાળ ને તિથેટ વચ્ચે જગડો જગેલો. ત્યારે તિથેટની મહદે ચીનની શહેનશાહીન આવી પહોંચવાથી નેપાળને નમતું મુક્તિ પડેલું ને પોતાનો થોડોક પ્રદેશ ચીનને હસ્તક સાંપ્રેદારી પડેલો. તે વખતે તિથેટ અને નેપાળ બંને ચીનનાં અંડિયાં ગણ્યેલાં. તે પછી કંઈક શાંતિ હતી. પણ થોડોક વખતથી તિથેટના સત્તાધિકારો અને ત્યાં રહેતો ચીનનો એલચી નેપાળી બાપારીઓ અને સુસાઇરાને સત્તારવા માંડ્યા હતા. આ માટે જંગે વિધિસર વાંધો જિહાગ્યો. પણ તેનો કંઈક નિકાલ ને આવતાં તેણે યુદ્ધનો આશ્રય લીધો. ચીનમાં આ સમયે આંતરિક જગડો ચાલેલો હોઈ ત્યાંથી તિથેટને મહદે મળ્યા સંબંધિત નહોતી. એટલે જંગને આ યુદ્ધમાં પાછલું કંલંક ભૂસી નાખવાની પણ આશા અંધાઈ.

તેણે તરતજ લશ્કરમાં જરી વધારો કરી તેમના હાથમાં અલિનવ શાંકો મૂક્યાં. હેરે કુકરી પર તેણે વિશ્વાસુ અને વિર સેનાપતિની નિમાયુક્ત કરી. લશ્કરી સ્વયંસેવકોની દુકુંઝીઓ પણ જેતનેતામાં ભેટી થવા લાગી. સર્વને નેપાળની વિજયધ્યન ફરકાવતી હતી. શરૂઆતમાં તો તિથેટ સામનો કર્યો પણ તેનું બળ છેવટે બટવા માંડ્યું. નેપાળના હાથમાં તિથેટના કિલવા, થોડાઓ, લશ્કરી સરંજનમને સમૃદ્ધ આવવા લાગ્યાં. એક ડેકાણુથી ૪૫ મણું તેનુંઠુરી ( સોનાની રેતિ ) મળ્યો આવી. ચીનની મહદે ન મળ્યો શકવાથી તિથેટ છેવટે નરમ પડી સલાહની માગણી કરી. ને નેપાળે દશ હજારની વાર્પિક અંડણી, તુકશાનનો બદલો વગેરે લઈ તિથેટની સાથે મિત્રતાના કરાર કર્યો.

આ રીતે સર્વત્ર વિજયી બનેલ જંગે હવે પોતાના ભાઈની તરફેણુમાં નેપાળના પ્રધાનપદેથી રાજુનાસું આપ્યું. પણ નેપાળી પ્રજાને એ ન રહ્યું. તેણે જંગને એ પદ સાચવવા ખૂબ આશ્રય કર્યો. પણ જ્યારે જંગે ન માન્યું ત્યારે તેમણે જંગને સુરેન્દ્રવિઝિમની અનુમતિથી, કશ્ય અને લાંબાંગ નામે એ પ્રાન્તનો સ્વતંત્ર રાજ બનાવ્યો; તેને મહારાજનો છલકાય અક્ષયો; નેપાળના સર્વસત્તાધિકારીના તેને અધિકાર આપ્યા; નેપાળપતિને પણ કલાજમાં રાખવાની તેને સત્તા આપી ને નેપાળના વડાપ્રધાનનું પદ તેના વંશમાં કાયમ બનાવ્યું.

એકાદ વર્ષ જુદી પ્રધાનપદ લોાગવી જંગનો ભાઈ અવસાન પામ્યો. તે પછી જંગે હરી એ પદ અંબાળી લીધું. પણ હવે તો તે નેપાળનો અરેખરો ચક્રવર્તી સાંઘાર અની ગયો.

આ અરમામાં હિંદુમાં સત્તાવનનો બળવો ફાડી નીકલ્યો. દુંગાંડ જર્દ આંદ્યા પછી જંગે પોતાનું હેઠું તો ખિટનને ચરણે ધરી દાઢું હતું. બળવાના સમાચાર મળતાં જ તેણે

પોતાની શક્તિ અને સત્તા, સૈન્ય અને સમૃદ્ધિ અંગ્રેજેની સેવામાં ધર્યો; છ હનરના ગુરખા સૈન્ય સાથે તે હિંદી જુવાળને કચરી નાંખવા હોડી આવ્યો. પણ વાઈસરોયે તેની સેવાનો અસ્વીકાર કરતાં તેને વીલા મુખે પાછા કુરવું પડ્યું. એ સમયે ડેટલાક સ્વદેશ-ભક્તોએ તેને કચરી નાંખવાની ચોજના ઘડી પણ યુક્તિબાળ નગ સહેલે બચ્ચી ગયો. ને અંગ્રેજે ન્યારે હિંમાં અરેખર સપદાએ ગયા ત્યારે જંગ હરી તેમની મહદે હોડી આવ્યો ને પોતાની અનુપમ સેવાથી પડતા બિટિશ સામ્રાન્યને તેણે બચાવી લીધું.

તેની એ સેવા અનેકવિધ હતી. ડેટલેક ટેકાણે તેના સૈન્યે બળવાખોરાને પાછા હુદાવ્યા તો ડેટલેક સ્થળે અંગ્રેજમિનોને શ્રદ્ધારો રહ્યો; ડેટલેક ટેકાણે તેમણે કલા ચલાવી તો ડાઇક સ્થળે લુટફાટ પણ કરી. ઝનૂની બળવાખોરાની સામે તો જંગ અંગ્રેજેને દેવહૃત સમે થઈ પડ્યો. ડેમકે તેનું સૈન્ય હિંદી યુક્તિબાધી પરિચિત હતું ને બળવાખોરા અંગ્રેજેને સામે લડે એવા ઝનૂનથી તેની સામે લડી શકતા પણ નહિ. ડેટલાક હિંદી રાજયોને પણ અંગ્રેજેના પદ્દે બેસાડવામાં તેણે મહદુંનો લાગ લઈયો. ઔધના નવામે તેને બળવાખોરાને પક્ષે બળવાની કરેલ વિનિતિના જવાયામાં તેણે તે નવામને અંગ્રેજેના ચરણે જધ ફળવાની દીઘેલી સલાહ કરસણાજનક છે. અંગ્રેજેને તેને એ મદહોને તાતકાલિક અફ્લેન્સ પણ આપ્યો. લખનૌની ડાયનેસ્ટર જંગી લુંટમાં જંગને અને તેના સૈન્યને લાગ પડાવવાની છૂટ આપવામાં આવી. કરોડાનું જવાહિર, કિમતી કાપડ, અગણિત નાણું, સેનાચાંદીનાં વાસણો, અમૃત્ય કલાસામચી અંગ્રેજ-ગુરખા લૂટારાયોના હાથમાં જધ પડી. બિચારા લડાયક ગુરખાઓને તો અમૃત્ય વસ્તુઓનું જીાન પણ નહોંનું. મોતાની માળાઓમાંથી સોનાના તાર એચી લેવાને તેમણે લાખોની કિમતનાં મોતી રસ્તે વેરી નાંખ્યાં; અમૃત્ય રતનકંદ્લોને બોંધ પર પાથરી તેઓ તેના પર આણોટવા લાગ્યા.

હિંદી બળવાની આ રીત વોર જોદી વિજયી જંગ નેપાળ પાછો ઇઝો. અંગ્રેજેને તેને પોતાના લાડીલા સહાયક તરીક અભિનંદનના સહેશા મોકલ્યા. હિંદી વાઈસરોય લોર્ડ ડનિગે જંગનાં ગુણુગાન કરતો પત્ર લખી, તેનો અનુપમ સેવાના અભલામાં, નેપાળનો ને થોડાક પ્રદેશ બિટિશ હિંમાં બેળવી હેવામાં આવ્યો. હતો તે તેને પાછો સોઝો. બિટનના સત્તાધીશોને લાગ્યું કે કચરાયલ નેપાળ કરતાં સ્વતંત્ર નેપાળ તેમને વધારે લાલદાયી છે. પરિણામે નેપાળને તેમણે સન્માન્ય મિત્ર રાન્ય તરીક કર્યાયું. બિટનના મહારાણીઓ જંગ પર લારેમાં ભારે છિકાખોની નવાનેશ કરી. મહારાણીના પતિ પ્રીન્સ આલાર્ટે અભિનંદનપત્ર લખી તેની પ્રશંસા કરી.

બળવાની નિષ્ઠળતા પછી બળવાખોરામાંના ડેટલાક નેપાળની સરહદમાં ભરાયા. બિટનના મિત્ર તરીક તો જંગ એ બધાને અંગ્રેજેને સોંપી દેત પણ હિંદુઓનો પવિત્ર અતિથિધર્મ તેનાથી છોડાય એમ નહોંનું. ઔધના નવામ અને તેની માતા કેવી ડેટલીક વિશિષ્ટ વ્યક્તિઓને તેણે વર્ષાસન બાંધી આપ્યું, ડેટલાકને નિવાસની ગાડવણું કરી આપી, તોઝાને ચડચા એને પૂરા ઝર્યા, ને ને લેકા ઝાજદારી રીતે ચુન્હેગાર હરતા હતા, તેમને તેણે અંગ્રેજેને સોંપી દીધા. બળવાખોરાના હાથમાં ડેટલાક અંગ્રેજ ડેદીઓ હતા તેમને તેણે મુક્તિ આપવી.

જુના ભારતીય રાજ્યાઓની જેમ જંગ ધર્યી વખત શુસ્તેશે નગરની નવાજૂની જાણવા નીકળતો. એ પ્રસંગે ડાઇ શુસ્ત વીરે, સાચા સેવકો કે દેશભક્તોનાં ભાગ્ય ખૂલ્યી જતાં,

## ૧૭૬ .. સુવાસ : આવણ ૧૯૯૮૫

ન્યારે દ્રોહીઓ અને દુલ્હિઓના પણ ચીરાઈ જતા. ડેટલોક વખત તે જુગારખાનામાં જઈ જતો. અને પોતે પણ ગુમરાતે રમના બેસી જતો. એવાં સ્થળ તેને ધણું જણવાતું મળતું. તે જીત પણ સહેલાધથી મેળવી લેતો. એક દિવસે તેણે એક જ રમતમાં ઇપિયા ૨૫૦૦ મેળવેલા.

હિસેક પ્રાણીઓના શિકારને તેને વિશેષ શોખ હતો. તે માટે અનેક વખતે તે જીવલેણ સાહસોમાં પણ ઝપલાવતો. ધણી બેળા તે બાઈને પ્રધાનપદ સૌંપી દિવસોના દિવસે જંગલમાં ગાળતો. એ સમયનાં એનાં સાહસો એવાં રોમાંચક છતાં એટલી સંઘામાં છે કે તે અધાર્તાની નોંધ ધણી લાંખી થઈ પડે.

સાહસી હેવા સાથે જ તે સાહિત્ય અને કલાનો પણ એટલો જ પૂજક હતો. સાહિત્ય-કારો અને કલાકારોને તે અવનવાં ઉત્સેજન આપતો. તેણે તે પ્રહેણનાં પંખીઓ અને પણુંઓની જુદી જુદી જતોનાં તેમનું કુદરતી લીલાનાં લેવરાવેલ ચિત્રો હજુ પણ સચ્ચવાઈ રહ્યાં હો. ગ્રન્થલંડારો પણ તેને અતિ પ્રિય હતા. રોળના સુખ્ય ગ્રન્થલંડારમાંથી ગોરા વિદ્ધાનોએ અસુક અલઘ્ય પ્રનો પચાવી પાડ્યાના સમાચાર મળતાં જ તે ઉસ્કેરાઈ ગયેલો. તેણે કાઈ પણ ઉપાયે એ અન્ધો કે તેની નકલો મેળવવાનો આગહ કર્યો. અને ગુમ થેવેલમાંથી ધણુંખરાની નકલો તેણે એ રીતે પાછી મેળવાવી પણ લીધી. તેમાં ડેટલાક તાંત્રિક અન્ધો, સુદ્રારાકસ, સિક્ષાન્ત દીપિકા, ચુલ્લ સમાજ, મેધસૂન, વજસૂચિ, વરાહમિહિરકૃત ન્યોતિષ વગેરે સુખ્ય હતા.

તેનો સ્વભાવ પણ એટલો જ ઉદ્ઘાર હતો. તેણે બ્રાહ્મણોને દાનમાં હજારો ગાયો આપી, સુવર્ણનો રથ આપ્યો, રતધેનું આપી. નાનાં છોકરાંઓને સાહસિક હરિદ્વાઈઓમાં પ્રેરી તે તેમને સુંદર છનામો આપતો. એક પ્રસંગે એક ગરીબ કાશુલીનું કાપડ ઘપતું નહોનું ને તે બિચારાને દેશ પાછા જરું હતું, તે વખતે જંગ પોતાને જીનજરરી છતાં તેનું અધું જ કાપડ ઘરીહી લોમેલું. નેપાળના ડેટલાક દેવાલયો સૈકાઓથી જર્ણું થઈ રહ્યાં હતાં તે તેણે ચીનથી કુશળ છજનેરો એવાની લાખોના ખર્યે સમાવી હાથાં. એક પ્રસંગે તે હરિદર છત્રના મેળામાં ગયેલો. ત્યાં વેપારીઓને અટાવવા તેણે એક જ રાતમાં રૂ. ૩૫૦૦૦ ની ચીજેની અરીદી કરી.

તેની ન્યાયપ્રિયતા પણ એટલી જ ઉજાવળ હતી. એક શહેરીએ તેના પિતાને ચોવાશ વર્ષ પૂર્વે, તેની ગરીબ સ્થિતિમાં, ગુમ રીતે, રૂ. ૨૩૦૦ આપ્યા હોવાની વાત કરી ને જણે તરત જ તેને વ્યાજ સાથે તે નાણું ચૂકુવી આપ્યાં. એક ગામના જમીનનારે ન્યાયધીશને ફાડી એક ડેસનો ચુકાદો પોતાની તરફેખુમાં મેળવેલો. જંગ તરત જ ત્યાં જઈ પહોંચ્યો ને જાડા તપાસ કરી જમીનનાર દેખિત જણ્ણાતાં તેનો દંડ કર્યો, નિર્દેશને અદ્દેલા આપ્યો, ન્યાયધીશને નાળિયેર પરખાયું. મહારાણા સુરેન્દ્રવિક્રમે એક નિર્દેશ અમલહારનું અપમાન કરતાં તેણે મહારાણુની પણ ધૂળ કાઢી નાંખી. સત્તાવનના દીર સેનાપતિ નાનાસાહેભનાં નેપાળમાં વસતાં મહારાણુને એક જરૂરીએ તેમની એ હોરાની અંગડીઓના વેચાણુમાં છેતરેલાં. જંગને એ સમાચાર મળતાં જ તેણે જરૂરીનો દંડ કરી મહારાણુને યોગ્ય અદ્દેલા અપાય્યો. એક સ્થળે એક ખીને રડતી જોઈ તે તેના ઊડાખુમાં ભિતર્યો અને તેમાં ખીના ધણીનો દોષ જણાતાં તેણે તે ધણીને ધમકાવ્યો એટલું જ નહિ પણ કાયદો કર્યો કે કાઈ પુરુષ પોતાની પત્તીને વિશેષ પડતી હેરાન કરે તો તેને એવી ફડક સરળ કરવામાં આવશે

કે કેમાંથી તેની ર્થી તેને મારી અસ્કે તો જ થોડીક છૂટછાટ મળી શકે. ડેટલાક સૈનિકોએ કંઈક ચોરી કરતાં તેણે તેમને લાંબી સખત ડેફેન્સ ધડકાવી દીધા. ઇન્ફો કે બિહારમાંથી આવેલા થોડાક લોકને નેપાળમાં કંઈક સ્થાન નહોંઠું. તેમો ડાયેમોએ કહેવાતા ને અંતલ્ય વેખાતા. નંગે તેમને દરખારમાં ન્હેંતરી ચેતેજ તેમના હાથે પાણી પાધું ને નેપાળમાંથી એ જ પણ અસ્પૃષ્ટતા દૂર થઈ. એક ર્થીએ ધરમાં ધસી આવેલા એક વાધ સામે ટક્કર કીદેલી તેને તેણે સુંદર ઘનામ આપ્યું. એક ઝુદ્ધ મંહિરની ડેપ્લોિક જાગીરો. રાન્યે જમ કરેલી પણ તેના દાનતું તાખ્રપત્ર મળી આવતાં તેણે તે તરત જ પાછી સાંપાવી. તેરાઈમાં થતી ડેટલાક ચોરીઓની પાછળ ત્યાંના સુખેદારનો હાથ જણાતાં તેણે તેને સખત ડેફેન્સ હડ્સેની મૂક્યો. બાંકોના નાયથ સૂખાએ પોતાના પ્રેરણમાં સુંદર વ્યવસ્થા જાળવતાં તેને તેણે તરત જ ઊંચે દરજને ચડાવ્યો. આમ દોષિતને શિક્ષા ને ગુણવાનને યોગ્ય ઘનામ દ્વારા તેણે અંધાધૂંધી લર્યા નેપાળને થોડાજ સમયમાં સુંદર વ્યવસ્થાના શિખરે ચડાવી દીધું.

નેપાળનો સર્વસત્તાધીશ છતાં સિપાઈથી માંડી મલારાણ્ણા સુધીની અન્ધી જવાઅહારીએ તેને શિરે લટકતી. અધાંજ કાર્યો પર તેને દેખરેખ રાખવી પડતી, અધીજ આખતોમાં તેની સલાહ મંગાતી. તે પરોફેમાં શિહી પ્રભુપૂજન કરતો; પછી નાસ્તો કરી ન્યાયાસન સંબાળતો. બોજન પછી બીજાં રાજકૂય કામો પર તેને દેખરેખ રાખવી પડતી.

બિટનનો દોસ્ત છતાં તે સ્વદેશોભે ને ધર્મનિષ હતો. તેને આયુર્વેદ પર પૂર્ણ શ્રદ્ધા હતી. તે મારે તેણે હિમાલય અને પશ્ચિમ હિંદુમાંથી અનેક જતના છેડ મંગાવેલા. તેણે ડેટલાક ભારત્ય થઈ પડેલા રિવાને જે કે બંધ કર્યા છતાં તે રીતરિવાજનો ચુરત ઉપાસક હતો. તેની કિંમત તે સર્બજી શકતો. ચીનના શહેનશાહે જ્યારે તેની પ્રશંસા કરી યોગ્ય છદ્દકાય આપ્યો. ત્યારે બિટનના ગમે તેવા મોટા હંદ્દાએ કરતાં તેણે તેની કિંમત વખારે આંકી.

થોડાક સમય પૂર્વે પોતાના નાના પુત્રતું લમ તેણે નાની રાજકુંવરી વેરે કરેલું. આ અરસામાં તેણે પોતાની પુત્રોનું લમ નેપાળના પાટવીકુંવર મૈલોક્યાલિક વેરે કર્યું. આમ નેપાળના રાજવંશ સાથેનો તેનો સંઅધ અનૂટ અન્યો.

હેવે તે ઉત્તરાવસ્થામાં પ્રવેશતો હતો. તેણે માતાને, એ પત્નીએને, એક પુત્રને, એ ભાઈઓને રમશાને વળાબ્યા હતા. તેની સ્વાભાવિક શક્તિ એટલી જ પ્રભાવશીલ છતાં અંતરમાંથી તે ત્યાગી અની રહ્યો હતો. એક વખતે તો તેને સાધુ અની જતો માંડ અટકાવાયેલો.

૧૮૭૫ માં તેણે બીજી વખત યુરોપ જવાની વ્યવસ્થા કરી. થોડાજ સમયમાં યોગ્ય રસાલા સાથે તે નેપાળથી નીકળી ચૂક્યો. અદ્ધાભાદમાં તેને એ રસાલા સાથે નિવેદી સ્નાન કરવાની ઈચ્છા થઈ પણ લેઝ. ગવર્નર્ને સશક્ત સૈનિકો સાથે નદી પર જવાની અતુરંતિ ન આપતાં તે ખીજાયો. વાઈસરોયને એ સમાચાર મળતાંજ તેણે હિલગીરી દર્શાવી અધી અનુકૂળતા કરી આપી. પણ નંગે એ વખતે સ્નાન નજ કર્યું.

ત્યાંથી તે ગોદાવરી-નર્મદાના પ્રેરણમાં થઈ, ત્યાં પવિત્ર જળમાં સ્નાન કરી, મુંઘ પહોંચ્યો. પણ મુંઘાદમાં થોડાના અકર્માતથી શારીરિક છજ થતાં તેને તરત જ નેપાળ પાછા ફરવું પડ્યું.

આ અરસામાં બિટનના પાટવીકુંવર હિંદની મુલાકાતે આવ્યા. નંગે પણ પાછા પોતાના આધાને સામે મોકલી તેમને નેપાળમાં શિક્ષારે આવવાનું આમંત્રણ આપ્યું. કુંવરે એ આં-

ત્રણુનો સહર્ષ સ્વીકાર કર્યો. જંગે તેમની સાથે વણેક અઠવાડિયાં સુધી તેરાઘતા જંગલોમાં ધૂમી હિસ્ક પ્રાણીઓના શિકારની તેમને કળા શીખવી. કુંવર અતીવ આનંદ પામી શુભેચ્છા સાથે પાછા ઇર્યા.

જંગનું સ્વાસ્થ હવે ધીમેધીમે લથડતું જતું હતું. એ જ અરસામાં એનો બીજો પુત્ર અવસાન પામ્યો. તેને અપાર વેદના થઈ. તે શાંતિ માટે જંગલોમાં શિકારે ચાલ્યો. પણ તથિયત વધારે લથડી. તેને તરત જ પાછો દેરવામાં આવ્યો. પણ રસ્તે તેની આંખોનું નૂર એલવાઈ ગયું. ને પછીના એવણું હિવસમાં જ બાગમતી નહીને કિનારે, પથરધાટમાં, ૧૮૭૭ના ફેલ્લુઆરીની પચીશમાંથી તે અવસાન પામ્યો. તેની પાંચ પલોઓમાંથી મોટી ત્રણ તેની પાછળ સતી થઈ, નાની એને કુમળાં સંતાન હોઈ તેમને તેમ કરતાં વિનંતિપૂર્વક અટકાવવામાં આવી.

આમ જંગ ગયો, પણ નેપાળમાં એની જીવનપ્રભા હજુ જીવતીજગતી છે. નેપાળની ગાઢી પર, ત્યાંના પ્રધાનપદે તેના જ વંશને શોલે છે. મુસાફરો ત્યાંથી કંઈક ને કંઈક તેનીજ રમૃતિ લઈ પાછાં ફરે છે.

## મજલિસમાં—

તૈતામ

“ અહો ! શા દિંય સંગીતે આલ-ચ્યાલી છલી રહે,  
કિન્ચર કંઠ આ ડોનો નીરવે માધુરી અરે ?

સ્વર હિલોણ ચ્યો, નભ નીલમાં  
મધુરિમા લસી મેઘકમાનની;  
સુલગ સાંજની માદક લાલિમા  
બ્રધી ઢીચે સૂર-માધુરી ગાનની !”

“ સુરીલાં ગાનતાને ડો દેહવલદી નાયતી,  
અંગની ભંગિમા દૃષ્ટિ નેનપલદી રાયતી !  
લાવણ્ય અંગે લસતાં અનંગનાં,  
લાલિત્ય ચો લાલ્ય તણ્ણાં અન્યપ;  
સંગીત ને નૃત્ય-દીના સ્વર્ણ  
ભૂલે દિશા, જેમ દીવે પતંગિયા !”

ગામને ગોંદરે સાંજે જાભી છે મજલિસ, ત્યાં  
ગર્દબરાજ ને ઉટે સંગીત નૃત્ય આદર્યાઃ  
“ અહોત ! વહા ! ખૂણ ! હુણારા ! ” પ્રસંશાની પરેપરા  
ચાલી અન્યોન્ય માટે ત્યાં “ અહો ઝ્યપમ અહો ધ્વનિ ! ”



જગતને લેણે સંસકાર આપ્યા-સમૃદ્ધિ આપી, પચાંખરો આપ્યા-તત્ત્વજ્ઞાન આપ્યું, કલા આપી-કાંસ્કૃતિ આપી છતાં આજે હિંદમાં ને શુક્ષામ છે, ન્યુડીલેન્ડ કે ઓસ્ટ્રે-લિયામાં ને લંસાઇ બઈ છે, અમેરિકામાં આજ સુધી જેને બાળી હેવામાં આવી છે, ચીનમાં જેના પર બોંબ અને અભિ વર્ષે છે, આફ્રિકામાં જેના પર શુજરેતા અમા-તુપિક અત્યાચારો માટે શાંદો નથી એ—જગતની

## રંગીન પ્રજાઓ

નરસિંહ

દૃક્ષિણ-આફ્રિકામાં મહાત્માળને ઝાડની ડાળી પર ફાંસીએ લટકાવી હેવાની યોજના અને ના. શાખીજ અને શ્રીમતી સરેજિની દેવી સામે થયેલ ગોરા હુમદ્રામોએ હિંદી પ્રજન્તું એ પ્રદેશ પ્રત્યે ઢીક ઢીક ધ્યાન આકર્ષ્યું છે. આજે હિંદી એ પ્રશ્ન હિંદના પ્રજાકીય સ્વમાનને મુંઝી રહ્યો છે. ત્યાં વસતા હિંદીઓએ વર્ષોથી અધિનિત અપમાનો સહ્યાં છે, અસંખ્ય શુલામી વેઠી છે, મજૂરી કરીકરીને ગોરાઓને પેસો કમાવી આપ્યો છે—આજે એ ગોરાઓ કંધક વર્ષોથી ધરેલી પોતાની યોજના પ્રમાણે હિંદી વસાહતીઓને પાછા હડસેલના માગે છે, અથવા એમના ન જેવા હક્કો મૂંઝી લઈ એમને અંત્યજીવાદમાં ધડકી હેવા માગે છે.

આ પ્રસંગે દૃક્ષિણ-આફ્રિકામાં હિંદીઓના સ્થાન વિષેનો વિચાર ખાસ જરૂરી છે; પણ તે ડેવળ હિંદી દશ્ચિંદ્રે નહિ પણ સમરત રંગીન પ્રજની દર્શિયે. ડેમકે દૃક્ષિણ-આફ્રિકાની આ દ્રોષનીતિ—ને કે એના પરિણામે શોષવાતું તો મોટે લાગે હિંદીઓને છે છતાં—ડેવળ હિંદીઓ સામે નહિ, પણ મોટા લાગની એશિયાવાસી રંગીન પ્રજન સામે આહરવામાં આવી છે; અને તે પણ ગોરી પ્રજનની આપી રંગીન પ્રજન પ્રત્યેની વલણું એક પ્રકરણ જ છે.

ગોરી પ્રજનના લીપણું અત્યાચારો અને રંગીન પ્રજનની કરુણતમ સ્થિતિને ઉઘેલતાં પહેલાં એ નોઈ જવું જરૂરી છે કે ગોરી કરતાં અનેકગણ્યું ગોટી રંગીન પ્રજન ગોરા પાશમાં શા માટે ચૂંથાં રહી છે?—અત્યારે તો એમ થવાનાં ત્રણું કારણો જણાય છે: એક ગોરી પ્રજનનું દાનવી શાખબળ; ખીન્યું હાથચડેલી રંગીન પ્રજનમાં ડેજવવામાં આવેલ કુસ્પ, નિર્ણણતા અને સંસકારબન્ધટતા; અને ત્રીન્યું ગોરી પ્રજનની રાક્ષસી અને કુટિલ વૃત્તિઓને સમજવાની રંગીનોની અશક્તિ. ગોરી પ્રજન જણારે રંગીનોને પડાયે લે છે ત્યારે રંગીને કુલાં જથું છે, સમજતા નથી કે આ ડેચાંક નવી સોગડાયાળ છે. એક ગોરા અમલવારે દૃક્ષિણ-આફ્રિકાની ધારાસલામાં ગોરી પ્રજનનું માનસ વ્યક્ત કરતાં ખરું જ કહ્યું છે કે “દશ હનર દેશીઓએ કરતાં એક ગોરાની કિમત વધારે છે.” જર્મની ખિટનનું દુઃમન છતાં હારીને પણ વીસ વર્ષમાં પાણું ટટાર બન્યું છે, ડેમકે તે ગોડે છે. પણ યુદ્ધમાં ખિટનને પડાયે રહી એના પગ ચાટતાં ચાટતાં સમરભૂતિ પર આગોટનારાઓની પ્રજન પાસે આજે રોટલો નથી, ડેમકે એ રંગીનો છે. દૃક્ષિણ-આફ્રિકામાં એઓ યુદ્ધમાં મહદ કરી, હિંદીઓએ અંગ્રેજેને ડચો સામે વિજય અપાયો; આજે હિંદીઓને હાંકી કાદવામાં એ જ અંગ્રેજેને ને ડચો એક બન્યા છે; ડેમકે બંનેની ચામડી ગોરી છે. પણ રંગીનો એક નથી બની શકતા.

દ્વારાણુ-આદ્રિકાની ગોરી સરકારે એશિયાવાસીઓ સામેતી પોતાની દ્વિપનીતિમાંથી જાપાન અને સિરિયાને જુદાં તારણાં છે, ડેમકે એક બળવાન છે; ખીજું પાડેલું સેગાડું છે. પરિણામે એ બંનેને રંગીન પ્રજી પ્રત્યેતી પોતાની વિશેષ જવાબદારી કરી નથી જણ્યાતી. જે ચીનને હિંદુ યુગોથી પોતાનું ભિત્ર ગણું આવ્યું છે એ ચીન ગોરાઓને ચરણે પડે છે કે, ‘અમને એશિયાવાસી ન ગણ્યા.’ હિંદુઓ ત્યાંની કંયરાઈ ગયેલી મૂળ પ્રજી સાથે એક બળવાને બદલે પોતાની લાગવગનો ઉપયોગ કરી ગોરાઓ સાથે સમાધાન વાંछે છે. ડ્રાઇટે વિચારવાને અવકાશ નથી કે ગોરી પ્રજાને મન રંગીનોની પવિત્ર ભૂમિ એટલે શિકારનું મેદાન, જંગલો કે સંસ્થાને વસાવવાનું રથણ, વેપારી ચૌકુ કે લુંટ ચલાવવાની કે અત્યાચારો ગુણવાની ભન્નરો છે. એની સાથેનું સમાધાન એ ભિત્રતાના કરાર નથી પણ લીખો કુકો છે. એવા કુકોઓથી પ્રજાનાં સત્ત્વ, સાહસ તે તનમનાટ ચૂસાઈ જય છે; એ સ્વાર્થ જુઓ છે, સ્વમાન નથી જોઈ શકતી. પરિણામે સમાન પ્રજાઓ પર શુભરેલા કે શુભરતા ગમે તેવા અત્યાચારોથી એને કમક્કમાટી નથી ઉપજતી.

ડ્રાઈ કમભાગી પળે ગોરા સાહસિકોના મનમાં નવનવા દેશા શોધી કાઢવાનો તલસાટ જરૂર્યો. અને તે જ દિવસથી પોતપોતાના પ્રદેશોમાં સુખે વસતી રંગીન પ્રજાઓના ગળે ગોરાઓના સ્વાર્થની છૂટી આવી લટકી. આ માટે સાહસિકોને દોષ ન હેવાય. મહાન પુરુષોની મહેનત કે મહત્ત્વાનો ઉપયોગ હુમેશાં દુષ્ટાને હાથે હળાહળ સ્વાર્થમાં જ થાય છે. પણ જીછળતા સાહસિકોને એ ખૂબ મોહું સમજય છે. આદ્રિકાના અનેક પ્રદેશોનો સંશોધક હર્ફાઈ વોર્ડ ત્યાંની પ્રજી પર શુભરતા અત્યાચારો. સાંભળી દુઃખથી ઘેલો અની ગયેલો, પોતાના એ અમ પર તેણે આંસુ સાર્યો. આદ્રિકાની પ્રજી પર શુભરતા અત્યાચારોના કરણ રમારકૃપે તેણે હાનવોની આંખમાંથી પણ આંસુ સારે એવી એક પ્રતિમા જાબી કરી છે. ફેન્ચ ફંગોના સંશોધક અને એ પ્રદેશની પ્રજી સાથે મીડાશ ડેળવી ઝાન્સને તે પ્રદેશ અપાવનાર ડો. ખાજાઓ જ્યારે એ દેશની નિર્દીષ પ્રજાનાં લોહી વહેતાં જેથાં ત્યારે તેનું હૈનું ફાટી ગયેલું.

અમેરિકા શોધાયું, ઓસ્ટ્રેલિયા શોધાયું, ખીજ અનેક ટાપુઓ શોધાયા. આજે ત્યાં ગોરી પ્રજી મહાલી રહી છે. પણ ત્યાંની મૂળ પ્રજાઓ કયાં છે? – તેમની સ્થિતિ શું છે? ગોરાઓ પાસેથી જગતને તો એટલું જ જાણવા મળ્યું છે કે તે તે પ્રદેશોમાં છૂટીછાઈ માણસખાઉ પ્રજાઓ વસતી હતી અને તે ધીમેધીમે લુસ થધ ગઈ છે. એમ તો જગતની પ્રાચીનમાં પ્રાચીન મહાન હિંદુ પ્રજી વિષે પણ પરદેશોમાં કહેવાય છે કે અહીના લોકો કાંચું માંસ ખાય છે અને જ્યારે હિંદુ અશ્રેનોને હસ્તક પડ્યું ત્યારે તેની વસતી દશ કરેઝની હતી. [બિચારાઓને લાગ્યું હશે કે એથી ઓછા આંકડો તો ગાંડાઓની છર્સ્પીતાલ સિવાય ખીજે ક્યાંય માન્ય નહિ થાય.] ચીન આજે અરીણી ગણ્યાય છે. પણ એને અરીણી બનાવ્યું કાંચે? ત્રણેક મહિના પર સાંધાઈના એક પ્રતિક્ષિત ચીની પત્રમાં પ્રગટ થયેલ સમાચાર જે ખોટા ડેરવામાં ન આવે તે એમ માનવું રહે છે કે, ‘હિંદમાં અરીણું ઉત્પાદન વધારી ચીનને નયાંનું બનાવવાને ને તેનું નાણું એંચી લેવાને ત્યાં હુક્તિથી છેલ્લા એ સૈકામાં અરીણો. પ્રચાર વધારવામાં આવ્યો છે. ત્યાંના ખિસ્તિ દેવલોમાં વિભિયારના અખાડા ચાલે છે અને અનેક પ્રકારની લાલચોથી સેંકડો ચીનાઓને તેમનું સ્વત્વ હણવાને

ખ્રિસ્ત બનાવી હેવામાં આવે છે. આવા ભાણુસો ગોરી અને ખ્રિસ્ત પ્રજાની તરફેણુમાં પ્રચાર કરવામાં ચેપી રોગની ગરજ સારે છે.' ચીનમાં ગોરી પ્રજાએ ડેર ડેર પોતાનાં થાણું જમાવ્યાં છે. તે ચીનનું રાજતંત્ર અડાણુવટમાં લાખાવી તેને જપાનની સામે લડવાને નાણાં ધીર છે. એનો મૂળ ઉદ્દેશ તો ચીન-જપાનને અંદરોચંદર લડાવી અનેને ખોખરાં કરવાનો છે.'

અમેરિકાની મૂળ રેઝન્ડિયન્સ પ્રજાને તો આજ સુધી જીવતી ને જીવતી બાળો હેવામાં આવી છે એ જગતાહેર વાત છે. ગોરાઓ કહે છે કે એ પ્રજાએ તો પશુથીયે હલકા છે. કોણે માપ કાઢ્યું? ધર્તિહાસ તો એમ પૂરવાર કરી શકે એમ છે કે ઉત્તર રશિયાને માર્ગ થઈ આયેની કટલીક દુક્કિયોએ અમેરિકામાં જર્ઝ ત્યાં વસવાટ જમાવેલો. અમેરિકાનો મહાન ધર્તિહાસકાર પાકમેન તો ત્યાંની મૂળ પ્રજાએ ખેલેલાં અદ્વિતીય યુદ્ધોની પ્રશસ્ય નોંધ લે છે. ને અમેરિકામાં મળી આવતા પુરાતત્વના અભ્ય અવરોધે શું છેલ્લા નણુસો-ચારસો વર્ષથી ત્યાં જર્ઝ વસેલી ગોરી સંસ્કૃતિયે બિલા કરેલા છે?

ઈજલાંડમાં જેને માટે કંઈ સ્થાન ન રહ્યું હોય એવાએને ઓસ્ટ્રેલિયા ધડકા ધડકા એ સંસ્થાનની ભીલવણી કરવામાં આવી છે. પણ એ ભીલવણી શું કેવળ એવા જિતરેલ ગોરાએએ જ કરી છે? ગોરાએએ જયારે ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલાંડ પર પોતાનો વાવટો ચડાવ્યો. ત્યારે તે પ્રદેશની પ્રજા જેવી અને જે સંખ્યામાં હતી તેવી અને તેથી અડધી સંખ્યામાં પણ આજે છે?

આસ્ક્રિકા પરના અત્યાચારો વિષે તો વિચાર કરવાને પણ પત્થરી હૈયું જોઈએ. ઈ. ડી. મોરેલ જેવો નામાંકિત અંગ્રેજ લેખક પણ કહે છે કે, 'એ કાળા અત્યાચારનાં દોહિયાણ પાનાં ડેકલવાની હિંમત નથી. એ હિંદના વિજય જેટલાં જ દોહિયા રંગચેલાં છે.'

આસ્ક્રિકા વિષે એક ભ્રમણું એ ફેલાવવામાં આવે છે કે ત્યાંની પ્રજા પણ જેવી અને જિનસંસ્કારી હતી અને ગોરાએએ ત્યાં જર્ઝને પ્રકાશ ફેલાવ્યો છે. પણ આ બંને હળાહળ જુદાણ્યાં છે. ગોરાએએ તો ત્યાં જર્ઝ ને દોહિયાની નદીએ જ વહાની છે. અને ત્યાંની પ્રજા યુગોથી સંસ્કારી હોવાનાં પૂરતાં પ્રમાણો છે.

પુરાણોમાં આસ્ક્રિકાને ડોય દ્વીપના નામે એણખવામાં આવે છે. હિંદી સંસ્કૃતિ પદ્ધતિમ એશિયાને માર્ગ થઈ ધ. સ. પૂર્વે ૧૦૦૦ લગભગમાં ત્યાં પહેલેચેલી. શીમાણનેનાં અભ્ય ખંડેરામાં આજે પણ તેના અવરોધે નજરે પડે છે. ખંડના અનેક ભાગોમાંથી મળી આવતાં ખડકચિત્તાને તો ગોરા સંશોધકાએ પણ ધ. સ. પૂર્વે ૮૦૦૦ લગભગમાં ટેરવાં છે. મીસરના રાજવંશનો સ્થાપક રાજ મેનીજ (અસમેજસ) ચક્રવર્તી સગરનો પુત્ર હતો. એખિલાનના ચક્રવર્તી સભ્રાટો પણ આસ્ક્રિકાના ઉત્તર ભાગમાં જતાં હાર આઈ એઠેલા. એચ. જ. વેલસના મતે ધ. સ. ૫૨૦ માં હિંદી પ્રવાસીએ દક્ષિણ-આસ્ક્રિકાની સુલાક્ષણ લીધેલી. પૂર્વ-આસ્ક્રિકામાં તો હિંદીએ સદીએથી જર્ઝ વરસ્યા હતા અને વારકા ડી ગામાએ ત્યાં તેમને જોયેલ હોવાના પણ પુરાવા છે. હિંદ-વિરોધીએમાં અગ્રપદ ધરાવનાર મી. ચર્ચિલના મતે પણ હિંદીએ આસ્ક્રિકામાં ગોરાએ પૂર્વે ધણ્યાં વર્ષ પહેલાં જર્ઝ વરસ્યા હતા. આમ આસ્ક્રિકા અંધારખંડ હતો અને ગોરાએએ એને શાખોને અજવાળામાં મુક્યો. એ વાત વજુદલરી નથી જણાતી. એ ખંડે છે કે લુંટફાટની નીતિ ગોરાએએ જ ત્યાં પહેલવહેલી અજમાની.

શૈલીમાં સદીના મણ્યાન્હમાં પોર્ટુગલના રાજ હેન્રી ધી તેવીઓટરની સહાયથી કેટલાક ગોરા શાખકાએ પદ્ધતિમ આસ્ક્રિકાને કંડે પગ મુક્યો. તેમની નજર ત્યાંના સુષ્ઠિસૌન્દર્ય પર ન હરી પણ કેટલાંક ખેલતાં-કૂદતાં કાળાં માનવો પર જર્ઝ ચોંટી. તેમણે એ માનવોમાંના

કેટલાક સંશક્તા પુરુષોને ગુલામો તરીક ઉડાવવાની યોજના ઘડી. પરિણુમે બંને પક્ષ વચ્ચે યુદ્ધ થયું. પણ શાખાધારી પ્રિસ્ટિએન્સે અનેક કાળાં ઝો-પુરુષોને સંહાર કરી નાંખ્યે. તે પછી વિજય માટે તેમના વહાલા પ્રભુની રહુતિ કરી બાર ગુલામો લઈ તેઓ પોર્ટુગલ પાછા ઇર્યા.

એ પછી ક્રાંતિકસ રખડતો રખડતો અમેરિકા જઈ ચહ્યો. શાસ્ત્રાત્માં તે પ્રદેશ ર્પેનને હસ્તક આવ્યો. તેને ત્યાં ધાતુએ અને કુદરતી અગ્નનાની વિપુલતા જણ્યાએ. પણ ત્યાંની ભૂગ્લ સ્વભાવની પ્રણ તેને માટે મળૂરી કરવા તૈયાર ચાય એમ નહોંતી. પરિણુમે તેને પરહેઠી ગુલામોની જરૂર જણ્યાએ. પોર્ટુગલ તૈયાર જ હતું. તેણે ર્પેનને ગુલામો પૂરા પાડવાનો ક્રાન્દ્રાકટ કર્યો. અને ધંશુભિસ્તના પવિત્ર નામ પર આફ્રિકામાંથી ટોળાંધ ગુલામો ઉડાવીને તેમને અમેરિકાને કાઢે ખડકવા માંડ્યા. ગુલામોને પકડવામાં કેટલું લોહી રેડારું હતું, કેટલાં નિર્દેષ ચુંથાઈ જતાં હતાં, મુસાફીમાં કેટલા ગુલામો મરી જતા હતા તેનો ખ્યાલ રાખવાની પોર્ટુગલને જરૂરત નહોંતી.

પણ પોર્ટુગલને આ રીતે લાડવો જાણી નહતું નેર્ચ યુરોપના ભીજા દેશોની દાઢ સળકી. ૧૫૬૨ માં દ્યુગ્લાંડના મહારાણી એલીજાબેથની ખાનગી ભાગીદારી સાથે હોકીન નામના અંગ્રેજ પણ એ પવિત્ર કામ ઉપાડી લીધું. એ પછી તો અધા દેશો વચ્ચે તે ધ્રેધામાં હરીકાઢ ચાલ્યો. ર્પેને પોર્ટુગલ સાથેના કરાર રહ્યું કરી ભીજા દેશોને પણ એ સફળ ધંધામાં નેડાવા દીધા. પણ સાથે જ તેનું અમેરિકા પણ ભીજાએ. ખાઈ જવા માંડ્યા. આ અધા ધંધા, હરીકાઢ ને વિજયોમાં વધુમાં વધુ ભાગ દ્યુગ્લાંડને દ્રાગે ગયો.

ક્ર. સ. ૧૬૬૬થી ૧૮૦૦ના ગાળા દરમિયાન યુરોપની જોરી પ્રગતિ આ રીતે અમેરિકાને કાઢે ૧૦૫૮૧૧૧૫ ગુલામો જીતાર્યો. આમાં સાડ લાખ લગભગ તો એકલા દ્યુગ્લાંડ જ જીતાર્યો. એ અધાને પકડતાં રેડલું પડેલ લોહી, તેમનાં કુંઝોના હાલહલાલ, રસ્તે દુઃખ કે ભૂખથી તેમાંનાં લાખોનાં કરુણ મૃત્યુ એ કશાનો તો હિસાબ જ નથી. એક ગાળા દરમિયાન અઠી લાખ લગભગ ગુલામો રસ્તે દુઃખથી કચરાઈને મરી ગયાની નોંધ લેવાઈ છે. આ અધા ગુલામો મોટે ભાગે પશ્ચિમ-આફ્રિકામાંથી જ ઉડાવાયેલા.

આ વેપારમાં જેડાનાર પેઢીએની સાથે જ રાન્યને અને વહાણુવટાના વેપારીએને પણ એટલો જ આર્થિક લાભ થયેલો. ક્ર. સ. ૧૭૭૫ માં પિટનના સંસ્થાનમંત્રીએ પાર્લિમેન્ટમાં જવાબ આપતાં કહેલું કે, ‘આવો ઉમદા લાભાદ્ય ધ્યાદો દેશથી ન છાડી દેવાય.’ ઈંગ્લાનો વહાણુવટાનો ઉદ્ઘોગ પણ એ અરસામાં કાલી ફૂલી નીકળ્યો. ગુલામોના એ વેપારમાં એકલા લીવરપુલનાં વહાણો જ વાર્ષિક ૩. ૧૬૭૬૪૭૦૫ નો નંદી કરતાં હતાં. નંદીમાનો કેટલોક ભાગ કાળી પ્રણમાં ઉમદા પ્રિસ્ટિ ધર્મના પ્રચાર માટે ભીશનરીએને સોંપાતો.

અમેરિકામાં ઉતારવામાં આવેલા ગુલામોની દશા વર્ણવી જય એવી નથી. તેઓ કામ કરવાને અશક્ત બનતાં તેમને મારી નાંખવામાં આવતા. તેઓ સામનો કરે તો શરીરનું લોહી નીતરવા માડે એ હેઠ તેમને ચાઅચા ભરાતા. કામ ન કરનાર કે ઓછું કરનારને દિવસો સુધી જાડ સાથે ભૂખ્યા બાંધી રાખવામાં આવતા. ઉચ-ગિયાના ને પિટિસ વેસ્ટ છન્ડીજમાં તો તેમને જવતા સળગાવી દેવામાં આવતા, તેમનાં ગુલ્લ અંગો છેદી નાંખવામાં આવતાં કે તેમને ખાંડના બિકળતા તાવડાએમાં ફેકી દેવાતા. તેમના દેશમાં તેમનાં કુંઝોની સ્થિતિ તો પ્રભુને આધીન હતી.

ગોરી પ્રજાએ આદ્ધિકાના દેશો સર કરવામાં વાપરેલી કૂરતા અને અધમતાનો ધતિહાસ પણ એટલો જ કરુણ છે. ગોરાએને મન અનગોરી ચામડી એટલે સંહાર કરવાનું ઢેકાણું. એમના ભગવાન ધર્શુ યહુદી ડામમાં જન્મેલા એ ખાતર એશિયાઈ યહુદીએને પણ તેઓ ગોરા ગણે છે. ધર્શુની જન્મભૂમિ એશિયામાં આવેલી છતાં એને એએઓ અનએશિયાઈક ગણે છે. ગોરી ચામડી સિવાયનું જગત એમને મન પશુજગત છે. અને એના પ્રત્યે તેઓ પોતાની કથી ક્રજ નથી માનતા.

આદ્ધિકામાં હોઠ લાખ ચોરસમાઈલ લગલગના વિસ્તારનો દક્ષિણ રોડેશિયા નામે પ્રાન્ત છે. ત્યાંની પ્રજા તંદુરસ્ત અને આંદ્રી ગણ્યાતી. એ પ્રાન્તના રાજ લોએન્યુલાને અંગ્રેજે ઉપર પૂર્વ વિશ્વાસ હતો. તે એક અંગ્રેજ મીશનરી સાથે મિત્રતાથી મંકળાયે; પરિણામે અંગ્રેજ વેપારીએ ત્યાં આવતા જતા થયા. એ વેપારીએને તે પ્રદેશની ઘનીજસંપત્તિ અખૂટ અને અમૃત્યુ જણ્યાઈ. તેમણે અંગ્રેજ ન જણ્યાતી એ રાજ પાસે, તેને જુદી જ રીતે સમજાવી, એક કરાર પર સહી કરાવી લીધી. જ્યારે રાજએ જાણ્યું કે તે કરાર તો માસિક રૂ. ૧૫૦૦ના અદ્દલામાં દેશની વધી અનીજસંપત્તિ પરના હક્કો જૂંટવી લેતા હતા ત્યારે તેણે મહારાણી વિક્રોરિયાને તે ઉપર સંબંધી લખી જણ્યાયું. મહારાણી વિક્રોરિયાએ તેવા અંગ્રેજને અનિસત્તાવાર જણ્યાવી તેમની સાથે જોઈને વર્તવાની રાજને સલાહ આપી; પણ પછી તો રોડેશિયામાં અંગ્રેજ કંપનીએ સ્થપાણી. ને તે ખિટનાના પીડુણ સાથે નવાનવા હક્ક મેળવતી જ ગઈ. પછી તેમણે જુદાં જુદાં અહાનાં કાઢી ત્યાંની મૂળ પ્રજા સાથે જગડા માંડ્યાં. ને છેવટે હજરો માણસો ને ઢોરોને સંહાર કરીને એ પ્રદેશ પડાવી લીધો. તે પછી તેમણે મૂળ પ્રજા સામે કડકમાં કડક કાતુન કરી અધી જગીન જૂંટવી લઈ તે પ્રજાને વાડાએમાં ધકેલી મૂકી. તેના પાસે મરળુમાં આવે એટલું વળતર આપી કરનિયાત મળુરી કરવાના માંડી. અંગ્રેજે પર વિશ્વાસ રાખનાર રાજ લોએન્યુલાના વંશજોએ સમાટ જ્યોર્જ પર પોતાની કરુણ સ્થિતિ સંબંધી લખેલો કકળો પત્ર કદણ હૈયાને પણ આંસુ સરાવે એવો છે.

વીશભી સદ્ગીની શરિયાતમાં ખિટન દક્ષિણ-આદ્ધિકામાં બોઅર યુદ્ધમાં સંડોવાયું હતું. આ વખતે ફાન્સને મોરાઝો ગળી જવાનો તલસાટ જગ્યો. તેણે મોરાઝોના વિલાસી સુલતાનને બોાંડ નાણું ધીરી તેના પર કાખુ જમાયો. પહેલાં તો ઈગ્લાંડ ક્રાંસની વિરુદ્ધ પડ્યું પણ પછી જર્મનીની વિરુદ્ધ ફાન્સનું બળ ફેળવું જર્રી હોઈ તેણે ફાન્સને ચુખે કરારથી મોરાઝો ગળી જવાની છૂટ આપી. બોાટા આરોપો જિલા કરવામાં તો ગોરી પ્રજા નિર્ણયાત જ છે. એવા જુદા જુદા આરોપો જિલા કરી ક્રાન્સે મોરાઝોના એક નગર કેસેમ્બલેન્ફા પર તોચોનો મારો ચલાયો. હજરોની કંતલ થઈ. ને બોાટા જ વખતમાં મોરાઝો ક્રાન્સને હસ્તક જઈ પડ્યું.

આ જ રીતે ઈગ્લાંડની એવડી તેવડી રમતોથી પ્રેરાઈ ક્રાન્સે ટર્કી પાસેથી ટ્યુનિસ પડાવી લીધું, ઈટાલીએ ટ્રીપોલી પડાવી લીધું. એ બનેનો કાંઈને લેતાં જે સંહાર થયો એ ગણ્યો જથું એમ નથી. ઈટાલીએ બોાટા જ સમય પૂર્વે લીધેલા એભીસીનિયાના કંપનીથી એનો કંઈક ખ્યાલ આવી શક્રો.

એહિન્યમના રાજ લિયોપોલ્ડના મનમાં પણ સંસ્થાનવાદની દુષ્ટ ભાવના જગ્યા. તેણે ગોરી પ્રજાને પોતાના સંસ્થાનમાં વેપારી લાભો કરી આપવાનું વચ્ચન આપ્યું, મધ્ય આદ્ધિકાની પ્રજાને અનેક જાતના સુખની લાલચો આપી; ને આદ્ધિકન પ્રજાને પ્રય થઈ પડેલા મુસાફર સ્ટેન્લીને

મહદમાં લઈ કોણે હી રટેટ નામે સંસ્થાન વસાચું. પણ પછી એ સંસ્થાનમાં ગુજરાતા અત્યારોત્તાની સીમા નથી. એ પ્રદેશમાં રષ્યાર ને હાથીદાંત એની પુષ્કળ પેદાશ છે. પણ જોરા વેપારીઓ પોતે તો એ કામ કરી ન શકે. તેમણે ત્યાંની મૂળ પ્રણ પર એ ક્રીજ નાંખી. અને એ ક્રીજ આદ્ય કરાવતાં તેમણે હન્દરોત્તાની કટલ કરી, સેકડોને શિકારી પ્રાણીઓના મોઢામાં ધકેલી લીધા, હન્દરોત્તાને ઝાંસીએ લટકાયા, સેકડોને ભૂખથી મારી નાંખ્યા. તેમને મારી નાંખવામાં બંદુકની ગોળાએ નકામી વપરાઈ ન જય એ આતર તેઓ સેકડોને જાડ સાથે બાંધી ભૂખ-તરસ કે શિકારી પ્રાણીઓના શિકાર તરીક મરવા હેતા. પુરુષો પાસે કામ કરાવવાને તેઓ તેમનાં સ્વી-ભાગકોને પકડીને કંડક સજ કરતા, તેમનાં અંગ છેહી નાંખતા, તેમને દ્વિસે સુધી ભૂખે મારતા, જાડ સાથે બાંધી રાખતા, તેમનાં ગામે સળગાતી મૂકતા, તેમને મારી નાંખી તેમનાં માંસની ઉજણી કરતા. આ રીતે એ દારણું ગાળામાં તે પ્રદેશનાં ૨૦૦૦૦ માણુસો હેમાધ ગયાં.

ચાલાક રાજ લિયોપોલ્ડે આવા દોરવર્તન માટે પોતાના પર દુનિયાનો રોષ ન જિતરે એ માટે ફેન્ચ-કોંગોમાં પણ આજ નીતિ અમલમાં ભૂકાવી. તે દેશના સારી વિલાગમાં, એ નીતિની રૂએ, એક જ દ્વિસેમાં પછી સ્વી-છેડારાંને નાની કોટડીમાં પૂરી મારી નાંખવામાં આવેલાં. સેકડો સ્વીએને તેઓ ધગધગતા સળિયાથી કંપાવતા. ફોર્ટ સિથુટમાં તેમણે ૧૧૬ સ્વીએનો. અને કુમળી કન્યાએને એકજ દ્વિસેમાં એ રીતે મારી નાખેલી.

અંગેને પણ આ વિષયમાં જીતરતા નથી. શેડા જ દ્વિસે પહેલાં ખિટિશ પાલમેન્ટમાં પ્રશ્ન પૂછવામાં આવેલો કે સિયેરાલીયેન નામના ખિટિશ સંસ્થાનમાં કુગાળ બની ગેલેલી પ્રણને કર અરવાને પોતાનાં સંતાન વેચવાં પડે છે અને સરકાર તરફથી કર ન અરનારાએ પર અંગધર્મણું જેવા જુદા જુદા અત્યાચાર થાય છે એ વાત સાચી છે ?'—તેના ઉત્તરમાં સર થોમસ ધન્સ્કોપે કણૂલ કરેલું કે ગેરવર્તાવ ચલાવવામાં આવે છે અરો. હિંદમાં એમણે થું કર્યું એ તો જગળણીતી વાત છે.

દ્વિષ્ણુ-આદ્ધિકાનો ધિતિહાસ, ગાંધીજીના પ્રતાપે, હિંદને વિશેષ જણુંતો છે. ત્યાંની મૂળ પ્રણ બાન્ડુ. તે પછી ત્યાં ડ્રો જર્દ વસ્યા. તેમણે બાન્ડુએને અનેક રીતે ફ્રસ્તાની, તેમના પર અત્યાચારો કરી, કેટલોક પ્રદેશ પડાવી લીધો. પછી ત્યાં અંગેનેનું ધ્યાન આકર્ષણ્યું. તેમણે મૂળ પ્રણને વિશ્વાસમાં લઈ ડ્રોને ફૂટવા માંડયા. ડ્રો ઉત્તર તરફ આગળ વથતા ગયા. આદ્ધિકાની ડ્રો પ્રણ બોઅર નામે એણખાય છે. તેનું જન્મન પણ અજખ ગણાય છે. તેની અને અંગેનેની વર્ચે લયંકર યુદ્ધ થયું. પણ છેવેટે અંગેને ફૂબ્યા ને અન્ને વર્ચે સમાધાન થયું. સમાધાન થતાં જ અંગેને મૂળ પ્રણને અને યુદ્ધમાં મદદ કરનાર હિંદીપ્રણને વીસરી ગયા; ૧૯૪૩ માં મહારાણી વિકોટરિયાએ બહાર પાડેલ પ્રણસમાનતાનો ઢોરો ભૂલી ગયા. મૂળ પ્રણને ડ્રોએ ધણે અંશો તો કંચરી નાંખી હતી. હવે બંનેએ સાથે મળી તેને વિશેષ કુચરવા માંડી.

હિંદીએના ત્યાં વણુંહાંતર્યાં ગયા પણ નહોતા. અને જોગીપ્રણએ કરતાં આદ્ધિક પર તેમનો વિશેષ હકુ હતો. અને મોટાલાગના હિંદીએને તો નાતાલમાં ૧૯૬૦માં શેરડીનું વાબેતર કરવાનું હતું ત્યારે નહેંતરવામાં આવેલા. પણ કામ સર્વું કે વૈદ્ય વૈરો. અને જોગી પ્રણએ અંદરથી એક થઈ હિંદીપ્રણને મૂળ પ્રણની જેમ કોઈ પણ જાતના હકુ વગર અંત્યજીવાડમાં ધકેલી દેવાની અથવા હિંદ પાછી કાઢવાની યોજનાએ રચવા માંડી. હિંદીપ્રણ

## અર્થશાસ્ક્રના અવયાસનું એક પ્રકારણ— શ્રમ-હેંચણી

ન. હ. વ્યાસ

મનુષ્યના જીવનમાં શ્રમને નેટલું મહત્વનું સ્થાન છે તેટલું જ બદ્દે તેથી પણ વિશેષ શ્રમની યોગ્ય હેંચણીને સ્થાન છે. પ્રત્યેક માનવીને શ્રમ કરવો પડે છે; પણ તે માત્ર ગમે તે દંગથી શ્રમ કરીને ભુક્ત નથી થતો; તેને અમૃત જ પ્રકારનો શ્રમ કરવો પડે છે; પોતાની પરિસ્થિતીને અંગે જે પ્રકારના શ્રમનું નિર્માણ થયું હોય તે પ્રકારનો શ્રમ કરવો પડે છે. આ રીતે પ્રત્યેક માણુસને વિવિધ પ્રકારનો શ્રમ કરવો પડે છે.

આર્થિક જીવનની શક્યતા માટે માનવીના જીવનમાં શ્રમ અનિવાર્ય છે. પણ જીવનની સમગ્ર જરૂરિયાતો પ્રાપ્ત કરવાને માટે તે, વિવિધ પ્રકારનો-પ્રત્યેક જરૂરિયાતને અનુલક્ષીને શ્રમ કરતો નથી. તે તો માત્ર સારીએ લંઘણી સુધી એકજ પ્રકારનો શ્રમ ઉડાવે છે અને છતાં તે શ્રમના બદલામાં તેનું સાંચે આર્થિક જીવન શક્ય બને છે, તેમજ બધી જરૂરિયાતો પ્રાપ્ત થાય છે. આનું કારણ શ્રમની-હેંચણી છે.

ધણું પ્રાચીન કાળમાં જ્યારે માનવી આજના જેવા નિયમબદ્ધ આર્થિક સમાજમાં નહોતો વસતો ત્યારે શ્રમની હેંચણીની હસ્તી નહોતી, તેનો ખ્યાલ પણ ન હતો. જગત પ્રગતિશીલ છે, જગતમાં વસતો માનવી પણ પ્રગતિશીલ છે. વ્યક્તિજીવનમાંથી કુદુમ્ય જીવન આંધું, કુદુમ્યજીવનમાંથી સમૂહજીવન આંધું, સમૂહજીવન સ્થિર થતાં આમ જીવન પ્રાપ્ત થયું અને આમજીવનમાંથી પ્રાપ્તો, રાષ્ટ્રો અને આજે, માનવી આંતરરાષ્ટ્રીય જીવનના ધ્યેય તરફ ઝપટભેર જઈ રહ્યો છે. આ બધી પ્રગતિના મૂળમાં શ્રમની-હેંચણી રહેલી છે. શ્રમની હેંચણી વિના પ્રગતિ આકાશ કુસુમવત્ત છે. શ્રમની હેંચણી નેટલી વિશેષ તેટલી પ્રગતિ વિશેષ. શ્રમની હેંચણીની વ્યાપકતા, પ્રગતિનું માપ કાઢવાનું સાધન છે.

માનવી તેની પ્રાથમિક અવસ્થામાં પોતાની બધી જરૂરિયાતો માટે-અલખત જરૂરિયાતો ધણી મર્યાદિત હતી—નેટલા પ્રકારનો શ્રમ કરવો પડે તે બધો શ્રમ કરતો. નેમકે ક્ષુધાશાનિત માટે પોતાના ખોરાકનું સાધન તેને પોતાને જ તૈયાર કરવું પડતું; શરીરના રક્ષણ માટે કપડાંઓ પોતાને જ તૈયાર કરવાં પડતાં—જે પ્રકારનાં કપડાંઓ પ્રયોગિત હતાં તે—પોતાનાં આધુદ્યો—શાલો; પોતાને રહેવાનું ધર વગેરે વગેરે બધી જરૂરિયાતો મેળવવાને માટે તેને પોતાને જ દરેક જાતનો શ્રમ કરવો પડતો. એકજ માણુસ પોતે શિકારી, મંદીરાર,

પ્રત્યે તેમણે તીવ્ર દેર ડેણાંધું. હજુ સુધી એ કંદ ચાહુ છે. હવે તેને જીવાળ આવ્યો છે. અને સરકારે જનપાન-સિરિયા સિવાયની આખી અશીયાર્થ પ્રણ સામે એ કાયદો અમલમાં મૂકવા ડરાંધું છે.

આ પ્રસ્તો રંગીન પ્રણાના દરેક વગો પોતપોતાનો જુદો સ્વાર્થ એણે એ કરતાં આખી પ્રણ એકમેકને માટે એકજ અવાજ રજુ કરે તો એના પર પ્રલુના વધારે જોડા આશીર્વાદ બિતરશે.

રસોઈ પક્કાવનાર, ડપડાં તૈયાર કરનાર, સુતારી કામ કરનાર, મકાન ખાંખનાર વગેરે અનેક પ્રકારના શ્રમ કરનાર હતો.

પણ જેમનેમ માનવી સમાજમાં રહેતો થયો અને સમાજજીવન દિન-પ્રતિદિન પ્રગતિ પામવા લાગ્યું, તેમને સમાજમાં તેમ જ વ્યક્તિના જીવનમાં શ્રમની હેઠાંથીને સ્થાન મળ્યું. શ્રમની હેઠાંથી આવતાં અમુક માણુસો 'ઝેલું બન્યા, ડાર્ઢ મચ્છીમાર બન્યા, ડાર્ઢ દરજ બન્યા, ડેઢ મોચી, ડાર્ઢ ધાંચી, ડાર્ઢ સુતાર તો વળી ડાર્ઢ લુહાર બન્યા, એમ અનેક પ્રકારની જરૂરિયાનો પૂરી પાડવાને મારે વિવિધ પ્રકારના ધ્યાનોવાર શ્રમની હેઠાંથીના સિદ્ધાન્ત ઉપર આખાયે સમાજનું આધિક જીવન શક્ય બન્યું. શ્રમની -હેઠાંથીના સિદ્ધાન્ત અમાણે ચાલતું સમાજજીવન વધારે સુગમ, સરળ, સંગીત અને સુખ આપનાં પણ પરિણુંથ્યું.

હજુ આ તો શ્રમની-હેઠાંથીની પ્રાથમિક ભૂમિકા જ હતી; હેઠાંથી માત્ર સાદી સ્વરૂપમાં જ હતી. જેવી રીતે પ્રત્યેક કુદુર્ભમાં અને ખાસ કરીને જ્યાં અવિભક્ત કુદુર્ભની ગ્રથા છે ત્યાં કુદુર્ભના પ્રત્યેક સભ્યને ભાગે અમુક પ્રકારનું કામ આવી જય છે અને આખુંયે કુદુર્ભજીવન સરળતાથી અને સહેલાઈથી ચાલે છે, તેવી જ રીતે સમાજમાં રહેતા પ્રત્યેક માનવીને ભાગે અમુક અમુક પ્રકારનું કામ-અમુક પ્રકારનો શ્રમ-કરવાનું આવે છે અને સારાયે સમાજનું આધિક જીવન સુંદર રીતે સુગમતાથી ચાલે છે.

પણ આજે તો શ્રમની-હેઠાંથીને વિકાસ અને તેની વ્યાપકતા ન કલ્પી શકાય તેટલાં આગળ વધેલાં છે. વિગ્રાને યંત્રો આખ્યાં અને યંત્રાથી ઔદ્ઘોગિક કાન્તિ આવો. આ યંત્રની સફળતાના મૂળમાં તેમજ ઔદ્ઘોગિક કાન્તિના વિજયના મૂળમાં શ્રમની-હેઠાંથી છે. આ શ્રમની-હેઠાંથીને પ્રકાર ઉપર જોઈ ગયા તે સાદી શ્રમની-હેઠાંથી કરતાં જુહે છે. અર્થશાખામાં આ શ્રમની હેઠાંથીને સંયુક્ત શ્રમની હેઠાંથી અને હેઠાંથીમાં આવે છે.

સંયુક્ત શ્રમની-હેઠાંથીને આધાર યંત્ર અને જરૂરાખંધ ઉત્પાદન ઉપર જ છે, ઉસ્ટાનીને કહીએ કે યંત્રની હસ્તિ તેમજ જરૂરાખંધ ઉત્પાદનની શક્યતા કેવળ શ્રમની હેઠાંથીને આલારી છે તો તે પણ બિલકુલ સત્ય છે. સાદી શ્રમની હેઠાંથી આજના સામાજિક જીવનની જેટલી વાસ્તવિક ઘટના છે તેટલી જ ખલ્કે તેથી પણ વિશેષ સંયુક્ત શ્રમની-હેઠાંથી યાંત્રિક ઉત્પાદનની વાસ્તવિક ઘટના છે.

ગુહાઓગના ધૂગમાં, હજુ જ્યાંસુધી યંત્ર ઉત્પાદના ક્ષેત્રમાં પ્રવેશ્યું નહોતું ત્યાંસુધી, પ્રત્યેક ઉદ્ઘોગમાં બનતી જુદી જુદી વસ્તુઓને, બનાવનાર સંગાંગ રીતે પહેલેથી છેલ્દે સુધી તેની બધી વિધિ પોતાના જ શ્રમથી સંપૂર્ણ કરી તૈયાર કરતો. જેમકે આપણો મોચી પગરખાંને, સંગાંગ પોતાના શ્રમથી તેના અધા ભાગોને તૈયાર કરી, બનાવે છે; તે જ પ્રમાણે લુહાર, તે જ પ્રમાણે સુધાર. પ્રત્યેક કારીગર જે યંત્રનું અવલંખન નથી કેતો પણ હાથ કારીગરિયી કામ કરે છે તે તૈયાર કરવાની વસ્તુને સંગાંગ પોતે જ તૈયાર કરે છે.

પણ યાંત્રિક ઉત્પાદનમાં જ્યાં સંયુક્ત શ્રમની હેઠાંથીનો સિદ્ધાન્ત ખૂબ જ વ્યાપક બને છે ત્યાં તો બનાવવાની વસ્તુના અનેક ભાગ પાડી નાખવામાં આવે છે અને પ્રત્યેક ભાગ જુદા જુદા માણુસથી-મજૂરથી તૈયાર થાય છે, અને છેવટ બધા ભાગોનું સંયોજન એક જગ્યાએ થઈ વસ્તુ સંપૂર્ણ સ્વરૂપમાં તૈયાર થઈ બહાર આવે છે. જેમકે ખૂટના કારખાનાઓમાં આપોય ખૂટ એક માણુસ નથી બનાવતો પણ એ ખૂટના લગભગ એશી

નેટલા વિભાગો કરી નાખવામાં આવેલા હોય છે અને પ્રત્યેક વિભાગ જુદો જુદો તૈયાર થઈ છેવટ બધાયે વિભાગોનું સંયોજન થઈ ઝડપ તૈયાર થાય છે. પ્રત્યેક મન્જૂર માત્ર ઝડપનો અંશીગો ભાગ જ હરહંમેશને માટે બનાવ્યા કરતો હોય છે. આ પ્રમાણે શ્રમની હેંચણી નેટલી વધારે સૂક્ષ્મ તેટલી ઉત્પાદનની શક્તિ વધારે. નેટલે ઉત્પાદનની શક્તિને વધારવા માટે શક્ય હોય ત્યાંસુધી શ્રમની હેંચણોને વધારે ને વધારે સૂક્ષ્મ બનાવવામાં આવે છે; ઉત્પાદનની વસ્તુના શક્ય હોય તેટલા વધારેમાં વધારે વિભાગો પાડી નાખવામાં આવે છે. આમ કરવામાં કામ કરનારાન્નો વધારે સંખ્યામાં રોકવા પડે છે અને તે ત્યારે જ ભની શકે જ્યારે ઉત્પાદન જરૂરાંધ્ય કરવાનું હોય તેમ જ જરૂરાંધ્ય તૈયાર થતા ઉત્પાદન માટે વિશાળ બજાર હોય. માત્ર જરૂરાંધ્ય ઉત્પાદન અને વિશાળ બનારને પરિણામે શ્રમની હેંચણોને સૂક્ષ્મતમ બનાવી શક્તિ નથી પણ ઉત્પાદન સતત ચાલુ રહેલું. જોઈ એ. જે ઉત્પાદન સતત ચાલુ ન રહે તેમ હોય તો કાઈ પણ એક વસ્તુનો સોમો કે હજારમો ભાગ માત્ર બનાવવા પૂરતો મન્જૂર કામ કરવા તૈયાર નહીં થાય. જેતીવાડીના ધંધામાં યાંનિક ઉત્પાદન કરતાં સંયુક્ત શ્રમની હેંચણી બહુ જ બોડા પ્રમાણમાં શક્ય બને છે તેનું કારણું આ જ છે. યાંનિક ઉત્પાદન નેટલો કૃષિઓગ સતત હોતો નથી.

ઉત્પાદનના ક્ષેત્રમાં સંયુક્ત શ્રમની હેંચણીમાંથી પૂરેપૂરો લાલ ઉડાવવો હોય તો પ્રત્યેક મન્જૂરને એકજ પ્રકારના કામ ઉપર—અને તે કામ ઉત્પાદનની વસ્તુનો શક્ય હોય તેટલો નાનો વિભાગ—સતત લગાડવો જોઈએ. આવી રીતે પ્રત્યેક મન્જૂરને તેની શક્તિ અને યોગ્યતા પ્રમાણે જુદા જુદા અંકેક વિભાગનું કામ આપવાથી તે વિભાગ તૈયાર કરવામાં અસાધારણું કુશળતા, તે મન્જૂર પ્રાપ્ત કરી શકે છે. પરિણામે કામ વધારે સારું અને સચોટ બને છે. પ્રત્યેક વિભાગ તૈયાર કરવા પૂરતું યંત્ર પણ વિશિષ્ટ પ્રકારનું થતું જય છે.

શ્રમની હેંચણોને પરિણામે ઉત્પાદનના ક્ષેત્રમાં અનેકવિધ ફાયદાઓ થાય છે. નેમકે પ્રત્યેક મન્જૂરને તેની શક્તિ કે યોગ્યતા પ્રમાણે કામ આપી શકાય છે. સ્વી-મન્જૂરો અને ભાગ-મન્જૂરો ઉત્પાદનના ક્ષેત્રમાં શ્રમની-હેંચણીના સિદ્ધાન્તને પરિણામે જ પ્રવેશી શક્યાં છે. એકજ પ્રકારનું કામ સતત કરવાથી કાર્યમાં કુશળતા પ્રાપ્ત થાય છે; પખતનો, મૂડીનો, સાધનોનો સંપૂર્ણ રીતે ઉપયોગ થઈ શકે છે તેટલું જ નહીં પણ ધણું લાભથી ઉપયોગ કરી શકાય છે. યંત્રનો ઉપયોગ ખૂબ જ બ્યાપક બનાવી શકાય છે.

ઉપર નેચેલા શ્રમની હેંચણીના ફાયદાઓ માત્ર દાલની એકજ બાળુ છે. દાલની બીજી બાળુ-તેનાથી થતા ગેરકાયદાઓ ડેટલા લયકર છે તે ડોડાખુથી વિચાર કરતાં કમકમાં આવે તેવા છે. શ્રમની હેંચણી ઉત્પાદનના ક્ષેત્રમાં નેવાં સ્વી-મન્જૂરો અને ભાગ-મન્જૂરોને લાવે છે કે તેનીજ સાથે એકારી, અનીતિ, કુંભળવનનો વિનાશ અને શૈશવનો નિર્દ્દિષ્ટ આનંદ અને વિકાસ હથી નાખે છે.

એકજ પ્રકારનું કામ આપી જિન્દગી સુધી કરતાં કદાચ તે કામ પૂરતી કુશળતા પ્રાપ્ત થાય પણ સાથે સાથે તે મન્જૂરના જીવનમાંથી જીવનની તેમજ શ્રમની બીજી પધી બાળુઓ બંધ થઈ જય છે, તેના જીવનમાંથી વિવિધતા અને રસ બીજી જય છે, તે યંત્રની સાથે માત્ર યંત્રવત અની જીવન પસાર કરે છે, અને સહાને માટે મૂડીદારનો યુલામ અની રહે છે કારણું કે એક વસ્તુનો સોમો કે હજારમો ભાગ બનાવવા સિવાય તેને કંઈ આવડતું નથી.

યંત્રનો ઉપયોગ અલખત શ્રમની વ્હેચણીને પરિણામે ખૂબ જ વ્યાપક બને છે પણ યંત્રની વ્યાપકતા સાથે માનવીના શ્રમની જરૂર એાછી થતી જય છે નેથી યંત્ર પોતે જ માનવીનું સ્થાન દેતું જય છે અને માનવી કામ વિનાનો એકાર રખે છે. જ્યાં હજરો મજૂરોની જરૂર પડતી ત્યાં આજે યંત્ર એક ચાલી ચલાવનારથી હજરો મજૂરોનું કામ કરે છે. આખા જગતભરમાં માનવીના આર્થિક જીવનને એકારીનો પ્રશ્ન આજે ગુંગળાવી રહ્યો છે અને એ પ્રશ્ન માટે શ્રમની-વ્હેચણી એાછી નોખમદાર નથી.

શ્રમની વ્હેચણીને સિક્ષાંત તરીકે તેમજ ઉત્પાદનને તે જે વેગ આપે છે તે દાખિયે અવગણ્યી શકાય કે વખ્ચાડી શકાય નહિ પણ મૂડીદારના કાળ્યમાં એ સિક્ષાંત મજૂરોના રોષણ અંદે વપરાય છે તેટલા પૂરતી એ પ્રથા બયકર છે. આ સિક્ષાંતનો ઉપયોગ, માનવ જાતનું આર્થિક હિત સંધાય અને માનવીનું આર્થિક કલ્યાણ થાય તે રીતે કરવામાં આવે તો તે ખરેખર આશિર્વાદિત્ય છે.

ઉપર જોયેલા શ્રમની વ્હેચણીના એ પ્રકાર-સાઠી અને સંયુક્તા-ઉપરાંત ત્રીજે પ્રકાર ભૌગોલિક શ્રમની વ્હેચણીનો છે. આ પ્રકાર સાઢી શ્રમની વ્હેચણીનું વિશાળ સ્વરૂપ છે. પ્રત્યેક દેશની પ્રાકૃતિક સંપત્તિ પ્રમાણે જુદા જુદા પ્રકારનું ઉત્પાદન થાય અને તે પ્રમાણે, પરસ્પર રાણ્ણો, આંતરરાષ્ટ્રીય વ્યાપારથી રાજ્યની બધી જરૂરિયાતો પૂરી કરી લ્યે. વિનિમયના સાધનોને પરિણામે આ પ્રકારની ભૌગોલિક શ્રમની વ્હેચણી શક્ય બને છે અને તે શક્ય બનતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અને આંતરરાષ્ટ્રીય વ્યવહારનો જન્મ થાય છે. જેમકે કૃષિપ્રાધાન્ય દેશ ઐતીનું જ ઉત્પાદન કરે, ઉદ્ઘોગપ્રાધાન્ય દેશ યાંત્રિક ઉત્પાદન જ કરે, પ્રત્યેક દેશ પોતાની આડૃતિક અનુકૂળતા પ્રમાણે ઉત્પાદન કરે. આ પ્રકારને પરિણામે જગતનું આર્થિક જીવન વધારે સુગમ અને સરળ બને છે. માનવીની દરેક પ્રકારની જરૂરિયાતો પૂરી પડે છે.

## સૌદામિની

[ રાજ તિળંગ—ચિતાલ ]

મહેન્દ્રદુમાર ડેસાઈ

મંદ મંદ મલકે માનિની,  
ઉલ્લસતી મધુ સ્કુરતી નંદિત,  
હાર હમામથી મોહિની હામિની  
મંદ મંદ મલકે માનિની.  
પ્રશ્યુયશિખ સોછત મોહતિમિરે,  
કૃષ્ણ-ગેદ મહી વીજ સોહિની,  
પરમાનહે નાચે થતુરા,  
પુલકિત કાજળકાય થામિની,  
મંદ મંદ મલકે માનિની.

## શ્રી સુવાસ

ગ્રંથ

મહાન શિવાજુના પિતા શાહજી બોલપુરના નવાખના સરદાર હતા. નવાખે સરદારના પુત્રને સલામીએ બોલાવ્યો. પણ શિવાજુએ જોવધ ચલાવનારના દરખારમાં જવાની ચોક્કી ના સંલાયાની. નવાખે જોવધની બંધી ફરમાવી; સાંચ કલખખાનાં પણ તેણે ગામ બહાર લેવરાવ્યાં. જોવધ ફરનારને માટે તેણે જ્યારે મુલ્યની સળ જહેર કરી ત્યારે જ શિવાજ તેના દરખારમાં ગયા.

એક વખતે ખીનપુરના ચૌટામાં એક વીફેલ ખાટકીએ ગાંય પર તરખાર ઉગામી. તે તરખાર ગાયના ગળાને રફ્ઝે એ પહેલાં જ ત્યાં અક્ષમાત આવી પહેંચેલ શિવાજુએ આટકીનો એ હાથ કાપી નાખ્યો.

શિવાજુના અગ્રીયામાંથી બાગવાનની રણ સિવાય ડોઢાએ કંઈ તોડવું નહિ એવું શિવાજુના ગુરુ ડેઢાદેવે ફરમાન આદેલું; પણ એક પ્રસંગે ભૂલથી ગુરુ ડેઢાદેવ પોતે જ બોડાંક ફળ તોડી એહા. એ ભૂલ માટે તે તરત જ પોતાનો જમણો હાથ કાપી નાખવા તૈથાર બન્યા. પણ એ પળ ત્યાં આવી પહેંચેલ શિવાજ વરોરદે તેમને પગે પડીને તેમ કરતાં અટકાવ્યા. છતાં ગુરુજે એ ભૂલની યાદગીરી માટે પોતાના પહેરણુંની જમણું બાંધ તો હેશને માટે કાપી જ નાંધી.

શિવાજ મુસલમાનોના કદ્દ દુઃખન હતા, તેમના પિતા શાહજી મુસલમાની નવાખના સરદાર હતા. એક પ્રસંગે શાહજી શિવાજુના પ્રદેશમાં એડોયાનાં દર્શને આવ્યા. શિવાજુએ સામે જઈ તેમનું લક્ષીનાવથી સન્માન કર્યું. એડોયાના મંદિરથી જેલુરી ગામ સુધી પિતાને રાજવંશી પાલખીમાં લઈ જવાની તેમણે બ્યવસ્થા કરી. નેતે પોતે હાથમાં લોડા ઝાલી પાલખીની સાથે સાથે ચાલ્યા.

છત્રપતિ શિવાજ એક પ્રસંગે સંત તુકારામના ભજનમાં ભસ્ત થઈ ડોલવા માંડેલા. તે વખતે મોગલ સૈન્ય તેમને ધેરવાને આવી પહેંચયું હોવાની ભૂમ પડી. પણ મહારાજ ભજનની ધૂનનેજ વળજી રહ્યા. આ કટોકટીની પળ એક મરાડા સરદારને એક યુક્તિ જરી આવી. ને મહારાણા પ્રતાપને નેમ રાજ માનસિહે બચાવી લીધો હતો, ગુર્જરપતિ સિદ્ધરાજને નેમ શ્રી. મુનશીનો અનાવટી કાંક બચાવી લે છે એમ છત્રપતિ શિવાજુને બચાવવાને તેણે તેમના માથા પરનો મુગટ ઉકાવી લીધો. તે મુગટ પોતાના માથા પર મૂકી તે ત્યાંથી આગો નીકળ્યો, ને મોગલ સૈન્યે તેનેજ શિવાજ માની રેનો પીછો લીધો.

\*

નેપોલિયનની સાત વર્ષની વધે તેના કાકાને ત્યાંથી ફુલનો એક ઝરાયો આવ્યો. તેની નાની-મોટી એ બહેનોએ તેમાંથી કેટલાંક ફળ ઉડાવી લઈ ચોરીનો આરાપ નેપોલિયન પર, ઢોળ્યો. પિતાએ નેપોલિયનને ચાલુખાની સળ કરી તેને ત્રણ હિવસ ભૂષે માર્યો. નેપોલિયને

એ બધું શાંતિથી સંખ્યા કર્યું. છેવટે બહેનો ભાઈની આ કરણું સ્થિતિથી પીગળા જાડી. તેમણે પોતાની ભૂલ કષૂલી. જ્યારે નેપોલિયનને આ સંબંધી પૂછવામાં આવ્યું ત્યારે તે ઓલ્યો, ‘તેઓ સ્વી છે, મારી બહેનો છે, ડેમળ વયની છે. તેમને સજી કરવામાં આવે તે કરતાં મને થતી સંખ્યા એમને વધારે શાખવાનું મળ્યું છે.’

નેપોલિયન દુધલેરીસ-મહેલના સ્નાનઅંડમાં મરામતની ડેટલીક વ્યવસ્થા કરેલી. મહેલના અધિકારીએ તે વિભાગમાં હ્રાસના સર્વોત્તમ ચિન્તકારી પાસે ડેટલાંક સુંદર ચિત્રો દોરાવ્યાં. ખંડ તૈયાર થઈ જતાં નેપોલિયને જ્યારે સ્નાન કરવા માટે ત્યાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં દોરાયેલ ચિત્રોમાં ડેટલાંક સ્વીચ્છિયો તરફ તેની નજર ખેંચાઈ. તે તરત સ્નાન કર્યા ચિના જ તાંથી બહાર આવ્યો. મહેલના અધિકારીને પોતાની સમીપ બોલાવી તે ઓલ્યો; “સ્વીએનું સંનામાન જળવો.” – ને જ્યારે એ ખંડમાંથી સ્વીચ્છિયોને ભૂંસી નાંખવામાં આવ્યાં ત્યારે જ તેણે તે ખંડમાં સ્નાન કર્યું.

સેનાપતિ સોલટને નેપોલિયને સ્પેનના યુદ્ધમાં જવાની આસા ફરમાવી. પણ સોલટની સ્વરૂપવતી અને તેજસ્વી પત્નીને એવા જોખમી પ્રદેશમાં જતું ન ગમ્યું. તેણે સોલટને દ્વારાવી દીધો. નેપોલિયનને આ સમાચાર મળતાં તેણે સોલટની પત્નીને પોતાની સમીપ બોલાવી. ને રૂપરૂપના અંબાર વર્ષાવતી એ ઉમરાવનજી નેપોલિયનની સમજ્ઞ આવી ધડાધડ પોતાની મુશ્કેલીએ વર્ણિવવા માંડી.

“શ્રીમતીજી,” નેપોલિયન શાંતિથી કહ્યું, “હું તમારો પતિ નથી કે મારી સામે જેમને એલો છો. તે જે પતિ હોત તો તમે આ રીતે એલતાં શીખ્યાં પણ ન હોત. યાદ રાખો, શાસકની આસા એ સેનાપતિનો ધર્મ છે; પતિની આસા એ સ્વીનો ધર્મ છે. મેં તમને અહીં શિખામણ લેવા નથી બોલાવ્યાં. જાઓ, તરત સ્પેન ચાલ્યાં જાઓ.”

બિચારી ઉમરાવનજી તો હડોગાર બની ગઈ. બાંને જ દિવસે તેણે પતિની સાથે સ્પેનનો રસ્તો પકડ્યો.

મુલાકાતે આવનાર પ્રત્યેક સ્વીને નેપોલિયન વણું પ્રક્રિયા પૂછતોઃ ‘તમે કયા કુળનાં છો? તમારી વય શું? તમને ડેટલાં સંતાન છે?’ આ વણું પ્રશ્નોના કંબિક ઉત્તર ગોઝી એક વૃદ્ધ અને બહેરાં મેડમ નેપોલિયનને મળવા ચાલ્યાં. પણ કમલાગ્યે નેપોલિયને એ જ પ્રસંગે પોતાના પ્રશ્નોમાં ફેરફાર કર્યો.

તેણે પૂછ્યું, “આપ ખૂટ સેનાપતિનાં ભાલી થાઓ?”

મેડમે કહ્યું. “હું ખિસેક...”

“આપને કંઈ સંતાન છે?” નેપોલિયને પહેલા પ્રશ્નનો ઉત્તર ન સમજાતાં પૂછ્યું.

“આવન” વૃદ્ધ મેડમે હસીને ઉત્તર દીધો.

આદ્યાં બધાં સંતાનની ભાગ્યશાળા માતા તો નેપોલિયનના ધ્યાન બહાર રહી શકે જ નહિ. એટલે એણે વિશેષ મુલાકા માટે પૂછ્યું, “આપની ઉમર?”

“સાત” વૃદ્ધાંગ ગર્વથી ઉત્તર દીધો.

નેપોલિયન પહેલાં તો ગુંઘવાયો. પણ પછી પરિસ્થિતિ સમજાઈ જતાં તેણે વૃદ્ધાને હસીને વિદાય આપી.

સેનાપતિ મોંથાલે એ વખત દ્યુરાછેડા લેનાર રી સાથે લમ્બ કરવાની નેપોલિયન પાસે મંજુરી ભાગી. નેપોલિયનને દ્યુરાછેડાની પદ્ધતિ દૃષ્ટાંબરી લાગતી. પોતાના સેનાપતિએ એવી રીતી સાથે પરણે એ તેને ન સચ્ચયું. પરિણામે તેણે એવી અનુમતિ આપવા ના કહી. પણ મોંથાલને તફન નિરાશ ન કરી નાખવાને તેણે ઉમેદું, “તમે પ્રેસોડેન્ટ સેગરની લત્તીજી સાથે પરણો એ વધારે ચોણ્ય છે.” પણ કર્મભાગે નેપોલિયને પ્રેસોડેન્ટની ને લત્તીજીનું સૂચન કર્યું એ લત્તીજી એ વખત દ્યુરાછેડા લેનાર અને મોંથાલની ઉક્ત પ્રિયતમા હતી.

નેપોલિયનને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે તે ખીનયો. તેણે કહ્યું, “મારી ન્યાય-સભામાં દ્યુરાછેડા લેનાર રીતોને માટે સ્થાન નથી.” ને સેનાપતિ મોંથાલને તેણે પોતાની પત્ની સાથે વર્જિંગની ડાર્ટમાં પ્રવેશવાની મના ફરમાની.

એક વખતે નેપોલિયન ફ્રાન્સમાં બળવાનાં મૂળ રોપનાર ઇસોની પ્રતિમા પાસેથી પસાર થતો હતો. તે પ્રસ્તરે એ પ્રતિમા સામે જોઈ એ વખતયો, “આ માણુસ ને પાક્યો જ ન હોત તો ફાન્સની શાન્તિ વિશેષ જળવાત.”

પાસે જિબેલ ડેટલાક પ્રણજનોએ આ સાંલળી પૂછ્યું, “નામહાર આપ આમ કેમ જોલો છો? બળવાને લીધે વધારેમાં વધારે લાંબ તો આપને થયો છો?”

“હું જાણું છું,” નેપોલિયને હું:ખ્યૂર્ઝ શાતિથી કહ્યું, “પણ હું એ પણ જાણું છું કે ઇસો ન થયો હોત, બળવો ન થયો હોત કે હું પણ ન થયો હોત તો ફાન્સની અને જગતની શાંતિ વિશેષ જળવાત.”

એક પ્રસ્તરે એક મેલાંદેલા ચિત્રકાર નેપોલિયનને બળવાને આવ્યો. નેપોલિયને શરૂ-આતમાં તો અના પ્રયે કશું ધ્યાનજ ન આપ્યું; પણ જ્યારે નેપોલિયન સાથે થોડોક સમય ચિત્રકલા સંબંધમાં વાતરીત કરી ચિત્રકાર જવાને બિડ્યો ત્યારે નેપોલિયન તેને બારણું સુધી વળાવવા ગયો.

ચિત્રકારે વિનયપૂર્વક આ ફેરફારતું કારણ પૂછ્યું. નેપોલિયન ઓલ્યો, “માણુસ આવે છે ત્યારે કપડાંથી ઓળખાય છે. જાય છે ત્યારે ગુણથી.”

\*

ગુરુ ચૈતન્યહેવ એક પ્રસ્તરે એટમાં એક મિત્રની સાથે જળવિહાર કરતા હતા. એ પ્રસ્તરે તેમણે તરતમાં પોતે રચેલો ન્યાયનો અદ્ભુત અન્ય મિત્રને જોવાને આપ્યો. પણ અન્ય જોઈને તો મિત્રની આંખમાંથી જિલાં આંસું સરી પડ્યાં.

“કેમ?” ચૈતન્યહેવે ચમકીને પૂછ્યું.

“ભાઈ,” મિત્રે હું:ખ્યૂર્ઝ દ્યુપાવતાં કહ્યું, “મેં પણ અમરકીર્તિ કરવાને ન્યાય પર એક અન્ય લઘ્યો છે. પણ આ અન્ય જોતાં જણ્યાય છે કે મારા એ અન્યનો ડાઈ કરેલો ભાવ પણ નથી પૂછવાતું.”

“એમ!” ચૈતન્યહેવ હસીને પોતાના અન્યને સરિતામાં પદ્ધરાવતાં ઓલ્યા, “હવે તો ભાવ પૂછાશો ને?”

\*

એક પ્રલાતે ગુર્જરપતિ બીમહેવના સામંતો શાબની હાજરીમાં એક નિશાન તાકતા હતા. પણ તે નિશાન ડાઈથી ભેદાતું નહોતું. એ પ્રસ્તરે તાં મેલાંદેલા વેશમાં એક અજાણ્યો

## ૧૬૨ .. સુવાસ : શ્રાવણ ૧૯૬૪

વાણુક-યુવાન આવી પહોંચ્યો. તેણે સામન્તોનો ઉપહાસ કરતાં ગુણપૂજક રાજએ તેને પણ નિશાન લાડવાની અનુમતિ આપી. યુવાને તે જ પણ નિશાનને એક ભાણુથીજ વીધી નાખ્યું.

રાજએ બાણ ડેટેલે દૂર પડ્યું છે તે તપાસવાને એક સૈનિકને મોકલવા માંડ્યો. યુવાને હસીને કહ્યું, “રાજનું સૈનિક નહિ, ધોડેસ્વાર મોકલે. નહિતર સાંજ સુધી પણ તે પાછા નહિ કરે.”—ને ખરેખર તેનું બાણ નિશાન લેદીને જ માર્દિલ છેટે જધ પડ્યું હતું.

“તારું નામ?” રાજએ તે યુવાનને પૂછ્યું.

યુવાને વિનયપૂર્વક હસીને કહ્યું, “લોકો મને વિમલના નામે એળાપે છે.”

જગત એ યુવાનને આણુનાં સ્વર્ગાય દહેરાં બધાવનાર વિમલમંત્રો તરીક પિણને છે.

\*

અવંતીમાં એક મેધલો રાત્રે એક સુંદરી પોતાના મૃત પિતાને સંભારી ‘હા તાત, હા તાત’—એ પ્રમાણે વિલાપ કરતી હતી.

રાજમહેલમાં તે વિલાપના પદ્ધતા પડતાં રાજ ભાને તે સુંદરીનો પિતાપ્રેમ વખાણ્યો. પણ રાણીએ કહ્યું, “એ પિતાપ્રેમ ન હોય, વ્યવહાર છે.”

“એ શી રીતે?” રાજએ પૂછ્યું.

“ડેમક એ વેશ્યા છે.”

“એ ડેમ કરી જાણ્યું?” રાજએ અકિત થઈ પૂછ્યું.

“એમ કરીને,” રાજના ગાલે ચૂંટી ખણું હસીને રાણી-સૌભાગ્યસુંદરી એલી, “ક વિલાપમાં તે એકલો તાત શખ્ફ વાપરે છે. જ્યારે ઇનું વખતે ખરી રીતે તો આપ ક પિતા શખ્ફ વપરાય, પણ પોતાના એણ પરની રંગપ્રભા ભૂસાઈ ન જાય એ માટે તે એ એણસ્થાની શરીરો નથી વાપરતી.”

\*

સેનાપતિ આન્ટનું લસ્કર જ્યારે દક્ષિણ તરફ કૂચ કરતું હતું ત્યારે સૈન્યના આગળના ભાગનો લેઝેનેન્ટ પોતાને આન્ટ તરીક એળાખાની, ત્યાં આવેલાં ધરોમાંથી કે કંઈ એરાક મળ્યો તે પોતાના મહદ્દીશોની સાથે હોઈયાં કરી ગયો.

પાછળ આવતા આન્ટને જ્યારે આ અનાવની ખરી પડી ત્યારે તેણે શિક્ષાની એક જુદી યુક્તિ વિચારી. તે આગળના ભાગમાં આવી એલયો, “લેઝેનેન્ટ મહાશય મારા નામે બધું હોઈયાં તો કરી ગયા છે પણ એક ધરમાં દુધીનું એક લભિયું રહી ગયું છે, તેમણે સો સૈનિકા સાથે ત્યાં જઈએ લભિયાનો પણ ગોળ્ય નિકાલ કરવો જોઈએ.”—ને બિચારા લેઝેનેન્ટને એમ કરતું પડ્યું.

હુશ્મનસૈન્ય પર વિજય મેળવ્યા પછી સેનાપતિ આન્ટે એ સૈન્યના સેનાપતિની શાધખેણ કરવા માંડી. પણ ડેટલાક સૈનિકાએ કહ્યું, “નામદાર, આખા સૈન્યમાં આપ એમને જ પહેલાં પકડનાનું પરંપરા કરશો એમ માની તોંબો પહેલેથી જ સહીસસામત સ્થળે ચાલ્યા ગયા છે.”

“હત તારોની,” આન્ટે હસીને કહ્યું, “મારે તો એને થોડું છનિામ આપવું હતું. ડેમક હુશ્મન-સૈન્યમાં એના જેવા સેનાપતિઓ છે એને લિધે તો અમે મહસ્તનો ભોગ આખ્યા વિનાજ આઠલી સહેલાઈથી વિજયો મેળવી લઈએ છીએ.”

## પરહેશી આંખે—

[ ચર્ચાપત્ર ]

તંત્રી શ્રી—

આજે આપણે શિક્ષણ અને સંસ્કારમાં, વાણી અને વર્તનમાં, વિચાર અને પહેરવેશમાં, ધર્મ અને રાજકોરાયમાં તો પરહેશી બની ગયા છીએ. પણ આપણાં એ મોટામાં મોટાં ક્રમભાગ્ય નર્થો કે હણરા વર્ષો સુધી હિંદુનું સ્વાતંત્ર્ય સાચવી રાખનાર, જગતની સર્વોત્તમ સંસ્કૃતિ ધનાનાર, પ્રણને પવિત્રતાના મંત્રો શીખવનાર આપણા મહાન પુરુંને ને આપણા ઈતિહાસને પણ આપણે પરહેશીઓની આંખે કે પરહેશીઓએ આપણને આપેલી આંકડીઓ માપી રહ્યા છીએ? ડેટકટલાંય ઈતિહાસિક અસત્યોને આપણે પરહેશી આંખે સત્ય તરીકે જોઈ રહ્યા છીએ. એવાં અસત્યો અનેક છે પણ અહીં હું એ વિષયને નથી સ્પર્શિતો. અહીં તો મારો આશય આપણાં ડેટલાંય સ્વાભાવિક સત્યોને આપણે ડેવળ પરહેશીઓને અતુસરિને ચૂંથી રહ્યા છીએ; ડેટલાંય નામોને ભ્રષ્ટ કરી રહ્યા છીએ; અંગ્રેજીના ઉચ્ચારને ન સમજી, ઝૂણી તપાસી જોવાને બદલે, ડેટલીક વખત, બિચારા પરહેશીઓએ લીધેલ અમને પણ આપણે ડેવો હાર્યારપદ બનાવી રહ્યા છીએ એ સંખંધી કંઈક ટાંચણો આપવાનો છે.

ટાંચણો કે દાખલાઓ આપતાં તે તે લેખકાનાં નામ નોંધવાં પડે એ સ્વાભાવિક છે. પણ એનો અર્થ એ નથી કે હું એ લેખકોની ભૂલો દર્શાવવા માંગું છું. અનેક લેખકોની અનેક ભૂલો નોંધવાનો અહીં અવકાશ પણ નથી. પરિણામે થોડાક નોંધપાત્ર દાખલાઓએ રજુ કરી, આપણી સ્વતંત્ર-સમય પ્રણાલીય ચોકસાઈ ડેવળ પરહેશીઓને અતુસરિને ડેટલી અવનત બની રહી છે એ દર્શાવવા રણ લઈ છું.

ચંદ્ર ને મલયાગીરી નામે રાજદ્વાપતી અને સાધર ને નીર નામે તેમના પુત્રોની હક્કીકત ભારતભાષાની છે. પણ કંનલ ટોડે, ‘દ્રાવેદ્સ ધન વેસ્ટર્ન ઇન્ડિયા’માં લખ્યું કે, ‘ચંદ્રનરાજએ ચન્દ્રનાવતી (વડોદરા) વસાયું હતું. તેને મલયાગીરી નામે પત્તી અને સોઢી અને નીલા નામે એ છોકરાઓ હતી.’ આ વિધાનો ડેટલાં સાચાં છે એની તપાસ કર્યા વિના જ એન્સાઇઝલોપોડિયા ઇન્ડીકા’, ડૉ. નંદલાલકૃત ‘નોંધારીકલ ડિક્ષનેરી’ વગેરેમાં એની એ રીતે નોંધ લેવાઈ.

વડોદરાનું મૂળ નામ પરહેશીઓએ વીરવતી (વીરાથી વસાયલી) હેરયું. અંગ્રેજીમાં એ પરથી લખાયું—‘Viravati’; ને એ અંગ્રેજ શખ્ષ પરથી શ્રી. નર્મદાશંકર લાલશંકર કવિએ ‘ગુજરાત સર્વ સંગ્રહ’માં લખ્યું—‘વરાવતી.’ વરાવતીનો અર્થ રવ. કવિ નાણે. પણ એ પરથી ડૉ. અલ્લેકર જેવા અનેક વિદાનોએ એવા જ ઉતારા કર્યા.

રાજીની બંધુરાજનું અંગ્રેજ શખ્ષાંતર Dhandhuraj. એ પરથી રાવખાદુર દેસાઈ જેવાના ઈતિહાસમાં પણ દુરોજ લખાયું.

મહાકવિ ‘આસાડ’ને ‘કવિસભાસુંગાર’નું બિરુદ્ધ ભગેલું. ‘આસાડ’નું અંગ્રેજ રૂપાંતર ‘Asad’ અથવા ‘Ashad.’ એ અંગ્રેજ શખ્ષ પરથી શ્રી. મોતીયંદ કાપડિયાએ

‘શ્રી. હેમચન્દ્રાચાર્ય’ નામના પોતાના અનુવાદઅન્થમાં કવિનું નામ લખ્યું, ‘અષાડ.’ બિચારાનું નામ બદલ્યું તો બદલ્યું પણ એના ‘કવિસભાણગાર’ના બિરુદ્ધે પણ ‘કવિસભા સંગ્રહ’ કરી દીધું. એજ અન્થમાં મહારાણી જૈતલલાહેવી ‘Jayataladevi’નું નામ બદલાયું ‘જૈતલાહેવી’.

ટાડે વસ્તુપાળની પત્ની લલિતાહેવી વિશે લખ્યું છે, “લલિતાહેવી વસ્તુપાળ કે તેજપાળ એમાંથી એકની મા, પત્ની કે છેવે દીકરી હતી.” આ પરથી કાઠક એને દીકરી ટેરવી તો કાઠક એને મા ટેરવી.

‘મુદ્રાણ્યાપાર’નો અર્થ થાય રાજમંત્રીનો વ્યવસાય. પણ અણુણણું પરહેશીઓએ તેનો અર્થ કર્યો શરારી ધ્યો. ને એ અર્થને અનુસરી આપણા સંશોધકોએ કેટલાય મંત્રીઓને શરાદ ટેરવી દીધા.

ક્રાંતિસની રાસમાળામાં પાનેપાને જેરસમજુતીએ ભરેલી છે. તેની વિરુદ્ધ બીજી પ્રમાણું જૂત હકીકતો પણ મળી રહે છે. છતાં એ અન્થ જાણે ગુજરાતના ધતિહાસનો એક માત્ર અદ્ભુત અન્થ હોય એમ એની આગળ એવી વિશેષ આદરણીય હક્કાક્રતોનોકરે મારવામાં આવે છે.

ટાડે લખ્યું છે, ‘સંવત ૧૨૩૪માં કુમારપાળના શાસનકાળ દરમિયાન તેના મંત્રી વસ્તુપાળ.....મંદિરાની પ્રતિષ્ઠા કરી.’ કુમારપાળ ૧૨૩૦માં અવસાન પામેલ અને વસ્તુપાળનો ઉદ્ઘાટન ૧૨૭૫ પછી થયો છે એ નગદ ધતિહાસ છે. છતાં આ હક્કાકત પરથી ઊંઘાંદી અહેકર જેવા અનેક વસ્તુપાળને કુમારપાળનો મંત્રી ટેરવી દીધે.

આપણાં બૌગોલિક નામોની વિકૃતિએ તો એ હુદે સીમા વટાવી દીધી છે કે એને હવે રૂપર્ણાંજ નિર્દ્ધક જણાય છે.

અમણું-સંસ્કૃતિના એ મહાન સ્થળો—શ્રી યુદ્ધ અને શ્રી મહાવીર. તેમાં જે તટરથ દશ્ચિએ જેવા જઈએ તો વધારે કસાયલ ને વધારે અભ્ય જીવન શ્રી મહાવીરનું લાગે છે. છતાં એડવીન આનેરોફ અને બીજી અંગેજ લેખકોએ યુદ્ધને જરૂર્યા અને આપણે યુદ્ધને જ સર્વસ્વ માની એડા. યુદ્ધનું જીવન આપણે બૌદ્ધ અન્યોભાંથી નથી લીધું, વેલસ કે આનેરોફ જેવાએ આપણું છે એ લીધું છે;—મૂળ બૌદ્ધ અન્થો કરતાં કેટલાય વિકૃત સ્વરૂપે. ન પૂજવા જેવી કેટલીયે અતિહાસિક વ્યક્તિઓને આપણે પૂજાએ છીએ; પૂર્ણીરાજ જેવી કેટલીયે મહાન વ્યક્તિઓને તરછોડી એડા છીએ.

આને આપણી દશ્ચિ છીજરી બની ગઈ છે. એક પણ વિષયના જોડા અભ્યાસ વિના અનેક વિષયોમાં ભાયું મારવાને આપણે તલપાપડ બની જઈએ છીએ. પુરાણોની પેદર લીનોના પણ શુદ્ધ અર્થ ન કરી જાણુનાર આને પૌરાણિક સાહિત્ય પર વિવેચન લખવા એસી જરૂરો; વેદાનાં એ સ્ક્રોનોને પણ સમજ ન શકનાર વૈહિક સાહિત્ય ઉપર નિયંધો લખવા એસરો; જૈન ધર્મિહાસ, સાહિત્ય કે તત્ત્વજ્ઞાનનું ડોટ ન જાણુનાર આખા. જૈતરત્વનો પૂર્ણ અભ્યાસી હોવાનો ડોળ કરસો; ને શાંત-અભ્ય તટરથતાપૂર્વક લખવા એસી જરૂરો કે ‘જૈનોના પહેલા તીર્થકર પાર્થનાથે આમ કર્યું’ કે ‘જૈનોના આવીસમા તીર્થકર આહિનાથે આમ કર્યું.’

પણ હવે આપણે આ બધું દૂર કરી વધારે વિશુદ્ધ બનવું જોઈ એ.

ચ.-૬.

# ગોચરી

**હૃ** હિટલરના બાલમિત્ર રેઈનહોલ્ડ હેનીશે હમણું પોતાનાં સંસ્કરણો કાખ્યા છે, જે જર્મનીના એ માન્ધાતાના પ્રભાવ અને તેના વિકાસના મૂળ પર સારો પ્રકાશ નાપે છે.

અમલદાર-પિતાના મૃત્યુ પછી હીટલર અનાથ અને કંગાલ બન્યો. તે રિથ્ટિમાં તે વિયેનાના અનાથાશ્રમમાં જર્ઝ વરસ્યો. ત્યાં ડેનીશને એની મુદ્રાકાત થઈ. ભૂખથી દ્યાયલા હીટલરને ખાવાતું આપી ડેનીશે અને વિશ્વાસમાં લાયો. ડેનીશ અજાર ચિત્રકાર હતો; હીટલર પણ કંધક ચિત્રકાર નાણુંનો. બનેએ લાગીહારીમાં એ કામ આદ્યુ.

હીટલરના પિતાના અવસાન પછી, તેની સુંદર સેવાઓના અદ્દામાં, સરકારે તેના કુંફને માસિક ૫૦ કોનતું પેન્શન બાંધી આપેલું. એ નાણું હીટલરની પરિણીત અહેન લઈ લેતી. હીટલર એ નિષે પરવા પણ ન કરતો. પણ શિયાળામાં જ્યારે તે ટાથી અરથરી જિડ્યો. ત્યારે ડેનીશના કહેવાથી તેણે ગરમ ડોટ ખરીદવાને બહેન પાસેથી થોડાક પેસા મંગાવ્યા.

ડેનીશ અને હીટલર બન્ને લાગીહારીમાં કામ કરતો, પણ હીટલરને આ સામાન્ય કામ જરીક ગમતું નહિ. તે તો સમાજ, સંસ્કૃતિ ને રાજકારણની વાતો કર્યા કરતો અથવા ગહન પુરટકો કે છાપાં વાંચવામાં જ વખત વીતાવતો. પરિણામે ડેનીશને જિલ્યો તે લારડ્ય થઈ પડ્યો.

તેનો સ્વભાવ ઉચ્ચ હતો. રાજકૂય ચર્ચાઓમાં તેને ખૂબ જ રસ પડતો. અનાથાશ્રમના નિવાસીઓએ તેના આ સ્વભાવની ધર્થી વખત મસ્કરી પણ ઉડાવતા. તે જ્યારે ચર્ચા કરવા બેસે ત્યારે તેઓ તેના પહેરણનો પાછળનો લાગ શુસ રીતે પાઠલી ચાશે બાંધી નાખતા અને પછી તેઓ ચર્ચામાં હીટલરને એવો ઉશ્કેરી મૂક્તા કે તે મુશ્કીઓ ઊગામી જોબો થવા જતો. તે સાથે જ પાઠલી પણ જિછળી પડતી.

ધર્મને તે ખૂબ જ જરી માને છે. કોઈ પ્રયત્નિત ધર્મ ન હોય તો નવો. સર્જનીને પણ પ્રણને તેના પર પ્રેમવતી કરવી જોઈએ એવો તેનો અભિપ્રાય છે. પાપ-પુણ્યને પણ તે સમજે છે ને માને પણ છે. તે સંખ્યામાં તે વારંવાર વોલ્ટેરનું દિશાંત ટાંકતોઃ ‘નાસ્તિક વોલ્ટેરને એક વખતે ડેટલાક ગામદિયાઓએ લુંટી લીધો. વોલ્ટેર ચીડાછ ગયો. ગામદિયા-ઓએ કંબું, ‘જો પાપ-પુણ્ય છે જ નહિ તો આમાં હોષ શો છે ? તમારા પાસે અખત નાણું હતું, અમારે તે જોઈતું હતું ને અમે તે લઈ લીધું.’ આ પરથી વોલ્ટેરની આંખ દિધડી ગઈ ને તે હમેશ દેવળમાં જવા લાગ્યો !’

કથોલિક-ખ્રિસ્તિ ધર્મનો તે ખૂબ જ વિરોધી છે. દુનિયામાં જે લોહી રેડાયું છે તેમાંનો મોટો ભાગ તે એ ધર્મના નામ પર ચડાવે છે. ધર્શના ડેટલાક સિંહાંતો એ માને છે. સુસંસ્કૃત હિંદુ પ્રયે એને ખૂબ જ પ્રેમ છે. હિંદેને તે સંસ્કૃતિઓની જનેતા માને છે. ધર્શુ સંખ્યામાં તે કહેતો કે, ‘તે હિંદુમાં રહેલ હોવો જ જોઈએ. તેના પર ખુલ્લ ધર્મની ડારી અસર છે.’

## ૧૬૬ .. સ્નેહાસ : આવણુ ૧૬૬૫

પાશ્રાત્ય સંસ્કૃતિ વિષે એનો અભિપ્રાય ધર્મો જ હલડો છે. તે કહેતો, ‘પશ્ચિમને સંસ્કૃતિ જેવું કેર્દ હતું જ ક્યાં? એ તો બધું ધર્મયુદ્ધ (કૂંગડ) ના પ્રસંગે પૂર્વમાંથી આયાત કરેલું છે.’

ઓછો વિષે તેનો અભિપ્રાય લગભગ નેપોલિયન જેવો છે. તે કહેતો, ‘ઓછાને સન્માન આપવું પણ એમના પાસેથી પવિત્રતા, સંસ્કાર અને સેવાપરાયણુતાની પૂરેપૂરી આશા રાખવી.’

તે પોતે ધર્મો જ અતડો હતો. એક અમલદારના પુત્ર સાથે એને મિત્રતા બંધાયેલી. તે મિત્રની ખૂબ્સૂરત બહેન અને તે-બને હૃદયથી પ્રેમમાં પડ્યાં, પણ બને એકમેકને શાખદોમાં તો તે ડાઈ દિવસ ન જ કહી શક્યાં. એક પ્રસંગે એક ગોવાળકન્યા એની વાગ્ધારા પર મુગધ બની ગઈ. તેણે તેના પાસે પ્રેમની માગણી કરી. તે હીટલરને પોતાના એકાંત ધરમાં પણ લઈ ગઈ. પણ હીટલર તેને રૂપર્ખાં પણ વિનાત્યાંથી ભાગી છુટ્યો.

ગમે તેવા ગહન વિષયોમાં પણ તે માયું ભારતો. પણ એક વખતે શોપનહેગને લગતા વિષયમાં તેની કચાશ પકડાઈ જતાં પૂર્ણ અભ્યાસ વિના ડાઈ પણ વિષય પર ન આવવાનું તેણે કૃત લીધું.

અન્યાયનો તે ઉચ્ચ વિરોધી હતો. એક વખતે એને લાગ્યું કે ડેનીશો તેની સાથેના કામમાં તેને છેઠ્યો છે કે તરતજ તેણે વર્ષોઝૂના મિત્રને પણ ડાઈમાં ધરસડ્યો.

આને તે જર્મનીનો સર્વસત્તાધીશ છે પણ તેના જીવનનું ધડતર ઉપરના સાધારણ પ્રસંગેને આભારી છે.

સાયેક્ષવાદના નવા સિદ્ધાન્તના સંરોધક અને મહાન વિજાનવેતા એઈન્સ્ટીન્યુનિવેરિટીને તેના એક ગિત્રે તેના નવા વાદની ટૂંકી વ્યાપ્યા પૂછી. એઈન્સ્ટીન્યુનિવેરિટીને કહ્યું :

‘સુન્હર-ગુલાભી યુવતી પાસે એક કલાક એક મિનિટથીએ એછો લાગરો, લાદ્યારા પર એક મિનિટ કલાક કરતાં પણ વધુ લાંખી જણારો.....આનું નામ સાયેક્ષવાદ.’

અમેરિકન મ્યુલિયમમાં નેચરલ હીસ્ટરીના સાયન્સના પ્રેફેઝર કહે છે કે, ‘માનવી વધ્યા જ કરે છે. પાંચ લાખ વર્ષમાં એ રાક્ષસી ડાચાઢે પહોંચે. ભીજા કેટલાક વિજાનો એથા જિલ્લા જ અભિપ્રાય ધરાવે છે. તેમનું એમ કહેવું છે કે, “લાણો વર્ષ પૂર્વે માનવી રાક્ષસી કદ્દો હતો. ધીમેધીમે તે ધટ્ટો જ આવ્યો છે.” ને તેમની એ માન્યતાની સાખીતીમાં હમણાં વેશ્વિગ્રનની જ્યેક ડાયમન્ડ કાલસાની ખાણું પાસેથી તેમને માનવીનું સાડાતરણ કૂટ લાયું પણ ભળ્યું છે.

કેપ્ટન કેરીના જન્મ વખતે એનો બાપ એટલો બધો ખૂશ થઈ ગયેલો કે તેણે પોતાના પુત્રને હિંદી સૈન્યના અધા જ અંગ્રેજ કેપ્ટનોનાં નામ એકી સાથે આપી દીધાં. એ અન્વયે કેપ્ટન કેરીનું ખડે નામ ‘ઓરકર વીલિયમ ઇન્ડી એમલીસ શીટ્જ એલન જહોન ડોન પેટ્રો એલફોનલ્સ મેલટાર ગુરુટાઇસન ટટલ સ્ટેપ કાર્લ કેરી’ છે.

નીશ્રાનતિમાં એમ મનાય છે કે મોઢામાં ને ચાંદીનાણું રાખવામાં આવે તો ભૂતપ્રેત વળગતાં નથી. એને અનુસરી જેન વેબસ્ટર નામના નીશ્રાને ૪૪ વર્ષ સુધી સતત પોતાના મોઢામાં ચાંદીનો ડોલર રાખેલો. તેમ કરતાં ત્રણ ડોલર તો ચ્યગાધને ખલાસ થઈ ગયેલા.

જગતના મોટામાં મોટા સહરાના રણને ડેકાણે પહેલાં જળ હતું. શાધ્યોળ કરતાં તેના ભૂગર્ભમાંથી સ્ક્રી માછલીએ સાથેના કૂવાએ ભળી આવે છે.



## ત્રણુ કાવ્યગ્રન્થ

૧. પાંખડી—કર્તાઃ જેહાલાલ નારાયણ નિવેદી. પ્રકાશક : અચુલાઈ રાવત, કુમાર કાર્યાલય, રાયપુર; અમદાવાદ. કિંમત પાર આના.

૨. કુમારનાં કાવ્યો—લેખક : મહેન્દ્રકુમાર મોતીલાલ દેસાઈ. પ્રકાશક : એ. એ. એ. દેસાઈ, અમદાવાદ પોણ, કડવા શેરી, વડોદરા. મૂલ્ય એક રૂપિયો.

૩. મહાલસા—લેખક : ગોવિન્દ હ. પટેલ. પ્રકાશક : ગોરધનલાઈ કુશારલાઈ પટેલ, વડોદરા. કિંમત દશ આના.

જેટાં સ્વરપ કુરરતનાં છે એટલાં જ કવિતાનાં છે. કવિતા સાગરની જેમ ગર્જતી હોઈ શકે, સરિતાની જેમ ઇપેરી પટ હોડતી પણ હોય; મેધધનુષ્ણની જેમ સુરમ્ય રંગપ્રધાન હોય તો ઝરમર વર્ષતી વર્ષાની જેમ તે આહલાદક પણ હોઈ શકે; મોતીની જેમ ચમકતી હોય તો મોતીમાળાની જેમ ગૂંઘેલી પણ હોય; અમૃતબિંદુની જેમ મધુર હોય તો પુણ્ય-પાંખડીની જેમ સુગંધહોરતી પણ હોય. મેધદૂતને સહેલે મોતીની માળાની ઉપમા આપી શકાય.

એક લોક કે આછામાં આછી પક્ષિતામાં એક જ ભાવ કે દર્શનને વાળામાં મોતીની જેમ પરૈવતી, પૂજનના થાળમાં પુણ્યપાંખડીની જેમ સોહાવતી કે અમૃતબિંદુનો સ્વાદ અદ્ભુતી કવિતાને સુકૃતક કહેવાય છે. ‘પાંખડી’ એવાં સુકૃતકોનો સંયદ છે.

‘કુમારનાં કાવ્યો’માં સુકૃતકો છે; ભાવ, દર્શન કે આત્મભેદનને વિકસાવતી કે વર્ણવતી લાંબી કવિતાઓ પણ છે.

‘મહાલસા’ એ એક પૌરાણિક પ્રેમપ્રસંગનું લાવ-ચિત્રદર્શન કરાવતું સંયાંગ અને સંવાદમય કાવ્ય છે.

ત્રણુ કાવ્યસંગહોમાં આમુખ પણ ચુંઝાતાના ત્રણુ જાણીતા વિવેચકાએ લખ્યો છે. ‘પાંખડી’માં શ્રી. રામનારાયણ પાઠક, ‘કુમારનાં કાવ્યો’માં શ્રી. રમણુલાલ વંસતલાલ દેસાઈ અને ‘મહાલસા’માં શ્રી. વિષણુપ્રસાદ નિવેદી.

શ્રી રામનારાયણ પાઠક પોતાના ડથનમાં સુખ્યતે સુકૃતકનું સ્વરપ સમજાયું છે. શ્રી રમણુલાલ દેસાઈ ‘કુમારનાં કાવ્યો’ના ચુંઝુદોષ વર્ણને છે; શ્રી નિવેદી ‘મહાલસા’નું અવલોકન કરતાં સાથે રસપાન પણ કરે છે.

પ્રાચીન યુગ કવિતાને પ્રકૃતિમાં ભાંધવા ભથ્થો; અર્વાચીન યુગ તેને વિગ્નાન અને જીવનના સામાન્ય પ્રભોમાં ભાંધવા ભથ્થે છે. આ ત્રણુ કાવ્યગ્રન્થો અર્વાચીન કરતાં આચીન સ્વરપને વિશેષ પ્રમાણુમાં અનુસરે છે એટલે સંભવિત છે કે અર્વાચીન યુગ-સંપ્રદાયાઓને એ ચો઱્ય પ્રમાણુમાં ન આડ્યો; છતાં ત્રણુમાં કવિતના માધુર્યગળો ચમકાર ઓછેવધતે અંશે પણ છે જ.

આ ત્રણુ પુરતકોમાં મૌલિક ચિત્રન, રમ્ય શાખદગ્ધાંથણી, સુલલિત પ્રવાહ, ચિત્રાત્મક

દર્શન અને લાવમાધુર્ય અલભત્ત ‘પાંખડી’માં વિરોષ પ્રમાણુમાં ઝગમગે છે છતાં ખીજી એ પણ ઓછા આશારપદ નથી જણ્ણાતા.

નહેને ચોતપોતાના અથ્વ હોષે પણ છે. પણ તેમાં ‘કુમારનાં કાંબો’માં ડેટલેક ઠેકાણે તરી આવતો અર્થકલિષ્ટતાનો દ્વારા અને અનાર્કષક પ્રકાશન કંઈક વિરોષ પ્રમાણુમાં ખૂંચે છે. તે સહેને દૂર કરી રાક્ષાણાં હોત. ‘પાંખડી’નાં મુક્કાડેનો મેરો લાગ તો રસ-માધુર્ય કે ભાવનાપ્રેરક છે પણ શરીરાતનાં થોડાંકમાં કંઈક અંશે પ્રયાસ જણાય છે: કવિતા સ્વાભાવિક જર્મિનન્ય હોવી ધટે; નક્કેને છતાં છંદાંલંગ પણ કચાંક કચાંક રહી જવા પાંચ્યો છે. ‘મદાલસા’ કાંબને સંપૂર્ણ સમજવાને થોડાક સંસ્કૃત શબ્દકોરો ખરીદી લેવા જેઠાંએ. તેમાંના ડેટલાક શખ્દો તો સંસ્કૃત કે ગુજરાતી બનેમાંથી એકે લાધામાં ન મળી શકે એવા છે.

**ઉપહશસાર—**મૂળ લેખક : શ્રી રમણ મહર્ષિ. પ્રકાશક : શ્રી નિરંજનાનંદ સ્વામી, તિરુવણ્ણમલૈ, દક્ષિણ ભારત. ડિઝિટલ દોઢ આનો.

દક્ષિણે અરસણુાચલ પર્વતની તલેટીમાં શ્રી રમણમહર્ષિનો આશ્રમ છે. ત્યાં રહી તેણો જીવનનાં ગૂઢ તત્ત્વો શોધે છે, તપ અને સંયમમાં જીવન વિતાવે છે, જ્ઞાનસુઓને ભાવભર્યો ઉપહેશ આપે છે. એ ઉપહેશનાં અનેક ભાષાઓમાં ભાષાંતર થયાં છે. દાર્ઢક વનમાં રહેતા અભિમાની ઋષિઓને શિવે ઉપહેશ આપેલ; મહર્ષિએ એ ઉપહેશને રમણીય પંક્તિઓમાં વર્ણી લાખે. આ અનો ગુજરાતી અનુવાદ છે. અનુવાદકનું નામ નથી આયું પણ તે શ્રી કીર્તિશારલાલ ધ. ભશનવાળા હોવા વિરોષ સંભવ છે.

અનુવાદ જેય, મધુર અને સુવાચ્ય અન્યો છે. પાછળના લાગમાં આપેલ ટિપ્પણો અને સ્પષ્ટ અર્થ સમજવામાં મદદકર્તા થઈ પડે છે. શરીરાતમાં આપેલો શ્રી રમણમહર્ષિનો પરિચય ભાવપ્રેરક છે.

[ સ્વીકારાચલ અને ભાડીનાનો પરિચય હવે પણ ]

## સ્વીકાર

**પુસ્તક—**છત્રપતિ શિવાજિ; માનવશરીર વિકાસ; મંજરીમાળા; સંવાદ સંગ્રહ; વિહાર-દિગ્દર્શન; પુરાણાં પુણ્યો; શ્રી કુમારપાળા; હેમચંદ્ર વચ્ચનામૃત; સંસ્કૃત પ્રાચીન સ્તવન સંહોલ.


**તૈમાસિક—**દ્વાર્ધસ તૈમાસિક; જૈનસિક્ષાન્ત ભાસ્કર; કુસુમ; દેશી રાજ્ય; જૈન સિક્ષાન્ત ભાસ્કર; માનસી; માધુરી.

**માસિક—**પ્રસ્થાન; શારદા; યુવક; નવરચના; ભાલજીવન; ભાલમિત્ર; ભાગંક; હોરમ; શિક્ષણપત્રિકા; ભાલવાડી; ગાંડિવ; સ્ક્રી-ઓધ; ગુજરાત શાળાપત્ર; કમર; વેપાર ઉદ્ઘોગ; વ્યાયામ; વૈદ્યકલ્પતર; ઐતીવાડી વિજાન; દીપક; જૈન સત્ય પ્રકાશ; આત્માનંદ પ્રકાશ; કંચ્છી દશા ઓસવાળ પ્રકાશ; ગીતા; પ્રગતિ; અનાવિલ જગત; ક્ષત્રિય મિત્ર; વિશ્વવિજ્ઞાન; ગુમ સહાય; કિર્લેસ્કર; કપ્તાન; કલ્યાણ; અનેકાન્ત; New book digest; Indian Review; The Educational Review; The New Review; Radio Times.

**પાક્ષિક—**ઓસવાલ; દુન્હુભિ.

**અઠવાડિક—**પ્રગણન્દૃ; ગુજરાતી; ગુજરાતી પંચ, નૌકા; જૈન જ્યોતિ; ખીશકિત; લોકસેવા; રાજરચાન.

**અહેવાલ—**શ્રી પશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા; સુખ સંચારક ફૂપની-મધુરા.



**મહાસભાના આગેવાનો સાથેના મતબેદ પછી શ્રી સુભાષચંદ્ર બેઅએ પ્રણવિકાસની અસંક્ષિપ્ત ચોજનાઓએ હીકીડીક પ્રમાણમાં રણુ કરવા માડી છે. જગતમાં જ્યારથી પ્રગતિની શક્તિએ થઈ છે ત્યારથી સત્તાધિકારી પક્ષના વિરોધી નાયકો પ્રગતને નચુવવા હુમેશ આજ નીતિને અતુસરતા આવ્યા છે એટલે એમાં નવીનતા કંઈ નથી; પણ જ્યારે એ વિરોધના પરિણામે એવા નાયકાના હાથમાં સત્તા સોંપી હેવામાં આવી છે ત્યારે ત્યારે તે નાયકો પોતાની બિનવ્યવહાર ચોજનાઓમાંથી એકેટે અમલમાં મુડી શક્યા નથી એ વસ્તુસ્થિતિ શ્રી સુભાષચંદ્ર કંઈ તો જાણુતા નથી, જાણે છે તો હુદ્ધને છેતરે છે.**

તેઓ કહે છે : ‘દારનિષેધને હું જરૂરી માનું છું, પણ તેનાથી આનંદ તુકશાન નવા કરો નાંખીને નહીં પણ કુરેપિયનો માટે જે દાર પીવાની ધૂટ રાખવામાં આવી છે તે દાર પર વધારે કર નાંખીને વસ્તુ કરવું નેર્ઝાય... અંગેને અત્યારે સ્વાતંત્ર્ય માટે અહીનેટમ આપી હેવાનો સમય પાકી ગયો છે.’

દારનિષેધ મુંઅર્થ દ્વારાકાની પ્રગતને ગમે છે એટલે શ્રી સુભાષચાનુ એનો વિરોધ તો કરી શકતી નથી; પણ કર પ્રગતને નથી ગમતા એટલે તે દૂર કરવાની તેઓ જરૂરિયાત જણાવે છે. સ્વાતંત્ર્ય પણ પ્રગતને ગમે એટલે એનો સમય પાકી ગયો હોવાનું શર્દોમાં કહેવું એ પણ એટલું જ સહેલું ગણ્યાય. પણ એ અધું શી રીતે સંભવિત છે, માર્ગમાં શ્રી સુરક્ષાદીએ નડે એ પ્રથમ વિચારી લેલું આવશ્યક છે.

દારની જેમને માટે ધૂટ રાખવામાં આવી છે તેમના પર શક્ય કર નાંખવાની વાત ન વિચારાઈ હોઈ એમ કહેવું એ તો પ્રધાનમંડળને દેચ્છોહી, પરદેશીઓનું ભિત્ર ને દારની તરફણે કરનાર કહેવા જરૂરાય છે. પણ દારથી આવનારી નણુ-સાડાનણુ કરોડની કરને લગતી અને પચાશ લાખ લગભગની વ્યવસ્થાને લગતી—એમ ચાર કરોડની ખોટને અમૃક હજાર પરદેશીએઓ કે પરવાનાધારીઓ પૂરી કરી શકે એ શી રીતે મનાય ને એ માર્ગ લેવામાં આવે તો પણ જ્યાંસુધી હિંદ બિટનને હસ્તક છે ત્યાંસુધી એનો અમલ થઈ શક્યો શું સંભવિત છે? “દારનિષેધ, પણ કર નહીં”—એ વાત તો ડેલસો બાળ્યા સિવાય સોનાને ગાળવા જેવી છે.

છતાં એટલું અધું છે કે મુંઅર્થ સરકારે નવા કરતી જે પદ્ધતિ સ્વીકારી છે એ કરતાં એછી તુકશાનકારક ખોલ પદ્ધતિએ તેને મળી શકત. સેદ્સ-ટેક્સથી પૈસાદારોને જરીકે તુકશાન નથી આવવાનું. તે તો જિલ્લા પ્રગતની ખરીદશક્તિ ઘટાડી ગરીયોનાં કપડાની કિંમત ગોધી જનાવશે. અને પ્રોપર્ટી-ટેક્સથી પૈસાદારોને જેટલું શોષવાનું હશે એ કરતાં લાડુઆત વર્ગને અને જેમને ધંધે. નવાં મકાનોની બાંધણી સાથે સંકળાયેલો છે એવા કંડિયા-સુથાર કે મજૂર-વર્ગને વધારે શોષવું પડશે.

નવા કરો નાંખતી વખતે, હુમેશાં એ કરોથી થનાર નક્કાની ગણુતરી કરતાં, તુકશાનની ગણુતરી બમણું પ્રમાણમાં કરી લેવી નેર્ઝાયે. મોટાં શહેરોમાં ભાડાનો વધારો એહેહ વધી

## ૨૦૦ .. સુવાસ : આવણ્ય ૧૯૬૫

ગચ્છે છે એ જાણીતો વાત છે. એને કાપદાપૂર્વક ઘટાડવાળી વાત પણ ચર્ચાઈ રહી છે. આમે પ્રોપર્ટી-ટેક્ષ અને ભાડાનો ઘટાડો અનેના પરિણામે, પૈસાદારો નવાં મકાનો બાંધવાને બદલે પોતાની મૂડીને બેંકામાં સલામત રાખવી વધારે લાલદારી ગણુશે. પરિણામે ને મૂડી હરતી ફરતી અને વહેચાતી રહેત તે સ્થિર અની, દેશી સરકારને મદદકર્તા અનવાને બદલે જીલદી પ્રજાના વ્યવસાય પર કાપ મુક્શે ને એડા કે લોનેના વ્યાજના દર ઘટાડવામાં મદદકર્તા થઈ પણે.


ભાડાના વધારાનાં અનેક કારણોમાંનું એક મુખ્ય કારણ એ પણ છે કે પ્રજા જેટલા પ્રમાણમાં શહેરો બાળું ધસી રહી છે એટલા પ્રમાણમાં ત્યાં મકાનો ન હોઈ જેણો વધારે ભાડાં આપવાને તત્પર અને છે તેમને જ ભાડાનાં મકાનો મળી શક છે. એટલે ઉપરના અંતે કાપદાઓના પરિણામે નવાં મકાનો બધાતાં જે અઠકી ગયાં તો પ્રજા કંગાલ ગામડાઓમાં પાછી નહિ ફરતી રહે, પણ ગુમ રીતે પણ વધારે ભાડાં આપવાને તૈયાર અની શહેરમાં વસવાની હરીકાઈ આદરશે.

આને બદલે પ્રોપર્ટી-ટેક્ષમાંથી જે ભાડાનાં મકાનોને બાહુ કરવામાં આવે તો પૈસાદારોને એવાં મકાનો બાંધવાને ઉત્તેજન મળે, એની હરીકાઈના પરિણામે ભાડાં સ્વાભાવિક રીતે ઘટી જથ્ય, એ હરીકાઈ મકાનોને પણ સારાં અને સ્વચ્છ અનાવવામાં મદદકર્તા થઈ પડે, મૂડી ફરતી રહે, ધંધી ભાવલો રહી પ્રજાની અરીશાક્ષિત ટકાવી રાણે, સરકારને જમીનનું સારું વેચાણું થાય અને સરકારી કાગળિયાં કે એડામાં પડી રહેતી મૂડી ધૂલિકાની સ્થાવર મિલકતમાં વધારે કરી પ્રજાના ધન તરફે વહેચાઈ જથ્ય.

આ ઉપરાંત પ્રજાનો કાર્નિંગ્રેમ વિકસાવી આવકને ડેટલાક સ્વૈચ્છક માર્ગ પણ વધારી રહ્યાન્ન. પ્રગતનો પૈસાદાર કે સેવકની દાઢાંધીમાં ડેટલો સહકાર આપવાને તૈયાર છે એની માગણી કરવામાં આવે ને ને પૈસાદારો અભુક રોડડ કે વાર્ષિક મદદ આપવાને તૈયાર થાય કે ને સેવકા દાઢને દૂર કરવામાં પોતાનું છુફન વીતાવવા તૈયાર હોય એવાંને, તેમણે કરેલી કે કખૂલેલી આર્થિક કે સેવાવિવિષ્યક મદહની ફરત તરફે, તે તે મદહના પ્રમાણમાં, ‘હૈત્યદુસ્મન, હૈત્યવિક્રેતા કે હૈત્યવિક્રમ’ જેવા ચુક્કિતર ક્રાટિના ધૂલિકાંનો આપવામાં આવે. આ ધૂલિકાંનો માનમરતશ્ચે સરકારની સત્તામાં હોય એટલે દરજને વધારેમાં વધારે સન્માનનીય અને ક્રીતિવંત અનાવવો. જે આનું યોગ્ય સ્વરૂપ ઘડવામાં આવે તો આ પ્રયોગ જરીક નિષ્પળ જરૂર સંભવ નથી. જેલટો તે ચાલુ ધૂલિકાંનો તરફની પ્રોત્િને પોતાના તરફ એંચરો, અને દ્રષ્ટ સાથે લાવનાને પણ એંચી લાવશે.

આ ઉપરાંત સમૃદ્ધિસંપત્ત નિર્વિશલેની ગમે તેના હાથમાં જઈ પડતી સંપત્તિ, સટો કે લખલૂટ જંગમ મિલકતો-તેના પર કર કે તે સંખ્યામાં કંઈક કાયદેસર યોગ્ય વ્યવસ્થા આખી પ્રાપ્ત ભારેન્ય નહિ થઈ પડે.

ને શી એજન્ટનું અલ્ટોમેટમ—થિટનનું પ્રધાનમંડળ જ્યાંસુધી અનિતશિરોમણીએનું ન અને સાંસુધી, એકસંપ્ર લશકરી પીઠણી કે ડોઝક રાજ્યારી યુક્તિ વિના એ ડોઝને દાદ હે એમ નથી. હોઝન-પ્રદેશમાં જર્ભનદૃપસુંહરીઓનાં જ્યારે હયસી જૈનિકાને હાથે શિયળ લુંટાં હતાં ત્યારે મહાન હીન્દનાર્ગની વિનંતિઓ કે પ્રભાવની આખા યુરોપમાં ડોઝએ પરવા પણ ન કરેલી. પણ આને હીન્દનાર્ગના શિષ્યને ચરણે ઠળાય છે, કેમકે તેણે સંયોગ સન્યાર્થી છે, બણે એકસંપ્ર ને વ્યવસ્થિત અનાધ્ય છે.



**કલા-સંસ્કૃતિ-ધ્વાકાર શ્રી. યજ્ઞાચીર કુશલનાં છિટાલિ સંતમાન હેઠે.** [ હેઠે હિંદુ પણ કરો. ] ક્રીસ્ટાની સરકારે જાહેર અની જગ્યેલી સાહિત્યસ્કૃતિઓના પ્રકાશન પર કર નાખી તેમાંથી ગરીબ લેખકોને મહેં ધરવાનું ડેરોયું છે. સર રાધાકૃષ્ણા ખિટિશ-એડિટરીના ફેઝો તરીકે ચૂંચાયા છે. અલ્લીગાંધી સુનીવર્સોર્ટીએ બનાઈ રોં અને એચ. લી. નેલસનના પુસ્તકોને પોતાના અન્યાંયમાંથી અહીં કઢાની નાંખ્યાં છે. સુકુલ એદું ગોઠન ફેન્ચ ખુલ્લી મુક્કાતા ભા. સુનશીએ ફેન્ચ-સાહિત્યને આપેલી અનન્દિતિ, હિમાલય-આરોહણમાં એ પોતાંડવાસીઓનું મૃત્યુ. સરસું, સાહું ને સલામતીઓરેલું વિમાન અનાવવા માટે ફેન્ચ સરકારે જાહેર કરેલું નીરા લાખ સ્ટેન્ડનું ધનામ. શેડઅનાંતીલાલ પોદારી મુખ્યમંડળ આયુર્વેહિક કુલેન/ના મકાન ને હોસ્પિટલ માટે કરેલું સાડાત્રણું લાખનું દાન. કુમારી શાન્તા આપેના પ્રકાત-શીટમ કંપની સામે ઉપવાસ. [ રામભાણું ઈલાજ ! ] ને ઉપવાસ છોડયા છતો એટેલોં તંગ મામદો. [ રામનું આણ પણ એક વખત તો નિષ્ઠળ ગયું હતું ને ! ] હિંદુથી દર અદવારિએ જ્યું લાખ લગભગનું રોટું પરદેશ ચઢે છે. [ હિંદુ એટેલો જ કામથેતું છે ને ? ] મહાત્માજી બિમાર ડાંડિ ખખરદારની સુલાકાત દ્યે છે. હુક્કે વસનાં માધવણ વ્યાખ્યાનમાળામાં કલિશી અખરદારનું વ્યાખ્યાન ગોઠવાયું છે. એકસફર્ડ ચુની-વર્સીએ નાખીતા હાસ્યદેખક પી. લ. લુંડાંડસને ડેકટર એદું લીટરેચરની પહી આપી છે. જગત-પુસ્તકમંડળે જાહેરન રેન્ડનેને એપ્સ એદું 'રોથ' નામણી નવલકથા—જેના શીમહદ્દ માટે લેખકને ડેરોંદું ડોલર આપવામાં આવ્યા છે—ને એગસ્ટ માસના રસિક પુસ્તક તરીકે જાહેર કરી છે. ઈંગ્લાંડમાં વાષ્પિક ગર્ભપાતની સરેરાસ દોટ લાખની આવી છે; ક્રાંતસ સ્વરૂપતી સ્વીચ્છાનું સંઅહસ્યાન પોતાનાર છે. [ પાથીત્ય સંસ્કૃતિનાં અને વિકાસચિન્હો છે. ] બસીર-આસામમાં કોલસા ને લોખાંડની નવી આણ્ણે. મળી આવી છે. [ હિંદનું આખર્યું વધ્યું. ]

**દેશ—પંલબના હિંદુ પ્રસ્તિયોના સમાજે લે યુદ્ધ આવી પડે તો ખિંનને ચરણે પોતાની સેવા પહેલેથી જ ધરી હેવાનો ડરાવ પસાર હોયો છે. [ ધર્મભાન્ધવતા તે આનું નામ—એક ગાડે તમારો પડે તો બીજે આગળ ધરવાનો હપહેશ હેનાર ભગવાન ઈશુને પણ આકાશમાંથી પુણ્ય વેરવાનું મન થાય એચી. ] શ્રી. સુભાષયંદ્ર એઝે મહાસભાના શિસ્તના નિયમન સામે દર્શાવેલો દેશવ્યાપી વિરોધ [ સિવાય દેશમાં બીજું છે પણ શું શું ? ] મુખ્ય-સરકારના આકરા કરે સામે શ્રી. સુભાષનો ચેકાર. [ ચેકાર ધયી વખત પુણ્યોની ગરજ સારે છે. ] મહાસભાલું સુભાષનાનું પલટાયલ વર્તન સંખ્યમાં દાખવેલો એદ. મહાત્માજીને લાગે છે કે પ્રજાએ હણું સ્વેચ્છિક સ્વરૂપે અગરથી શુદ્ધ અહિસાને અપનાવી નથી. [ મનુથી મારીને ચાણુકય અને કાલિકાર્યથી મારીને હેલ્યાંડ્રાચાર્ય સુધીના દરેકને એમજ લાગેલું. ] અંગાળના ડીલીયોના ઉપવાસ. દેશભરમાં તેમના ઈટકારા માટે ચણવળ. મહાત્માજી તેઓના ઉપવાસ સંખ્યમાં કરે છે, 'ભૂખમરાની લડત અયોગ છે.' સરકાર ઉપવાસ છોડ્યા પહેલાં ઈટકારાનો. પ્રશ્ન હૃદાય ધરવાની ના કરે છે. છેવટે યોગયુંયોના આશહ અને બાંધખરીથી ઉપવાસ મુખતલી રખાયા છે. સિદોનમાં હિંદીયોના હાડમારીયોના નિકાલ આણવાને પંડિત જવાહરલાલ સિદોનની સુલાકાતો. પણ સિદોન હિંદીયોને ધૂતકારવામાં મક્કમ છે. [ જોા સંસ્થાનવાહની ખૂભીજ એ છે—કે જે પ્રદેશને સંસ્થાનના હિંય સ્વાતંત્ર્યહુક આપવામાં આવે ત્યાંની પ્રેલ પોતાના મૂળ સંસ્કાર વીસરી ગદ્ય હોય છે એટલું જ નહિ પણ જોાયોને આણવન સ્વામીને મિત્ર ભાઈ કોડી ને**

## ૧૦૨ .. સુવાસ : શ્રાવણ ૧૯૬૫

સંસ્કારનો સંબંધ ધરાવતી યુગલૂની મિત્રપ્રેણઓને તરછેડવાને પણ તે તત્ત્વ અનેલી હોય છે. નેણ્યારે તે એવી અને છે ત્યારે જ તે સંસ્થાનને લાયક કોઈ હોય છે.] ઈજાંડની ઉમરાવસભામે ખોડ્ય સિંહાનો ઉમરાવહક સ્વીકાર્યો છે. [ ભવિષ્યમાં કામ લાગશે.] ટ્રાન્સવાલ—સત્યાગ્રહ મુલાકીની રહ્યો છે. કાંચી—કોલેજમાં હડતાળ ને લાડીમાર. [ યુદ્ધના મેદાનો સુમસામ જેઈ હિસાડેવીએ સંસ્કાર અને સરસ્વતી—મંહિરોનો આભય લીધો લાગે છે.] હિંદને સુસલમાની અમલમાં લાવવા આકસ્માત ચ્યાળવણ આગળ વધે છે. [ એ બિલ્દીએ ન લડે તો બંદરને મળે શી રીતે ?] દિલ્હીએ ટ્રામ-હડતાળ, અમદાવાદની ડેટલીડ રિક્ષણ-સંસ્થાઓને પર્સિનેહ કડવા લાગે છે. [ એમ ન થાય તો પ્રિસ્ટીએ સમાન સામાનિક દરાને મળી પણ શી રીતે શકે ?] ચરેદા-નેસમાં તોફાન, રાન મહેન્દ્રપ્રતાપને હિંદ આવવાની અનુમતિ નથી મળતી. [ હિંદ હિંદીએનું નથી એ વાત કંઈ નવી નથી.] સર હોરમસણ એડનવાળાનું અવસાન, મેવાડના એક જેન શ્રીમન્તે ચેતાના પુત્રને પ્રિસ્ટી અનનો આટકાવનારને માટે પણ હન્દરતું છનામ નાહેર કર્યું છે. [ પ્રિસ્ટી પ્રચારકોને હિંદુએની શક્તિનું માપ કાઢવાનો અવકાશ મળશે.] મુણીએમાં તિલકનાંયંતિ ને શરાબધારીના મંગલાચરણ. હિંદી મીલદ્યોગ પર ઝડપત્રી લખ; ગીતોને અડવાયિયામાં પણ હિવસ બંધ રાખવાની વિચારાતી ચેતના; [ મલ્લરોને અને એમના કુંકુંમને બણે હિવસ કખવાસ કરી પવિત્ર અનવાનો અવકાશ મળશે.] હિંદી લશ્કર મલાયા ને કરો જરો. [ તદ્દન સ્વાભાવિક !] સમવાયતંત્રની અનુકૂળતા માટે વડી ધરાવસભાની મુદ્રત ફીરી એક વર્ષ માટે લંઘાણી છે. [ પ્રાનિકંતન્ન સામેના ભખાળા એમ ગોલા હતા એમ સમવાયતંત્ર સામેના ભખાળા પણ પ્રિસ્ટને એવાજ લાગે છે.] મુણીએમાં સામાન્ય હૃદ્યાંદ અને શાન્તિ. શુભરાતમાં દુષ્ટાનો ઉચ્ચ અનનો લખ. [ રાન કાલસ્ય કારણ્યમું ].

હેઠી રાજણ્ય—સાયાવદરાન દરબાર પદભ્રષ્ટ થાય છે. [ હાંદરો પણ એવોને સરવા દઈને પણીજ તેના પર વાદકાય કરે છે.] રાજકોટમાં ચાર નવી આંગનરત્નિકાયો. [ ધનભાગ્ય !] વીરાવાળા દેણ મેળવવા મેટે દોડાહોડ કરે છે. [ એ પણ ધનભાગ્ય !] લાણુંબાડા રાજ્યમાં એકૂંતો પર ઇમન. ભરતપુરમાં ઓઝો સત્યાગ્રહે પણે. ધર્મની નાયક નાગવા આવતી પ્રેણ પર જોળિભાર [ નાયના મહિર બંધ થતાં શયતાનાં ખૂલે એ સ્વાભાવિક છે.] રાનએ વાંનયાદમસ ચેતવણી આપે છે. [ સમય પાડ્યો હરો.] હૈદ્રાબાદમાં સુધારા; લીલીના ચુવરાજ કરે છે, ‘સ્વાતંત્ર્ય એ તો પ્રેણનો જરૂરિસ્ક હક્ક છે. [ બંને સમાન તુસ્થા છે.] હૈદ્રાબાદના સુધારા સામે ત્યાંની સુસલમાન પ્રેણનો વિરોધ. [ અંગેજ વ્યાપરીઓ પણ હિંદને આપી હેવાયેલા સ્વરૂપ્યનોં વિરોધ કરે છે.] પતિયાણ નેસમાં ૨૦૦ કેદીએના ઉપવાસ.

પરહેણા—દેન્યીએનો તંત્ર અનનો માભલો. [ હળાહળ સ્વાર્થની અયદામણો એવીજ હોય છે.] ચીન-નાપાનમાં પ્રિસ્ટનિચિરોધી હેખાનો. દીન્યનીન સંબંધમાં બિંદેને સ્નીપારી લીધેલી નાપાની ચરતો; પણ પણી એવીજ હુચ પરિસ્થિતિ. ચીન-નાપાન યુદ્ધની શરીરાતથી આજસુધીમાં સ્વાનંક લાખ લાપાનીઓ યુદ્ધભૂમિ પર સૂતા. કાઉન્ટ સિયાનો સ્પેનની સુલાક્ષણે. સ્પેન-ઈટલિની મિત્રતામાં થતો જતો વધારે. આચરિણ રીપલ્સકનોએ લંડનમાં ચલાવેલા ધૂમરધાકા. [ તે માટે નાણાંની મહદુદ એમને પ્રિસ્ટના મિત્ર અમેરિકામાંથી અણે છે !] ચીનાઈ ટાલરની ડિમતમાં ઘયારો. [ એ પણ નાપાનો એક વિનયન છે !] એંગ્લો-ફેન્સ-રચિયન સુલાક્ષણે નાયા કરતો ચાલુ અપશુકનો. એક અથન ચેંડ આખીને પણ પ્રિસ્ટન કદાચ જર્મનીની રીતની રીતનાં સુધીની સાથે નવા બેપારી કરાર કરી વળતર મેળવી લ્યે છે. સેવિયેટ ચીનને પણ કરોટ પાણની લોન આપે છે. [ અડાણુંબટમાં શું લેવાયું છે એ પણ સાથી નાહેર કરું નેતીરું હતું.] અમેરિકાના માણ પ્રમુખ હુવર વર્ટમાન-પ્રમુખ ઇચ્ચેદાની નિતિને વખોડી કાઢે છે; ત્યાંની પ્રતિનિધિ—સ્ક્રીપ્ટના લેન્ટીંગ બિલ પર વિચાર ચલાવવાની પણ ના પાડે છે.